

# સૌરાષ્ટ્રને તીરે તીરે

આવૃત્તિઓ

પહેલી 1933, બીજી 1943

‘સૌરાષ્ટ્રનાં ખંડરોમાં’ સાથે સંયુક્ત આવૃત્તિ 1956

ચોથી 1980, પુનર્મુદ્રણ 1994

સમગ્ર મેધાંડી સાહિત્યના ગ્રંથ ‘લોકસાહિત્યનાં શોધન-ભમજા’માં 2015

## કુમ

પ્રવારીઓને                                    73

1. ચાંચની ખાડીમાં.....	77
2. ચેલેયાની જન્મભોમ .....	85
3. ફૂકુંફૂ.....	90
4. દરિયાનાં દેવદેવીઓ .....	93
5. 'મોતી બૂડું મોરણી'	97
6. એક-બે ભજનો .....	102
7. વરલની રાત .....	107
8. હે... અહ્લા!	111
9. 'પીપા સીતા રેન અપારા!'	115
10. નાવિકોનાં લોકગીતો .....	119
11. બષ ગીતો?	131
12. વિદાય .....	136
13. મા!	144

## પ્રવાસીઓને

‘અમારે સૌરાષ્ટ્ર જોવો છે. શી રીતે જોઈએ?’

‘તમારી ચોપડીઓએ અમને સોરઠ દેશની મુસાફરી કરવાની તાલાવેલી જગાડી છે, અમે ક્યાં ક્યાં જઈએ તે સૂચવશો?’

‘તમે સંઘરેલાં લોકગીતો અમારે લોકોને માંયે સાંભળવાં છે, રાસડા રમાતા જોવા છે, ચારણોની વાર્તાઓ માણવી છે, ગીર જોવી છે, સિંહો જોવા છે, માટે કોઈ ભોમિયો આપો, અથવા સાથે આવો!’

નિશાળો-કોલેજેની લાંબી રજાઓ પડવાની થાય ત્યારેત્યારે ઓળખીતા અને અણાઓળખીતા કોઈ કોઈ તરફથી આવાં પુછાણ આવી પડે છે. પરંતુ એ બધાંની અંદર એક-બે શર્તો મુકાયેલી હોય છે :

‘આ બધું અમારે તા. 10મીથી 17મી સુધીમાં જોઈ લેવું છે.’

‘આ બધું જોવા માટે અમારી સાથે પંદર નાનાંમોટાં બાળકો, ત્રણ બહેનો ને સાતું ભાઈઓ છે.’

જુદી જુદી નાજુક ખાસિયતોવાળા એવા માનવમેળાને સૌરાષ્ટ્રનાં સાહિત્ય, સંસ્કાર, પુરાતનતા વગેરે બધું જ એકસામટું ‘કન્નેન્સ્ડ મિલ્ક’ના ડબ્બામાં ઠાંસેલું જોઈએ છે. દિવસે દિવસનો તેઓ કાર્યક્રમ માગે છે. એવું દર્શન કરાવવું અતિ કઠિન છે.

આવનારાંની ઉત્સુકતા સાચા હૃદયની હોય છે. અંતઃકરણમાં સોરઠ પ્રત્યે જિજ્ઞાસા જન્મી હોય છે, થોડું નિહાળીને પણ ઘણું પકડી લે તેવી દિલસોજ અને પૂજુક આંખો હોય છે, પરંતુ તેમને વખત નથી. એટલે તેઓને તમામ રાંધેલી વાનીઓ મેજ પર અમુક કલાકને ટકોરે પીરસેલી જોઈએ છે. અક્કેક વેકેશનમાં ફક્ત એક ચોક્કસ ક્ષેત્ર જ નથી જોવું, બધું સામટું જોઈ કાઢવું છે.

- ને સૌરાષ્ટ્રની આગગાડીઓ હવે તો એ રીતનું રાંધજું રાંધી પિરસી દેવાને તૈયાર થઈ ગઈ છે. પંદર કે પચીસ પ્રવાસીઓનું ટોળું સડસડાટ પોરબંદર, વેરાવળ, નવાનગર (જામનગર) અને ભાવનગર જેવાં બબ્બે સ્થળો એકેક દિવસમાં પતાવી, મુકરર તારીખે પાછું વળી શકે છે. પરંતુ આ પ્રવાસો કેવળ ‘સાઈટ-સીંગ’માં જ પરિણામે છે. સૌરાષ્ટ્ર જોઈ આવ્યાના ઉપલક સંતોષની નીચે તે બધાં ભાઈ-બહેનોનાં હૃદયમાં એક શૂન્યતાની લાગળી વહેતી હોય છે.

બીજી રીતે વિચારીએ તો આમાં પ્રવાસીઓનો દોષ પણ શો? આજે જાણવા-જોવાનાં સોરઠને તીરે તીરે : પ્રવાસીઓને

ક્ષેત્રો ખૂબ વધ્યાં છે. એકલો સોંન જાયેથી જ કંઈ ચાલ નહીં. શાનની, દર્શનની, વિવિધતાની ભૂખ આજ ઉધડી છે.

આ કારણે, જે માણસો અમુક ચોક્કસ ક્ષેત્ર લઈને તેની પાછળ બેરી ગયા હોય છે તેમનું જ એ કર્તવ્ય છે કે પોતાના ક્ષેત્રનું દર્શન પોતે કરી, લખી, એનો માનસિક સમાગમ સહુ લોકોને કરાવવો. એ કર્તવ્ય સમજાને હું પણ સોરઠના મારા નાનકડા પ્રવાસોનાં ચિત્રો દોડું છું.

માત્ર કુદરતના પ્રેમીજનો જે હશે તેને તો સોરઠની બહાર સ્થળે સ્થળે પ્રકૃતિ-સૌંદર્ય મળી રહેશે.

માત્ર લજ્જતથી ભટકવાને જ નીકળનારાઓ સારુ પણ આંહીં કશી આવિકતા નથી.

શિલ્પસ્થાપત્રકલાના પણ કોઈ અદ્ભુત અવશેષો આંહીં નથી પડચા.

માત્ર પુરાતનતાના આશકો-શોધકોને પણ બીજાં અનેક વધુ રસદાયક ખંડેરો જડી રહેશે.

સૌરાષ્ટ્રનાં સ્થાનોમાં જે રસ વહે છે તે તેની સાથે અંકિત થયેલા ઈતિહાસનો, લોકકથાઓનો, જાતિઓની જૂની તવારીખોનો અને ગીતકવિતાના સાહિત્યનો મિશ્ર રસ છે. એટલે કે દરેક સ્થળે બાળેલા સોરઠી લોકસમૂહના સંસ્કાર-પોપડા આપણને ઉત્કૃષ્ટ બનાવી શકે તો જ એનો રસ છે.

અમુક પહડાડ, ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી : એને દીઠ્યે મારા જેવાનો પ્રાણ થનગાની ઊઠે, કેમ કે મારી સ્મૃતિમાં સંઘરાયેલાં એનાં પુરાતન ઈતિહાસ-સ્મરણો તત્ખાણ સણગવા લાગે છે. બીજાને એ જ સ્થળોનો કે માનવીઓનો કશોય મહિમા ન લાગે.

એટલા સારુ જ મારા પ્રવાસનું વૃત્તાંત મારી અમુક ઊર્ભિઓ થકી રંગાયેલું છે. આ ભૂમિને હું અમુક વિશિષ્ટ પ્રકારના સાહિત્ય, કુલાચાર, ખાસિયતો અને શરીરો નિપઞ્ચાવનારી માનું છું. માટે જ નાની નાની વાતોમાંથી પણ હું એ સંસ્કારનું ઘડતર બતાવવા મથું છું.

સોરઠી ગીતકથાઓનાં જન્મસ્થાન કયાં છે? એ વાળીનો ગર્ભ ધરનારી ભોમ કઈ છે? એનો ઉત્તર કવિ સ્કોટ આપી ગયો છે :

“એ કવિતાનાં બેસ્ટાં તો છે કોઈ એકલ હુંગરાના ધુમ્મસઘેરા શિખર ઉપર; ને એ સાહિત્યનો અવાજ તો ઊઠે છે પહાડી ઝરણાંના કલકલ ધ્વનિમાંથી. એનો સાર્યો આશક જે હોય તેણે કુંજનિંજોથી ભરપૂર રસાળ જીડાના કરતાં ઊજ્જવ ખડકને અધિક ચાહવો પડશે, અને રાજ્યદરબારી રંગરાગનાં ભુવનો કરતાં વિશેષ તો નિર્જન રણપ્રદેશની મોહબ્બત કેળવવી પડશે.”<sup>1</sup>

<sup>1</sup> ‘The seat of the Celtic muse is in the mist of the secret and solitary hill, and her voice in the murmur of the mountain-stream. He who woos her, must love the barren rock more than the fertile valley, and the solitude of the desert better than the festivity of the hall.’

સ્કોટલેન્ડની પુરાતન લોક કવિતાને સમજવા મથનાર એક અંગેજ અમૃતુને એની છે. સ્કોટીશ પ્રેયસીએ કહેલું આ વચન સોરઠી કાવ્ય-ઇતિહાસને સમજવાની ખરી ચાવી આપે છે. સોરઠી ખલાસીઓ અને ગોવાળીઓનાં ગાન બાગબળીચામાં નથી રોપ્યાં. એની છ્યારીઓ તો પડી છે ભયંકર ભેંસલા ખડકની ટોચે, નાંદીવેલાના નિર્જળ તપ્ત ભાલ ઉપર, રોજ ઉનાણે દણણપણણની રમતો રમતા રેતીના દુંગરાઓની ગોદમાં.

દરેક પ્રદેશને પોતપોતાનો એક મુકરર આત્મા (સ્પિરિટ) હોય છે. એની સંગાથે એકાકાર ન થઈ શકનાર પ્રવાસીને એ બધું નર્યા પથ્થરો, પાણી, ધૂળ અને ધૂળ થકીય બદતર માનવ-માળખાંથી જ ભરેલું એક સ્થાન દેખાય.

પણ આત્મા પકડનારને માટે તો જરૂરનું છે કે દિવસોના દિવસો સુધી, બસ, જંખના જ એકઠી કર્યા કરવી : કારાગારમાંથી નાસનાર કેદીની પેઠ ઘરનાં સુખસરગવડ અને કુટુંબમોહમાંથી નાસી છૂટવું : રેલગાડી જે છેલ્લા બિન્દુ સુધી લઈ જાય ત્યાંથી તો સાચી મુસાફરીનો આરંભ સમજવો. ટ્યાલના કાગળો જ્યાં નથી પહોંચતા, પાણી જ્યાં કોઈ ખારવાની કાટ મારી ગયેલ ગાગરમાંનું કચરે ભરેલું, પહેરણની ચાળ વડે ગાળીને પીવું પડે છે, સૂવાને સારુ જ્યાં એના મહિનાઓના વણન્ધાયા શરીર સાથે ઘસાઈને બિછાનું પડે છે, એના દારુંગાંજાની સોડમો જ્યાં શાસેશાસે પેટમાં ઉતારવી રહે છે, એના કરવું પડે છે, એના દારુંગાંજાની સોડમો જ્યાં શાસેશાસે પેટમાં ઉતારવી રહે છે, એના રોટલાથી જ જ્યાં જઠર ભરવું પડે છે, ત્યાં ત્યાં, તેવી હાલતમાં એક્કેક અઠવાડિયું દટાઈ રહેવાની જ જ્યાં જઠર ભરવું પડે છે, એના કંઠનું સાહિત્ય કઢાવવા માટે એની જોડે કાલાઘેલા બનવું પડે, એનાં રહેવું પડે, એના કંઠનું સાહિત્ય કઢાવવા માટે એની જોડે કાલાઘેલા બનવું પડે, એનાં આંસુઓમાં આંસુ અને એના હાસ્યમાં હાસ્ય મેળવવાં પડે, તે પછી જ સાચો ‘પ્રાણ’ જડવા માંડે છે.

પાંચ વર્ષ પર મારા એક પ્રવાસનું વર્ણન ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં : ગીરનું પરિભ્રમણ’ લખાયું ને તે ખૂબ આદર પામ્યું હતું. તે વખતે સંકલ્પ જ્ઞાન્યોહો હતો કે એવા લિન્નલિન્ન પ્રદેશો ભર્મીને – ખાસ કરીને સોરઠનો સાગરતીર અવલોકીને – એ જ શૈલીએ પ્રવાસ વર્ણવીશ. આજ મારા એક સપ્તાહનો પ્રથમ યાત્રા-પરિયય આપી શકું છું. આગળ પ્રવાસ ચાલુ છે.

એક્કેક અઠવાડિયાનો પ્રવાસ એટલે તો પાણીમાં કોશિયો ઠેકડો મારવા સમાન. વાવકૂવાનાં મંડાણો પરથી પોતાનાં શરીરોનો સીધો કોશિયો ઘા કરતા જળશોખીન જુવાનો જોયા હશે. એનાં કલેવરો પાણીની આરપાર પરોવાઈ જઈને તળિયેથી ગાળની મુહી ભરી આવે છે. તમ્મર આવે એટલી ઊંચાઈએથી તેઓ આંખો મીંચીને એક જ ઠેકાણે ઝંપલાવે છે. એટલે જ તેઓ તાગ લઈ પાંચા આવે છે. એ જ મિસાલે મારા કોશિયા-પ્રવાસમાંથી મળેલી તાગની મુહી આંહીં ધરું છું. મહુવા-કતપરથી લઈ ચાંચ-શિયાળની ટૂંકી સાગરપણી પૂરતો જ સંઘરો છે. આખો સાગર-તીર તો એવી પચીસ ખેપો માગશે. પહેલી યાત્રા તો માત્ર વાતાવરણ જ પકડવા આપે છે.

પ્રવાસનાં વર્ણનો, મેં પૂર્વ લખ્યું હતું તેમ, વ્યવસ્થિત ભૂગોળ નથી, કે સમજ વા

સાહિત્યનું બ્યવાનેચત વિવેચન નથી. છતાં તે આ તમામ તત્ત્વોનો મનસ્વી સમૃદ્ધ્ય છે : ચિત્રકારની સુરેખ રંગપૂરણી જેવો નહીં પણ સાંજસવારના આકાશમાં રેલાતી તીખી અને મીઠી અસ્તવ્યસ્ત રંગરેખાઓ સરીખો : અસ્તવ્યસ્ત અને તરંગી એ જ એની પદ્ધતિ છે.

સૌરાષ્ટ્રની રેલગાડીમાં અથડાતા-પીટાતા અથવા ઊંચા વર્ગના ડબામાં કોઈ સંગપથી વિના કંટાળો અનુભવતાં પ્રવાસી ભાઈ કે બહેન ! તમારા એકાઉ બે કલાકોને આ વર્ણન શુદ્ધ દિલારામ દઈ શકે, સૌરાષ્ટ્ર વિશે તમારામાં થોડો રસ, થોડું ક્રૈટુક ઉત્પન્ન કરી શકે, અને એ ક્ષણિક લહેરમાંથી આ પ્રદેશની પૂરી ઓળખાણ કરવાની ઉત્કઠ જગાડી શકે, તો પ્રવાસી પોતે બગાડેલાં શાહી-કાગળની તેમ જ તમે ખરચેલા પૈસાની જફળતા સમજજો. વધુ ધારણા રાખી નથી.

ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ વગેરે આજે જુદાં જુદાં ચોગઠામાં ગોઠવીને શીખવાય છે. એ પદ્ધતિએ શીખનારાઓને પોતાના વતન પર ખરી મમતા નથી ચોંટતી. પ્રવાસ વર્ણન એ સર્વનું એકીકરણ કરીને, તેમ જ થોડા અંગત ઉદ્ગારોની પાંછી ફેરવીને તરિત ગતિએ વાચકોને પોતાની પ્રવાસભૂમિ પર પચરંગી મનોવિષાર કરાવે છે. પાઠેય-પુસ્તકોની એ ઊંણપ પૂરવામાં આ યાત્રા વર્ણન શાળાઓના યુવાન દોસ્તોને મદદગાર થાય એ એક ખાસ દસ્તિ છે.

નાવિકોનાં લોકગીતો મને નવાં જ લાઘેલ છે. આ પંદર-સોળ તો એક જ બેઠકમાંથી પ્રાપ્ત થયાં છે, તે પરથી મારી ધારણા છે કે હજુ બીજાં ધણાં – સ્ત્રીઓ ઉપરાંત પુરુષોને પણ પોતાની દરિયાઈ ખેપોમાં ગાવાનાં – હાથ લાગશે.

સાગર-તીરે પ્રવાસ કરવાની ધણા સમયની સંધરાયેલી ઇચ્છાને એકાએક જગ્રત કરનાર બે બળો આવી પડ્યાં : એક તો શ્રી ‘સુકાની’ નામના સિદ્ધહસ્ત લેખકની દોરેલી લાક્ષણિક દરિયાઈ વાર્તાઓ; ને બીજું વધુ ઉત્તેજક, શ્રી ગુજાવંતરાય આચાર્યની રોમાંચક ‘સોરઠી સાગરકથાઓ’ !

## ચાંચની ખાડીમાં

આગાડી દરિયાકંઠે ઉપાડી જઈ શકે તેટલા ઓછામાં ઓછા - એટલે કે અઢાર કલાકના - ગાળામાં મન સાથે મહાસાગરની કડી પરોવવા હું મથી રહ્યો હતો. પ્રભાતે જ્યારે ગાડીના પાઠ અટકીને ઊભા રહી ગયા ત્યારે પોર્ટ આલ્બર્ટ વિક્ટરના જુનવાડી બની ગયેલ બંદર ઉપર હું ઊભો હતો. મારી સામે લાંબી એક દરિયાપણી ખાડીને રૂપે પડી હતી. સામે કુંઠે 'ચાંચ' નામનો એક ધરતીનો ફાંટો ડાબા હાથ તરફની ભૂમિમાંથી લીર છૂટી પડી ગઈ હોય તે રીતે બે ગાઉની લંબાઈમાં પડ્યો હતો. અથવા જાડો કે ચીભડું ફસ્કાઈ પડજું હોય, ને એક ચીર આખા ફળમાંથી અળગી બની હોય એવું એ દશ્ય છે. મોટા દરિયાનાં પાણી એક ગાઉ દૂરથી ઠલવાઈને આ લાંબી નાળીમાં જ્યારે જુવાળ ચડાવે છે ત્યારે મહુવા, નવસારી, સૂરત અને મુંબઈ મલબારનાં નાનાંમોટાં દેશી વહાણો અંદર ચાલ્યાં આવે છે. માતાના પેટ-શી સલામત ખાડી તે જહુજોને સમથળ નીરમાં સેરવતી સેરવતી, શ્રી મહાદેવ દેસાઈએ એક વાર લખેલું તેમ હીરના દોરામાં મોતીડાં પરોવતી પરોવતી, જાડો કે ધરતી ખોળે ઉઠાવી આવે છે.

દરિયા અને પૃથ્વીનાં આલિંગનોને દર પૂનમે અને અમાસે પોતાના હૈયા પર ઊજવતી આ ખારાની જમીનમાં શું શું દફનાયું છે? એક તો ત્રીસ વર્ષ ઉપર આંહીં મરણ પામેલ ભાવનગર રાજ્યના અંગ્રેજ ઇજનેર સીમ્સ સાહેબનું કલેવર, ને બીજું એ બાહોશ ઇજનેરનું મહાન સ્વખ. એ સ્વખ હતું અહીં વિદેશી મોટી આગબોટો અડોઅડ ઊભીને માલ ચડાવે - ઉતારે તેવું તરતું બાંધીને જબ્બર એક શહેર જમાવી દેવાનું. એ ખારાની જીવલોશ આબોહવામાં સીમ્સ એક બંગલી બાંધીને વર્ષો સુધી કોઈ તપસ્વી ધૂણીધરની પેઠે પડ્યો રહ્યો. બંદર બાંધ્યું, ખાડી સુધરાવી, રેલના પાઠ પથરાવ્યા. અંતરરાષ્ટ્રીય વ્યાપારના એક ધીકૃતા બંદરની કલ્યના બાંધીને બે ગાઉના વિસ્તારમાં નગરની રૂપરેખા દોરી. એક દિવસ એ ખાડીને કિનારે એણે મોટી આગબોટ નાંગરાવી. અંદરથી એક અંગ્રેજને પરબારો કિનારાના પ્લોટફોર્મ પર પગ મેલાવીને ઉતાર્યો ને એને હથે બંદરનું ખાતમુરત કરાયું.

એ અંગ્રેજ અતિથિનું નામ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર. વર્તમાન શહેનશાહ પંચમ જ્યોર્જના એ કાકા થાય. તેના નામનું આ પોર્ટ આલ્બર્ટ વિક્ટર.

પણ સીમ્સ સાહેબનું અકાલ મૃત્યુ થાય છે તે સાથે જ એના ભવ્ય સ્વખ પર

પડદો પડી જાય છે. એની કલ્યના નગરી અત્યારે જાણો કે જમીનમાંથી ઊભી થતી થતી અવાચક થંભી ગઈ છે. સમયદેવે ભાવનગર બંદર પર પક્ષપાત વરસાવ્યો, અને સીમ્સ સાહેબની કાબેલિયતે તેમ જ દૂરંદેશીએ જેને આખા કાઠિયાવાડ-ગુજરાતની જોડે અનેક કરામતો વડે જાંકળી દીધું હોત ને છેક પુરોપના ઉંબરમાં મૂકી દીધું હોત, તે પોર્ટ આલ્બર્ટ વિક્ટર અત્યારે ફક્ત દેશી વહાણો પૂરતો જ, રાજુલાની ખાણોના ઘડેલા પથ્થરોનો તથા ચીરોડીનો કંઠાળી વ્યાપાર જોતું, લોકવાજીમાં ફક્ત 'પોર્ટ' અથવા 'પોટો' એવું જ મિતાક્ષરી ને અળખામણું નામ પામેલું ઊભું છે. કાળચકના આંટામાં ક્યાંયે કદાચ આ પોર્ટ આલ્બર્ટ વિક્ટરનાં તેજ તકદીર નિર્માયાં હશે તો તે દિવસ સીમ્સ સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં સાંત્વન પામશે. અત્યારે તો એ ઘણીનો રોટલો હક્ક કરવા સારુ પોતાનો દેહ પાડનાર ખાનદાન અંગેજને કંઠાના લોક ખરા યાત્રિકોના ભાવથી યાદ કરે છે.

સીમ્સ સાહેબની સ્વખનસૃષ્ટિના બે અવશેષોને હું નહીં ભૂલું : એક તો ચાંચના છેલ્લા બિન્દુની નજીક ખાડીના મુખદ્વાર ઉપર એક ખડક પર ઊભેલ 'કંદેલિયો'; ને બીજો બંદર પરનો પગી ઘૂઘો ખલાસી. એ 'કંદેલિયો' એટલે સીમ્સ સાહેબે ચણોલી અડીખમ ઓઝ્જરવેટરી.

"ઘૂઘા પગી, તમને કેટલાં વર્ષ થયાં?"

"ઈણી મુંજો શી ખબર્ય, સા'બ? મુંજો કીંયે ઈયાદ નથી." એ ચાલીસ વર્ષના દેખાતા હસતા માણસે જવાબ દીધો.

"ઘૂઘા પગી, 'વીજળી' આગબોટ ડૂબી ગઈ એ તમને યાદ છે?"

"ઈ તો સાઈબ, હજુ કાલુની જ વાત. ઈ તો સંધુંય મારી સાંભરણ્યનાં વીજળીની તો ઈ અગિયારમી-બારમી ખેપ હતી. ઈનો કપ્તાન હતો મશાલમાન. ઈણું એકોય મડદુંય ક્યાંદી ન જડયું, એકોય લૂગડું-ચીંથરુંય ભંડકમાં ભેરાં કરી દઈ ભંડક બાર્યથી બંધ કરી દીધું'તું ઈમ બોલાય છે. આગલુટ ઈમ ને ઈમ તળિયે જઈ બેઠી. ઈ તો હજુ હમજાંની વાત."

સાચું, 'વીજળી'નો કપ્તાન બિચારો ફકીર મહભ્રદ : પહેલો જ દેશી કપ્તાન : એટલે જ એને આગબોટ પાછી વાળવામાં નામોશી લાગી : એણે શું વિચાર્યુ?

ભાગું રે તો મારી ભોમકા લાજે,

અલ્લા માથે ઈમાન : કાસમ, તારી વીજળી!

વીજળી રે મધદરિયે વેરજ થઈ.

- એ રાસ્તો મને યાદ આવ્યો.

"ત્યારે, હેં ઘૂઘા પગી, સીમ્સ સાહેબે આ બંદર બાંધું તે તમને યાદ કે?"

"ઈયાદ કીમ નઈ, સા'બ! હું સીમ સા'બની ભેરો જ હુતો ને?"

"કેવી રીતે બંદર ખુલ્લું મૂકેલું, હેં ઘૂઘા પગી?"

"ઈમ થ્યું'તું, કે સીમ સા'બે સંધુંય તિયાર ટપે કરીને પછે ઠેઠ બંદરથી તે ગામ

લગે બે ગાઉમાં તંબૂ ખેંચાવી રાખેલા. તંબૂની હેઠથી રેલવાઈના પારા. પછે તખતસંગ મા'રાજ આવ્યા. સીમ સા'બે બે મોટી શલ્યા ઘડાવી રાખી'તી : એક તખતસંગ મા'રાજના નામની. ને બીજી ગોરાના નામની. રાતે તખતસંગ મા'રાજના નામની શલ્યા અધ્યર ટાંગી મેલી'તી. સવારે તો પાયો નાખવાનો હતો. ઈમાં સવારે એકદમ સીમ સા'બ કે' કે પાણો બાદલી નાખો. મા'રાજના નામનો પાણો ઝટ ઝટ છોડી નાખ્યો, ને ગોરાના નામનો પાણો બાંધી વાર્યો. તાં તો મોટી આગબુટ ખાડીમાં ધુંવાડા કાઢી હાલી આવે છે. માંઠથી ગોરો કનારે ઉતરે છે. તંબૂમાં જાય છે. થોડી વાર થઈ તાં તો તંબૂમાં તારીયું પડી, ને જહેર થીયું કે બંદર પાસ! પછે ગોરાએ દોરીએ હાથ દીધો. એટલે ખરરર ખટ, ગરેડીમાંલો પાણો ખાડામાં ઉતરી જ્યો. આમ હકીકત બણી'તી સા'બ."

મને સમજાવવામાં આવ્યું કે પ્રથમ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરનું પાયો રોપવા આવવાનું નક્કી નહોતું, એટલે એમને અભાવે મહારાજા તખતસિંહને હાથે પાયો રોપવી શહેરને 'તખતનગર' નામ આપવાનો સંકેત હતો; ને જો પ્રિન્સ છેલ્લી ઘડીએ પણ આવી પહોંચે તો 'પોર્ટ આલ્બર્ટ વિક્ટર' નામ પાડવું ઠર્યું હતું.

આ પથ્યર પર અમરત્વ અંકાવવાની માનવસહજ લોલુપતા! લોકો તો બાપડા 'પોર્ટ આલ્બર્ટ વિક્ટર'નેય વીસર્યા, 'તખતનગર' નામ પણ લોકમુખને ન ફંયું! ઓછામાં ઓછું ધૂંક ઉરાડવા અને બને તેટલા ઓછા લોચા વાળવા ટેવાયેલી લોક-જીબ આજે ફક્ત 'પોરો' કે 'પોર્ટ' કહી પતાવે છે. એ જ જીબ 'પોરબંદર'ને 'પોર' કહે છે. બેટ શંખોદ્ધારને ફક્ત 'બેટ' નામે ઓળખે છે.

પણ હું તો ઘૂઘા પગીની ઉંમરનો અંદાજ કાઢી રહ્યો હતો : "ઘૂઘા પગી! તમે મૂળથી નોકરી જ કરો છો, કે દરિયાઈ ખેપો કરી છે?"

"તયે નઈ? મંબી ને મલબાર ને કાલકોટ (કાલીકટ)ની કેંક ખેપું કરી છે મીંએ. આમ બસરા લગી જાઈ આવ્યો છું."

આ રીતે અનેક ગણતરીઓ ગણતાં ઘૂઘા પગીની અવસ્થાનો અંદાજ એંશી પર જાય છે. પણ ઘૂઘો હજુ 40-45 વર્ષનો, તરવરિયો અને અથાક જુવાન દીસે છે. એણે કહ્યું કે "ઈ સામો કળાય છે ને, ઈ કંદેલિયામાં તો સીમ સા'બે કેંક સંચા માંડેલા. દરિયાનાં આર-વીળ્ય (ભરતી-ઓટ), વાવડા, તોણન, આભનાં લાખતર (નક્ષત્ર), વગેરે સંધીય બાબતુંના હિસાબ ન્યાં થત્તા'તા. પછી તો સીમ સા'બ મૂવા કેંક સંચા બધા ભાવનગર ભેરા કરી દીધ્યા, ભાઈ!"

વિશાળ મહાસાગરથી ખાડી રાણીને અંતરપટ કરી રહેલ આ 'ચાંચ' નામની ભૂશિર પાઘડીપને દોઢ-બે ગાઉ લાંબી પડેલી છે. પક્ષીની લાંબી ચાંચના આકાર પરથી એનું નામ પડેલું છે. વિક્ટરની બાજુએ એનાં ખેતરવાડીઓ વાલોળની શીંગો અને રીંગણાં-મૂળાનાં રસાળ મીઠાં શાકની સોડમો પાથરી રહેલ છે. ગામનાં ખોરડાં તો ગોઠવાયાં છે મોય દરિયાની સન્યુખે. દિવસરાત પોતાની ધોળી કેશવાળી ખંખેરીને કિનારાના ઊંચા

બેઠા સાથે જીંકાળીક કરી રહેલ એ ભૂખરો દરિયો ખારવાનાં બચ્ચાને મોતનો ભય ભુલાવે છે. કાળાન્તરે કાળાન્તરે એ ભૂશિરના કાંઠામાં મોજાંની કોદાળીઓ મારીમારીને થોડાં થોડાં જબ્બર ગાબડાં પટકનાર આ સિંધુ ખારવાનાં બાળને જાણો કાળ-હાલરડાં ગાઈ ગાઈ ઉંઘાડે છે. કોઈ કોઈ વસ્તીના ખોરડા ઉપર તો મેંગલોરી નળિયાં દીપી રહ્યાં છે.

“અને આ દીવાદાંડી! ગામના ઊંચામાં ઊંચા ટેકરા પરની આ દીવાદાંડી તદ્દન નવી કેમ લાગે છે?”

“ભાઈ, આ હમજાં જ ભાવનગરથી આગબુટ લઈને ગોરો મોટે દરિયે ઊતરી પડ્યો. ને રાતોરાત એણો કામ લઈ આ કંદેલિયો ઊભો કર્યો. પરોડિયે તો એણો દીવોય પેટાવી દીધો.”

“પણ નવી શા સારુ કરી?”

“ઈ તો ભગવાન જાણો. વાતું થાય છે કે વત્યાતેથી પણ્ણું સા’બનો તાર આવ્યો. કોને ખબર, ‘પોટા’નાં તકદીર ચાઢિયાતાં થવાનાં હશે કદીક! ઓલી સામી લેખડે નવા દરબારનો બંગલો ચણાવાનો છે. માપણી સોત કરી જ્યા.”

એ રાજપ્રકરણમાં કશી ગમ ન પડતાં મેં તો મારી નજર મારા દોર ઉપર જ સ્થિર રાખી. ચાંચના ચોરાની પાસે કોડીબંધ પાળિયા ઊભા છે – જૂના તેમજ નવા. આ પાળિયા કોના?

“આ સાંઢ્યું માથે બેઠા એટલા રબારીયુંના; ને ઘોડે અસવાર એટલા અમારા કોળીયુંના.”

“રબારીઓની વસ્તી આંહીં હતી?”

“મોરુકી હતી. ધરતી માથે જુ વેળા બા’રવટિયાઓનાં ઘોડાં હાલતાં ને જંપવા ન દેતાં, ત્યારે રબારીઓએ માલ ઘોળીને આમાં આશરો લીધલ.”

“પછી?”

“પછી અમારા ખારવાઓએ આવીને રબારીનો વંશ કાઢ્યો. ધીંગાણાં થતાં તેમાં મૂઝા, ઈની આ ખાંબિયું છે. અમે અટાણો કોળી, પણ અમારી શાખ છે મકવાણા, ગોહલ, બારિયા વગેરે રજ્પૂતોની. એટલે અમારીય ખાંબિયું.”

“પણ આ નવી ખાંબિઓ છે તે કોની?”

“ખાંબી તમામ કાંઈ ધીંગાણો મૂખેલાંની જ નથી હોતી. દરિયે બૂડીને મરે, ગળેફાંસો ખાય, એરુ આભડવાથી મરે – મતલબ કે અસદ્ગતિએ જાય એની સૌની ખાંબી ખોડાય.

આ સ્થળોમાં વહાણવટીઓની તમામ ખાંબીઓ ઘોડેસવારના સ્વાંગમાં દીઠી, ત્યારે બેટ શંખોદ્ધાર કનેના બરાબર આવા જ પુરાતન સ્થાન આરંભાને પાદર મેં પાંચ વર્ષ પૂર્વે ખુદ વહાણની જ ખાંબી દેખી હતી. પાળિયામાં વહાણનું ચિત્ર કંડાર્યું હતું.

“તમારું વહાણવટું કેમ ચાલે છે?”

“હવે તમામ ભાંગી ગયું. જૂના વખતમાં આ મોટે દરિયે ચોરીના માલનાં વા’ણ

ଓବାଂ ରେତାଂ, ଅମନେ ଜଣୀ ଫରକାଵିନେ ଜାଣ କରତା, ଏଟିଲେ ଅମାରା ବଡ଼ବା ଆଂହିଥି ମଧ୍ୟବା ଲଈ ତାଂ ଜଈ ପୋଗତା; ଅନେ ସସ୍ତେ ଭାବେ ବଧୋ ମାଲ ଲଈ ଆବି ପଛି ଆସପାସ ଗାମଡାମାଂ ଦେଚତା.”

“ତମାରା ବଡ଼ବା ଆଂହି ନୀକଖିତାଂ ବହାଷୋନେ ଲୁଟତାଂ ନହିଁ?”

“ନା ରେ ନା.” ଦୁଁଗାଈଭର୍ଯ୍ୟ ଜ୍ଵାବ ମଣେ ଛେ. “ପଣ ଅମେ ଚୋରାଉ ମାଲ ରାଖିବାନେ ଧଂଘୋ କରତା ଏଟିଲେ ରାଜମାଂଥି ସତାଵାଣାଓେ ଆବିନେ ଅମାରାଂ ବା'ଷୋନେ ସଣଗାବି ଦୀଘାଂ. ଅମାରୁ ବା'ଷ ବାଂଧିବାନୁଯ ବଂଧ ଥିଥୁଂ.”

“ତ୍ୟାରେ ‘ଚାଂଚିଯା’ ନାମ ଆ ଚାଂଚ ପରଥି ଜ ପଡ଼ୁଥି ହଶେ ନେ? ଆଂହି ତେ ଧମଧୋକାର ଚୋରିଲୁଟ ଚାଲତାଂ ହଶେ ଜୁନା କଣମାଂ, ଖରୁନ୍ ନେ?”

ଦରିଆଈ ଲୁଟ୍ୟାରା ତରିକେ ନିଦାଈନେ ନାଶ ପାମେଲି ଆ କୋମମାଂ ଅଗାଉ କେବା ସାହସ-ଶୂରାତନ ଝେଡନାର ସାଗରନା ସାଵଜେ ପାଇୟା ହଶେ ତେନେ ଈତିହାସ ଜ ‘ଅମେ ଚୋରିଲୁଟ୍ୟାରା !’ ଏ ମନୋଦଶାନୀ ହେଠଳ ଦବାଈ ଗଯେ ଛେ. ଏନୀ ପୁରାତନ ଵିରତା ଉପର ଅତ୍ୟାରେ ଏକ ଏତି ବେଅବରୁନୋ ପୋପଡ଼େ ଚଢି ଗଯେ ଛେ କେ କୋଈ ଅବଶେଷ ଜ ହାଥ ଆବବୋ କଠିନ ଥିଈ ପଡ଼େ ଛେ. ଚାଂଚିଯା ବହାଷିତିଥି ଧଣ୍ଣାଖରା ଝେଡମାଂ ଲାଗ୍ୟା, କେଟିଲାଙ୍କ ଭାବନଗର ଜାଫରାବାଦ ମଜୂରୀଏ ଚଢିଯା, ନେ ଥୋଡ଼ାକ ଜୁବାନୋ ପାରକାଂ ବହାଷୋ ପର ଚଢିନେ ଖେପୋ କରେ ଛେ.

“ଚାଂଚନୀ ଶିତଣାନୁ ନାମ ତମେ ନହିଁ ସାଂଭିଥୁଂ ହୋୟ.”

“ନା, ଶିତଣା କୋଣା?”

“ଵରବୋ ନାମେ ଆଂହିନୋ ଖାରବୋ ହତୋ. ଜବରେ ଦରିଆଈ ଚୋର ହତୋ. ଏନୁ ନାମ ଜ ‘ଶିତଣା ମାତା’ ପଡେଲୁଣ୍ଟ, କେମକେ ଆ ଦରିୟେଥି ଜେ କାଂଈ ମାଲ ଭରିନେ ବା'ଷ ନୀକଣେ, ତେ ତମାମ ଜାତନା ମାଲମାଂଥି ଏନୁ ଦାଙ୍ଗ ଚୁକ୍କିବିଲୁଣ୍ଟ ପଡ଼େ. ଆଖରେ ଏକ ଦିବସ ଜାଫରାବାଦନୀ ସୀଇଁ ସରକାରନୀ ଜାଲୀ-ବୋଟମାଂ ଵରବୋ ଝଲାଈ ଗଯେ. ଏନେ ହାଥେ କଢି ପେ'ରାବି ହତି. ଏମାଂ ଵରବୋ ରାତେ ଠକ୍କିନେ ଭାଗ୍ୟୋ. ଜାଫରାବାଦଥି ଆଂହି ଲଗିନୋ ପାଂଚ ଗାଉ ଦରିୟୋ ବାଂଧିଲ ହାଥେ ତରିନେ ଆବି ପୋଣ୍ୟୋ.”

ମନେ ଥିଥୁଂ : ଆବି ତାକାତନେ ନବି ମରଦାଈନେ ମାର୍ଗେ ଚଢାଵନାର କୋଈ ନ ମଣେ?

“ଆ ଅମାରେ ପୁରାତନ ଝୁଖଡ଼ୋ. ତ୍ରଣ ମହିନା ଉପର ଵାଵଡ଼େ ଥିଥୀ ତେମାଂ ଆ ପଡ଼ି ଗଯେ.”

ଜୁଦ୍ମୂଳୀ ଉଖଡ଼ି ପଡ଼ିନେ ଜମୀନଦୋସ୍ତ ଥିଲେ ଏ ଜାଜରମାନ ଵୃକ୍ଷଦୈତ୍ୟନୀ ସାମେ ହୁଣ୍ଡ ଜୋଈ ରଖ୍ୟୋ. ଏନା ଥଣ୍ଡା ପୋଲାଙ୍ଗମାଂ ଆଖୁଣ୍ଡ ଗାଢ଼ୁଣ୍ଡ ଚାଲୁଣ୍ଡ ଜାଯ, ତେ ପରଥି ଏ ଝାଡ଼ନୁ ପରିମାଣ କୁଳୀ ଶକାଶେ. ଏନେ ବଡ଼ବାଈରେ ନଥି. ଝିଣ୍ଡା ଝିଣ୍ଡା ପାନ ଛେ. ପଣ ବନସ୍ପତିନା କୋଈ ହୁଣ୍ଡ ରାକ୍ଷସ ଜେତୁଣ୍ଡ ଜ ଏନୁ କଟ ଅନେ ସତ୍ରପ ଦୀର୍ଘ.

“ଆ ଝୁଖଡ଼ାନୀ ଡାଣେ ଡାଣେ ତୋ, ଭାଈ, ଦର ଅଖାତୀଜେ କେକ ହିଂ୍ଚକା ବଂଧାତା, କାଯମ ଆଂହି ନାନା-ମୋଟାଂ ଛୋକରାଂ ରମତାଂ, ପଣ ଜ୍ୟାରେ ଏ ପଡ଼ିଥୋ, ତ୍ୟାରେ ପାରେ କୋଈ ଜ ନହୁନ୍ତି. ଏ ଜାରୋ କେ ଲାଗ ଦେଖିନେ ପଡ଼ି ଗଯେ. କୋଈନେ ଈଜା କରି ନହିଁ.”

ଚାଂଚନୋ ଏ ‘ଝୁଖଡ଼ୋ’ ନାମେ ପଂକ୍ତୀଲ ଵୃକ୍ଷଦୈତ୍ୟ ଲଗଭଗ ଜାତାନୁ ଧାମ ବନୀ ଗଯେ ହତୋ.

એની સાથે પણ કોઈક દેવદેવીને ગોઠવી દઈ 'ધરમ'ની દુકાન માંડવાની વેળા થઈ ગયેલી. બાપડો હશે કોઈક સંસ્કારી જીવ, કે વખતસર એણે સોડ તાણી લીધી.

કેટલો બુજરગ હશે એ રૂખડો? કોઈ ન કહી શકે. એ જ જાતનાં જાજરમાન બે ઝડપ મહુવાના સમુદ્રતીરે દીઠાં. જાણકાર કહે છે કે ભાઈ, આ જાડનાં મૂળ અંહીંનાં નથી. આહિકાને કાંઠેથી આપણા અસલી વહાણવટીઓએ જ એ રોપા આણોને આ ધરતીમાં ચોંઘા હશે. અથવા તો આહિકા અને એશિયા બેઉ ખંડો તૂટીને કટકા નહીં થઈ ગયા હોય, એક જ હશે, તે વખતની આ કંઠાળી વનસ્પતિ હશે.

તદ્દન કુદરતી રીતે જ જર્જરિત થયેલાં એનાં મૂળિયાં કેટલા કાળાન્તરે આજ આટલી આસાનીથી ઊખડી પડ્યાં હશે! કોઈ વનસ્પતિનો અભ્યાસી હોત તો કહી શકત. ચાંચનો 'રૂખડો' જતાં હજારો વર્ષનો એક ઈતિહાસ-દેખ ભૂસાયો છે. સૌરાષ્ટ્ર દેશની કેં કેં તવારીખોનો એ મૂંગો સાક્ષી હશે. સોરઠના રત્નજિત સાગરતીરની શતકોજૂની ચડતી-બઢતી એ રૂખડાએ નીરખેલી હશે. કોઈ નામાંકિત મ્યુક્લિયમમાં મૂકવા લાયક એ વૃક્ષદેહ - મમી છે. એનાં પડેપડ કોઈ વેદના પુસ્તકની માફક ઉકેલાવવાં જોઈએ. પણ એ ભાષા ઉકેલનાર જ્યક્ષ્યણ હંદ્રજી હવે નથી.

આવા કોઈક કોઈક રૂખડા, સ્વાદિષ્ટ વાલના મહેકતા છોડવા, દુષ્કાળમાં ગરીબોને ધાન્યને અભાવે ટકાવ આપનાર શોવાળિયાની ભાજી, અને ખાડીને કિનારે અર્દ્ધ પાણીમાં ઊગેલ તમ્મરિયાંનાં ઝડપવાં : એટલી અંહીંથી છેક તળાજા સુધીની કંઠાળ વનસ્પતિ. તમ્મરિયાંનાં ઝડપ તો ભેંસોને માટે ખોળ-કપાસિયાની ગરજ સારે એવું રસાળ ખાજા છે તે આજે જ જાણ્યું. ભાવનગરમાં તો કહે છે કે એનાં ગાડાં ને ગાડાં વેચાય છે. દૂધાળાં ઢોરને એ ભાવવાનું કારણ એની ખારાશ છે. દરિયાનાં પાણીમાં જ એ ઊગે છે ને ઊજરે છે.

"અને પટેલ, તમારે દરિયાનાં જીવ કયાં કયાં ખવાય?"

પટેલ શરમાઈ ગયા. "ભાઈસા'બ, તમ સરીખાં ઊંચ વરણની અદબ અમુંથી ન છોડાય."

"પણ એમાં અદબ છોડવાનું શું છે? એ તો તમારો કુદરતી આહાર છે. અમે કયાં તમારાં ધરમાં દાણા પૂરી દઈએ છીએ કે એ આહાર લેવાની તમને ના પાડીએ?"

"ભાઈસા'બ, તમને સૂગ ચડે."

"સૂગ શા સારુ ચડે? ફક્ત નામ સાંભળવામાંય સૂગ?"

"તથે જુવો ભાઈ, શેળવો ખવાય, શીંગાળું (જેને માથે કાંટો હોય તે) ખવાય, શેરું (જેનાં ગલોકણમાં મૂછો હોય), ઢાંગર મગર (જેને દાંત હોય), પળશો, ગોમલ્યો (વાંકા દાંતવાળો), વરડો (જેના પુંછડાની લાંબી સોટી થાય), કળશ (એરુ જેવો), પાંભડી (ધોળી), કરચલો, પામેડી, લેપટા, સુંદિયું (વાંકું), જુંગો (વાંબ વાંબની મૂછોવાળો), કાગડી, કુંકરો (સૂપડા જેવો), કાળી મર્છી (થાળી જેવી, પુંછડી વિનાની), એવાં એવાં ખવાય.

“મલાર માછલી, મગરમચ્છ, કણો અને હળોંકું નામે સરપની જાત, કોઝી અને સીંકું, જુરીડો, એવાં એવાં ન ખાઈએ. જાફરાબાદને દરિયે અટાજો માછીમારોનું એક મોઢું પરું વસી ગવું છે. મછલા ભરી ભરીને માછલાં ત્યાં લાવે છે. પછી તમામ જીવના નોખા ઠગલા. પાડીને સુકવણી કરે છે. એના કોથળા ભરી ભરીને એ મુસલમાન શેઠિયા દેશાવર મોકલશે. ન ખવાય તે નોખાં રે'શે. અમારા ઘણા જણ ત્યાં ગયેલ છે.”

“એને શું રોજ મળે છે?”

“રોકડ નહીં, પણ માછલાં જ આપે છે વેપારીઓ.”

“ન ખવાય તેવા જીવનો બીજો કંઈ ઉપયોગ ખરો?”

“તથેં નઈ? ભારી ખપ લાગે. જુઓ આ પાણીમાં મોટી માછલી દૂબકી ખાતી ખાતી જાય છે ને, તે મલાર માછલી. એનું આખું શરીર જ તેલનું બનેલું હોય છે. અમે તો નહીં, પણ મુસલમાન માછીઓ એ મલારને એક ડબામાં પોક કરીને રાખી મૂકે. થોડે દા'રે એનું નરદમ તેલ બની જાય. પછી એમાં કાળો કે લાલ રંગ ધૂંટીને એનાથી વા'ણને ચોપડ કરે. ભારી પાકો રોગાન ચરે છે વા'ણને એનો.”

અંતમાં એ ચાંચવાસી ધૂંઘાભાઈએ એક જ વાક્યમાં સમેતી લીધું : “જોવો ભાઈ, જેટજેટલી ચીજવસ્તુ જીવને માથે છે, એટલી જ રકમ માતર આ રતનાગર સાગરમાંથી ભરી છે. અમને દરિયોલાલ સંધુંય આપી રે' છે.”

“કહો ત્યારે, તમારી દરિયાઈ દુનિયામાં જળઘોડા હોય છે એ વાત સાચી?”

“કેવા જળઘોડા?”

“એની એક લોકકથા મારી કને આવી છે તે હું કહું : બોલાય છે કે કર્છના કોઈ ગ્રામમાં એક નાથબાવાને ઘેર બે તાજણ ઘોડીઓ હતી. એક સાલ મે થતો નથી : ખડ ક્યાંય જડે નહીં : જાતવંત ઘોડીઓ ઠાણમાં બાંધી બાંધી ભૂખે મરે. હવે બાવાને ઘેર એક ચારણ છોકરો ઘોડી ચારવા રહે. એણો કહું, ‘બાપુ, આ દરિયાને કાંઠે ડાખડી ઊભી છે એ પંદરેક દિવસ ચારવા દિયો, ત્યાં મે થાશે.’ બાવાજીએ કહું, ‘ભલે, ચાર દરિયાકંઠે. પણ જોજે હો, કોઈ ટારડો પોગી જાય નહિ.’ (અર્થાત્ આ ઊંચી જાતની ઘોડીઓને કોઈ હલકા ઘોડાથી ગર્ભ ન રહી જાય.) છોકરો કહે કે હું બરાબર ધ્યાન રાખીશ. પછી તો છોકરો દરિયાકંઠે બેઠો બેઠો ઘોડીઓને ચારે. એમાં એક દિવસ એક તાજણો ઠાણ કર્યું. એ ઠાણની ઘાણ્ય દરિયાઈ ઘોડાને ગઈ. દરિયામાંથી ઘોડો નીકળ્યો, ઘોડી આગળ ગયો, બે ઘડી આળાં-પતાળાં કરીને માથે પડ્યો, પડીને પાછો ચાલ્યો ગયો દરિયામાં. છોકરો તો જોઈને દંગ થઈ ગયો. પછી તો મે થયો. ઘોડીઓ ઘેર બંધાઈ ગઈ. પાંચ-સતત મહિના થયા ત્યાં તાજણો પેટ મૂક્યું. જોતાં જ બાવાજીને ફણ પડી : ‘એલા ભૂંદું થ્યું. ઘોડી સભર થઈઃ’ છોકરો તે દિવસની બીજા છુપાવી રહ્યો હતો, તેણે કહું ‘ના, ના, બાપુ, એ તો ખડનું પેટ વધ્યું છે’. પણ બાર મહિને ઘોડીએ ઠાણ દીધું. વછેરી આવી. પણ શી એ વછેરીની રૂડપ! કિરતારે હાથ ઘોઈ નાખેલ; એનું ચિત્રામણ : અને ઘોડીને પાણી પાવા

કે ધમારવા તળારે લઈ જાય ત્યારે વછેરી ભયાં તળાવ ઉપર છબ છબ છબ હાલે : છોકરો મનમાં ને મનમાં બોલે કે વાહ માતાજી ! પણ પછી તો વછેરી મોટી થઈ એટલે પરગંધીલી થઈ ગઈ. છોકરા વિના બીજા કોઈને પડખે ઢૂકવા ન આપે. એક દિવસ ભુજના મહારાવનું માગું આવ્યું. ત્યારે છોકરાને ફાળ પડી. ચડ્યો વછેરી ઉપર, બાવાજને કહે કે, ‘બાપુ, જાઉં છું, પણ ભુજ નહીં હો ! પગ કચરીને મોટી મેં કરી છે ને શું સવારી કરશે ભુજનો રાવ ?’ એમ કહેતોક ને ગયો. કરછને કાંઠે જઈને નાખી વછેરીને દરિયાની ખાડીમાં. બાર ગાઉની ખાડી તરીને વછેરી કાઠિયાવાડને કાંઠે નીકળી ગઈ. સીસાંગ ગામનો ગરાસિયો હાલોજી ઘોડીઓ ફેરવે ત્યાં જઈને ચડાઉ કરાવી. પછી પોતે ને હાલોજી બેય લુંટફાટ કરવા ભેળા જાય. વચ્ચે પાણીનાં નવાજ ઉત્તરવાનાં આવે ત્યારે પોતે સહુની નજર ચુકાવીને વછેરીને ઉતારી લ્યે. એમાં એક વાર બેય જગાએ કુંડલાની નદીમાંથી ઘોડ્ય લૂંટી, ભાગ્યા, વચ્ચે શેત્રનું પડી છે, પાણી આવી ગયું છે. છોકરો કહે, હાલાજી, નાખો ઘોડી. હાલાજી કહે, તું નાખ પહેલી. હાલોજી ગોથાં ખાતો રહ્યો ને છોકરો વછેરીને વહેણ ઉપરથી કાઢી ગયો. હાલાજીની આંખો ફાટી રહી. વાય, ઘોડી વાય ! છોકરો કહે કે હાલાજી, આ લ્યો આ ઘોડી, કારણ કે એ સારુ તમે મને ક્યાંક કોઈક દિ’ દગ્દો કરીને મારશો.

આમ વાત ચાલે છે એ તાજણની વછેરીની. દરિયાપીરના ઘોડાથી પાકી, એટલે એનું નામ પીરાણી તાજણ પડયું. એના વંશની ઘોડીઓને ઠાણમાં રોજ સાંજે દીવા ને લોબાન કરવામાં આવતા. આ લોકવાયકા ઉપરથી હું પૂછું છું કે “એવા દરિયાઈ ઘોડા તમારા દીઠામાં આવેલ છે ક્યાંય ?”

“જળઘોડલાની તો સરત નથી, પણ જળમાણસડાં દીઠાં છે મલબારને દરિયે. બે હાથ, બે પગ, હાથપગના પોંચા અને આંગળીયું, કાળો વાન, વાંદરા જેવું મોં, ડોકું વગેરે તમામ રીતે આકાર વાંદરાને જ મળતો. પાણીનાં જ જીવ. પણ કાંઠે નીકળીને નાળિયેરીનાં ઊંચાં ઝડ પર ચડી બરાબર વાદરાંની માફક જ બેસે. માણસનો સંચાર થતાં જ પાણીમાં પેસી જાય, અમારાં વહાણોના પડખે હોડકાં તરતાં મૂકીએ તો તે પર પણ આવીને બેસે. પાછું જળમાં ચાલ્યું જાય. બધી જ ચેષ્ટા માણસ જેવી કરે.”

“આપણા કાંઠાના દરિયામાં મોટા મગરમરછ ખરા કે ?”

“ના ભાઈ, આંહીં નથી ભાગવામાં આવતા. મલબાર કાંઠે બહુ છે. અમારાં નાનકડાં વહાણોની પડખે આવીને અથડાય, ત્યારે એવી તો લે’ લાગે કે કદીક જફા પહોંચાડશે. ભારી વિકરાળ. એ તો ભાઈ, બજરંગનો અવતાર છે ખરો ના ? એટલે એમે એના માથે મીઠું તેલ ચડાવીએ, અડદના દાણા છાંટીએ ને હાથ જોડી કહીએ કે ‘હે હડમાનજી ! ખમા કરો. અમારાં રખવાળાં કરો’. આટલું કહેતાં જ મગરમરછ વહાણને છોડી ચાલ્યાં જાય છે.”

## ચેતૈયાની જન્મભોમ

નાકનું ટેરવું કુલાવીને આ લોકોના વહેમોને તિરસ્કાર દેવા હું ગયો નહોતો. ઉપદેશ કરવાનું કર્તવ્ય પણ મેં નહોતું ધારણ કર્યું, એટલે જાવી આવી વાતો તરફ હું એક સ્વભસ્થ, ઘેનઘેરી નજરે કાન માંડી રહ્યો. “દરિયાનાં બાળકોની વચ્ચે પણ સમુદ્ર ‘ઝી મેસનરી’ સ્થાપી રહેલ છે” એવું કથન ભાઈ સુકાનીએ ‘કુમાર’ના શતાંકમાં આદેખેલી ‘હડકી વારી આઈ’ નામની સાગરકથાને છેઠે ટંક્યું છે તેનું મને સ્મરણ થયું.

એ સ્મરણને તો હું આખા પ્રવાસમાં મારે હૈયે સાચવી રહ્યો હતો. કેમ કે ધીરોદાતા મરદાઈને હિસાબે જેનો જગતમાં જોટો નથી એવી આ ખારવા જાતિનું નિરીક્ષણ મને પગલે પગલે તેઓની જુદેરી અધ્યાત્મ-દુનિયાના પ્રદેશો દેખાડી રહ્યું હતું ને હું તો એક સંશોધક તરીકે તેઓના જીવનમાં પડેલી એ પુરાતન લોકવિદ્યાના પોપડા નિહાળવા નીકળ્યો હતો. તરીકે તેઓના જીવનમાં પડેલી એ પુરાતન લોકવિદ્યાના પોપડા નિહાળવા નીકળ્યો હતો. પૃથ્વીનાં પડોને ખોદનાર સંશોધકોને તેઓના રોજના અનુભવની વાત છે કે હજારો વર્ષોની અણીશુદ્ધ દટ્યાયેલી પડેલ કોઈ મિસરી મમીને અથવા તો મોહેં-જો-દડોનાં ખંડિયેરમાંથી નીકળતા જૂના લેખોને જરી કૂક લાગતાં જ એનું સ્વરૂપ છેકાઈ જાય છે. લગાર તડકો કુ પ્રકાશ પણ એને ધૂળ કરી નાખે છે, એટલે મારા જેવાને તો તેઓનાં આ જીવનતત્ત્વો પર તર્ક વા પાંડિત્યની, નવયુગના સુધારાની કૂક મારવાનો, અજવાણું નાખવાનો જરીકે લોભ નહોતો. હું ગયેલો ખંડેરો ખોદવા, જેવું છે તેવું લોકવિદ્યાનું તત્ત્વ પકડવા.

“હું વશરામભાઈ”, ‘રૂપારેલ’ નામના વહાણના વશરામ ટંદેલને હું પ્રશ્ન કરું છું  
 (“રૂપારેલ”, ‘રતનાકર’, ‘લક્ષ્મીપ્રસાદ’, ‘જબરદસ્ત’ એવાં એવાં વહાણોનાં નામ હોય છે) :  
 “વશરામભાઈ, તમે વહાણ લઈને ઘેરથી મુસાફરીએ ઉપડો ત્યારે કેવી રીતે દરિયાનું આરાધન કરો?”

“દરિયામાં નાળિયેર ને કૂલ ચડાવીએ. એટલે કે દરિયાનાં પાણીની અંજલિ ભરીને  
 પીએં. ને સલામ કરીએ દરિયાલાલને. વહાણની મોરી ઉપર લોબાનનો ધૂપ કરીએં, તે  
 કહીએં કે ‘હે સવાઈ દુલા! અમને મીઠો મીઠો સાજો વાવડો દેજે!’ બીજું તો અમે અભણ  
 અજ્ઞાની લોકો શું સમજીએ?”

“તમે કોઈ બ્રાહ્મણને ન બોલાવો?”

“ના, અમે નહીં. પણ અમારા વેપારી લોક, જે આ વહાણોના ધણી હોય, તેઓ

બળેવને દિવસે, જુવો આ ઠેકાણો, કંઈક સ્થાપના કરાવીને બ્રાબણો પાસે પૂજા ભાગાવે..”

એમ કહીને વશરામભાઈએ મને એની ‘રૂપારેલ’ની અંદર એક ઠેકાણો સિંહૂરનાં દોરેલાં ત્રિશૂળ વગરે છાંટણાં દેખાડ્યાં.

“એ સવાઈ હુલા કોણ છે?”

“આ આપણી કંઈળના દરિયાના એ દરિયાપીર છે. એની દરગા શિયાળ બેટમાં છે, ત્યાં જઈને તમે વધારે વાતો જાણશો.”

બીજે દિવસે પ્રભાતે જ્યારે ‘આર’ હતા, એટલે કે ભરતી ઉત્તરીને ઓટ ચાલુ થયો હતો, તે વેળા ખાડીમાંથી પાછાં મોટે દરિયે વળી જતાં અબોલ પાણીએ મારા મછવાને, કેમ જાણો એ કાગળનું બનાવેલ હોડકું હોય તેટલે હળવે હાથે શિયાળ બેટ તરફ સરકાવ્યો.

“ઓલ્યો કળાય તે ભેંસલો.” ખલાસીએ ચાંચ અને શિયાળ બેટના વચ્ચાળામાં પડેલા એક કાળા ભેંસા-આકારના ખડક તરફ આંગળી ચીંધીને કહ્યું. એના રંગ અને ઘાટ પરથી તેમજ પાણીમાં એ એકલ પડેલ છે તે પરથી મસ્તાન કોઈ મહિષાસુર પાડો કલ્યીને લોકોએ એ ખડકને ‘ભેંસલો’ એવું પૂરેપૂરું સૂચક નામ આપ્યું છે.

“કેટલીક જમીન છે એની?”

“બેક વીધા..”

“કોઈ રહે છે? ખેડ કરે છે?”

“કોઈ માનવી રહેતું નથી. માથે અબુ પીરનું થાનક છે. એની માનતા કરવા માટે ખારવાઓ કોઈ કોઈ વાર જાય છે, ને ત્યાં પડેલાં ઢામડાંમાં લાપસી કે ચોખાની દેગ રાંધે છે, પણ રાત ત્યાં કોઈથી રેવાતું નથી. ઉપાડીને ફેંકી હિયે છે. બાકી તો ત્યાં આખી જમીન ઉપર પંખીડાંનાં ઠંડાં પડવાં હોય છે. મૂળ એ ભાવનગર તાબે હતો. પણ જાફરાબાદના સીદી રાજાએ સરકારમાં લડીને ભેંસલાને પોતાના કબજાનો ઠરાવેલ છે.”

પાણીમાં મસ્તાન પડેલા એ ભેંસલાંભાઈની એકલતામાં ભંગ પાડવાની મને છિંદ્યા નહોતી, તેમ અબુ પીર કંઈ દિવસ વેળાએ મને ફગાવી દેવા નિમિત્તે પણ મુલાકાત દે તેમ નહોતા. એટલે શિયાળ બેટમાં જ રજીવાનું વધારે ગમ્યું.

એક વેળાની માતબર નગરીનું આ ખંડેર. જ્યાં ખોદો ત્યાં પાકા પથ્થરની બાંધેલ મીઠા પાણીની અણીશુદ્ધ વાવો નીકળે છે. કહે છે કે એ નગરીને ઘેરે ઘેરે પોતપોતાની અલાયદી વાવ હતી. વાત સારી જ લાગે છે. ચોગરદમ ખારા સમુદ્રથી વીટળાયેલ છતાં આ ટાપુની વાવડીએ વાવડીએ અમૃત-મીઠું નીર છે. આખાય ટાપુને ફરતા પાકા ગઢની છિન્નભિન્ન રાંગ અત્યારે પણ દેખાય છે. ગંગા તળાવ નામની વાવડી પણ પ્રાર્ચીનોએ પાકી બાંધેલી. અને ‘થાનવાવ’ નામની વાવનું સત આજ પણ એવું ને એવું અનામત મનાય છે : જેનાં થાનમાં (સ્તનમાં) ધાવણ ન આવતું હોય તેવી માત્રાને આ વાવમાં બોળેલ કાપડું નિચોવીને ભીનું ને ભીનું પહેરાવવામાં આવે એટલે થાનેલા દૂધે ભરાય! ગોરખમદી નામનું અસલી થાનક મૂળ ગુરુ ગોરખનાથનો આશ્રમ મનાય છે. એના ઉપર જીર્ણોદ્વાર

થયો છે. ત્યાં રહેતા એક કપડવંજવાસી સાધુએ અંધારા ભંડકિયામાં વિરાજતી પ્રાચીન મૂર્તિઓનાં અમને દર્શન કરાવ્યાં : ગોરખનાથની મૂર્તિ, ગણપતિની, હનુમાનની, અને જૈનોના નેમિનાથ-પાર્શ્વનાથની બે તાજેતરમાં નીકળેલી પ્રતિમાઓ. એક આપણી કમ્મર સુધીના પરિમાણની મોટી શ્યામ પ્રતિમા લઈને ગંગાતળાવડીની સામે કોઈ બાવો બેસી ગયો છે. થોડા જ વખત પર હળ ખેડતાં ખેતરમાંથી ખોદાઈ આવેલ આ પ્રતિમાના મસ્તક પર લાંબો ઉંચો મુગટ છે. કમ્મર સુધી નારીસ્વરૂપ છે, કુમરથી નીચે પુરુષ-આકાર છે. મૂર્તિઓ પારખવાનો મારો વિષય નથી. પણ કોઈ શિલ્પસ્થાપત્યના અભ્યાસીએ જઈને આ બધી પ્રતિમાઓનાં સ્થળ-કાળ ઉકેલવા જેવાં છે.

સગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણીની, એના પુત્ર ચેલેયાની ને પેલા અધોરી બાવાની ભયાનક બિના પણ આ શિયાળ બેટમાં જ બની હોવાનું કહેવાય છે. ગંગાતળાવની પાણે પડેલ એક પથ્થરની અસલી કુંડી એ જ પેલો ગોળારો ખાંડણિયો, કે જેની અંદર જોગીને જમાડવા સારુ માતાએ ચેલેયાનું મસ્તક ખાંડણું કહેવાય છે. એ આખી કથા એટલી ઘાતકી ધાર્મિકતાથી ભરેલી છે, કે મને એ યાદ કરવાનું મન નથી. હું ધન્યવાદ એક બાવાને નથી આપતો કે જેણે સગાળશાના પ્રતનો ગેરલાભ લઈને છેક શેઠાણીનો ગર્ભ ચિરાવવાની હંદ સુધી છુદ રાખી; નથી હું સ્તુતિ કરતો એ શેઠ-શેઠાણીની કે જેઓની શ્રદ્ધાએ જોગી કુહેતો ગયો તે તમામ ઘાતકી ક્રિયાઓ આચરી; હું તો અભિનંદું છું એ અનામી લોકકિરિને કે જેણે હિલેદિલને ભેટ તેવું એક લોકગીત આ કથા પરથી રચી કાઢણું. એ ‘ચેલેયા આખ્યાન’ની રચનામાં ઊંણપ હોય તો તે આટલી છે કે ચંગાવતી શેઠાણીએ જોગીરાજને પોતે વાંગણી નથી એવી ખાતરી કરવવા માટે સ્વહસ્તે છરો લઈ ગર્ભશાય ચીરી દેખાડણું. તે જ ઠેકાણે ભજન અટકી જવું જોઈતું હતું. જોગીરાજે પ્રભુરૂપે પ્રગટ થઈ સહુને ‘સજીવન કર્યા એ પ્રસંગ ઉમેરાયો ન હોત તો ‘ચેલેયા આખ્યાન’ જગતનાં સર્વોત્કૃષ્ણ ‘બેલેઝુ’ માયલું એક કથાગીત બની જત. એની કરુણતા અનેક હૈયાંને નિરંતર ધોયા જ કરત. અત્યારે પણ એ ચેલેયાની ઘટનાનું સ્મરણ વીસ-પરીસ વર્ષોના કાળને પાછો હટાવી દે છે : ગામડિયા ઘરના ઉંબરમાં જાણે અમે નાનાં બાળકો અને પાડોશાં માતાઓ વગેરે બેદાં છીએ. ચોગાનમાં કોઈ રહણતો ભજનિક એકતારો લઈ ધીરે રાગે ‘ચેલેયા આખ્યાન’ ગાય છે : એમાં નિશાળે ગયેલો સપાત વર્ષનો ચેલેયો પોતાને ધેર માતપિતા ઉપર મૂંગુવાળ પડી છે એવી જાણ થતાં જ દફ્તર-પાટી લઈ, ધેર દોડતો આવી, રમતો હસતો માના ખોળામાં સૂઈ જાય છે, બાપ એનું માથું વધીરે છે, ને એ મસ્તકને ખાંડણિયે નાખી -

ખમા ખમા મારા ચેલેયા!

તુને ખમા ઘણી રે મારા ચેલેયા!

- એ હુલરદું ગાતી મા સાંબેલાં મારે છે, એ પ્રસંગની - હુલરડાની પંજિતાઓ સાંભળતાં અમે સહુ રડીએ છીએ. આજ પણ પાછળથી પ્રભુએ ચેલેયાને સજીવન કર્યાની ઘટના મને જરીકે સ્વર્ણતી નથી. એ આખું કથાગીત ચેલેયાની નિર્દોષ હત્યા અને માતાના નિર્દોષ

સાંબેલાંના ઘાવને તાલે તાલે ગવાયેલ 'ખમા! ખમા! મારા ચેલૈયા! તુંને ઘડ્હી ખમા!'ના આ હાલરડાથી મારી બાલસમૃતિને તરબોળ કરી રહ્યું છે :

### [હાલરડું]

એ જુ મારા, પીંગલાના પોઢનાર રે બાળ!

ચેલૈયા, ખમા! ખમા!

એ જુ મારા, ચાંખડીના ચડનાર રે બાળ!

ચેલૈયા, ખમા! ખમા!

એ જુ તારે પીંગલે પડી હડતાલ રે બાળ!

ચેલૈયા, ખમા! ખમા!

ભાઈ મરે ભવ સાંભરે, બેન મુવે દશ્ય જાય,

પણ નાનપણોથી જેનાં માવતર મુવાં

- તેને ચૌદશના વા વાય રે બાળ! - ચેલૈયા૦

ભાઈ ચેલૈયા! ખરે જ જો આ શિયાળ બેટ તારી માભૂમિ હોય, સાચે જ જો આ ખાંડણિયો તારા લોહીથી ખરડાયેલ અબોલ સાક્ષી હોય, તો હું તને કંઢું છું કે સોરઠના લાખો નાનકડા ચેલૈયા તારું ગીત સાંભળી સાંભળી તારી જોડે જ કપાયા ને ખંડાયા છે. તારાં ફૂલની એકાદ કણી પણ જો આ મિઠીમાં ક્યાંક પડી હોય તો આ શબ્દો એને કાને પુકારું છું કે બાવાઓ, સાધુઓ, ધર્મગુરુઓ, તમામનો હજુ તો એ અધોર પંથ ચાલ્યો આવે છે, માબાપોની અંધશ્રદ્ધા હજુય ઘેર ઘેર પોતપોતાના કિશોર કુમળા ચેલૈયાઓનો - શરીરનો નહિ પણ આત્માનો - વધ કરી રહેલ છે, ને સામે બેઠેલું એ માનવભક્તી ધર્મપાખંડ, આહૃતિ પછી આહૃતિઓ પામતું, 'હજુ લાવો! હજુ લાવો!'ની હક પાડી રહેલ છે. એટલે જ ભાઈ ચેલૈયા, અમે તારી વયનાં હતાં ત્યારથી શ્રદ્ધાહીન બની રહ્યાં છીએ, ને અમારી ઓલાદને કાને અમે ધર્મ કે સાધુ પરની શ્રદ્ધાનો એક છાંટોય નથી પડવા દેતા. મને તો એમ ભાસે છે, બંધુ ચેલૈયા, કે નક્કી કોઈ અધોરી જોગીએ તારી અને તારાં ભોળાં માબાપની આવી દશા કરી હશે, પણ આપણા આર્યસંસ્કારો મુજબ આપણે કોઈ વાતનો કરુણ અંત સહી શકતા નથી એટલે બાપડા લોકકવિએ પણ, અત્યારના અનેક નાટકકારોની પેઠે, અંતમાં એ અધોરીમાંથી પ્રભુએ પ્રગટ થઈ તમને સહુને સજીવન કર્યા એવો સુખદ અંત ઠોકી બેસારેલો હોવો જોઈએ.

'સુખી અંત' લાવવાની ઘેલછાએ આપણા ઈતિહાસની અનેક ભેદક કથાઓના જોરને હડ્હી નાખ્યું છે. મહાભારત અને રામાયણ બે જ એ ઘેલછામાંથી બચી છૂટ્યાં છે : કુરુક્ષેત્રના સંહાર ઉપર અમીનો કુંપો છાંટવા માટે કોઈ દેવદેવલું ઊતરતું નથી અને એ શોણિતભીનો વિજય ન સહેવાયાથી પાંડવો હિમાળે ગળવા જાય છે. યુધિષ્ઠિરના ખોળામાં રમતો છેલ્લો પ્રિય બાંધવ શાન એ આપા મહાકાવ્યનો કરુણ નિચોડ છે.

રામાયણના તમામ દિગ્વિજ્યને સૂનકાર કરી મૂકનાર એનું છેલ્લું દર્શય છે : પૃથ્વીમાં સુમાઈ જતી જાનકી અને એને જાલવા દોડેલ રામચંદ્રના હાથમાં પકડાયેલો સીતાનો ચોરલો જ રામકથાનું સમાપ્તિબિંદુ છે, લવકુશનો સુખી રાજવહીવટ નહીં.

હરિશ્ચંદની કથાનો અંત પણ મધરાતે મસાણમાં સગા ઘણીને હથે તારામતીના છુદન વડે જ આવ્યો હોત તો કેવી સ્વાભાવિકતા સચવાત !

નળનું બાહુક-રૂપ સદાને માટે આણબદલ્યું રહ્યું હોત તો કેવી કરુણતા ટપક્યા કરત !

અનેક માનવ-ધર્મોની ભુલભુલામણીમાં અટવાયેલાં નરનારીઓના જીવન-સંગ્રામની આ બધી કથાઓ છે. જિંદગીની નિગૂઢતા ઉપર એ વિચારો જગાડે છે, મંથનો જન્માવે છે, વેદનામાં તપાવીને કરુણરસ સિંચે છે, પ્રજાના કવિઓએ કે કથાકારોએ ભળાવેલું એ સાહિત્ય-ધન છે. શા સારુ એવી પ્રજા-પ્રાણને વલોવવા સર્જયેલી કથાઓ ઉપર ઈશ્વરી ચ્યામતકાર અથવા સુખદ અંતનાં બનાવવી થીગડાં મારવાં પડ્યાં ? ફક્ત લોકોને બે ઘડી રાજુ કરવા સારુ ? ઈશ્વરને કોઈ મનસ્વી અને આપખુદ સર્વસત્તાધીશ તરીકે રજૂ કરવા જાતર ? પાખંડ ઉપર ધર્મનાં પરિધાન ઓળાડવા જાતર ? દુઃખનું આધિપત્ય, ઉર્મિઓની અથડામણો, કર્તવ્યોની ભ્રમણાઓ અને એ તમામમાંથી નીપજતી આ સંસાર પરની હાહકારભરી વિચારણા, એ જ શું ઈશ્વરી રચનાનો સારો સાર નથી ?

શા માટે આપણે હરિશ્ચંદ-તારામતી જેવાં પાત્રોને રાગદ્રેષ્ભર્યા ઋષિઓનાં રમકડાં જ નથી રહેવા દેતા ? શા માટે પાંચાલીના ચીરહરણની પૂરીપૂરી નામોશી એ ડાચા જુગારી પતિઓને કપાળે ચોડાવા ન દેતાં ભગવાનને હીર-ચીરની ગાંસડી લઈ હાજર કરીએ છીએ ? શા માટે ચેદૈયાનું માથું ખંડાવનાર અધોરી પાખંડીને પ્રભુસ્વરૂપની ઓથ આપવી પડી ?

ના, ના, કથાઓ જેવી સીધી ને મર્મવેદ્ધક છે તેવી જ છો રહી. એમાંથી જ આપણા અંતરાત્માઓનાં મંથનો જાગે છે. એ બધી નિગૂઢતાને માનવી યુગયુગો સુધી વિચાર્ય જ કરે, સારાસાર ખેંચ્યા જ કરે, જીવનનું સ્વતંત્ર ઘડતર કર્યા જ કરે, એ સ્વિતિ ઠીક છે. વાતવાતમાં 'ગરુડે ચડીને શામળિયોજુ ચડી આવ્યા'ની ચાવી બહુ બેહૂદી લાગે છે.

ત્યારે, ઓ ભાઈ ચેદૈયા, આ ગંગાતળાવડીની પાળે જ શું એ અધોરી બેઠો હતો ? ન અંહીંથી શું તારી માતા એના રક્તપિતિયા દેહને મસ્તકે ધરીને ગાજતે-વાજતે ગામમાં લઈ ગઈ હતી ?

અત્યારે પણ, ભાઈ ચેદૈયા, ગામોગામની હજારો માતાઓ, ભીતરથી એવા જ અધોરી, પણ બાહેરથી સફેદ દેખાતા સાધુમુનિઓનાં સામૈયાં કરવા જાય છે, ને પોતાનાં બલોયાંની ચીપો સુધ્યાં વેચી વેચી એ ગુરુઓના કોડ પૂરા કરે છે.

## કુકુ...કુ

“આ સામે દેખાય તે સીદીકોડો, ભાઈ, જ્યાં બેટના રાજાએ અસલમાં સાડા સાતસો રાજાઓને કેદ પકડીને રોજ સવારે ‘કુકુ કુ’ બોલાવ્યું’તું.” ઘૂઘા પગી બોલ્યા.

શાબાશ દોસ્ત બેટના રાજા! તારી કથા મેં સાંભળી છે. કોઈ તને વીરમદેવ પરમાર કહે છે, કોઈ અનંત ચાવડો કહે છે. મારા અનુમાન મુજબ તું અનંત ચાવડો જ હોવો જોઈએ. ગુજરાત જેના નામનો ગર્વ કરે છે તે વનરાજ ચાવડાના વંશજોએ છેક ઓખામંડળથી માંડી, પ્રભાસ અને તે પછીના ઘણાખરા સોરઠી સમુદ્રતટ ઉપર પોતાની આજ ફરકાવી હતી, અને ‘ચાવડા’ શબ્દનો અસલ શબ્દ ‘ચૌરા’ અર્થાત્ ‘ચોર’ નીકળે છે તે અનુસાર ઠેર ઠેર સોરઠી કિનારા પર ચાંચિયાગીરી વર્તાવી હતી. તેઓ ફક્ત ચાંચિયાગીરી જ નહોતા કરતા. જ્યાં જ્યાં કિનારો હાથ કરીને રહ્યા ત્યાં ત્યાં તેઓએ મજબૂત કિલ્લેબંદી કરી કાળી હતી. સોમનાથ સરીખાં દેવાલયો બાંધ્યાં હતાં, ને ગજની જેવા વિદેશીઓને કિનારે ઉિતરવા આવતા તુંધ્યા હતા. પોરબંદર અને દ્વારકા વચ્ચેનું અત્યારનું મીંયાળી ગામ એટલે અસલ પ્રભાત ચાવડાના માતબર બંદર મીંયાળીસર પદ્ધતાનું જીવતું ખંડેર : જ્યાં આજ પણ ઊંચાં ઊંચાં શિવબાળવાળાં પ્રાચીન મંદિરો ઉભાં છે. તેની સામે જ ખાડીને કાંઠે કોયલો કુંગર કે જ્યાં દેવી હર્ષદીનું થાનક છે : એમ સોમનાથ પાસે કનકસેન ચાવડાની કનકાવતીનાં ખંડેર છે. એ જ મિસાલનું હું તો આ શિયાળ બેટના અસલ નગરને માનું છું. કેમ કે એ જ જાતના અવશેષો આંહીં પડેલા છે. તું દોસ્ત, અનંત ચાવડો જ હોઈશ. તારાં જહાજો આ સમુદ્રની ચોકી કરતાં હશે, ને ચાંચ, પટવા, ત્રવડા વગેરે કંઠાળી ગામોના કોળી જાતિના પોતાના ચૌર-સૈન્યને દરિયામાં પસારી તું લુંટોય ચલાવતો હોઈશ. તારો કાળ મને નવમા સૈકાનો લાગે છે. તારી સર્વોપરિ મોજ, બસ, સોરઠી રાજ્યપતિઓને પ્રથમ મિજબાની જમવા સારુ તારાં વહાણોમાં નોતરીને પછી વહાણને આ ‘બેટ’ ઉપર વહેતું મૂકવાની હતી! પક્ષીઓમાં પણ તારા જેંવી જ પ્રકૃતિનું એક મોજીલું પક્ષી છે. એનું નામ કાળો કોશિયો. હોય છે તો એક મોટી ચકલી જેવડો, પણ એની સર્વોપરિ ધૂન બસ એ જ છે, કે મરતાં પહેલાં એક વાર એકેએક જાતના પંખીનું અક્કેક પીંછિદું તો ખેંચવું, અને એ તમામ પીંછાં વડે પોતાનો માળો શણગારવો! આવો મસ્તાન કાળો કોશિયો જ્યારે પોતાની ખંડળીની વસૂલાત સારુ જબ્યર સમજીની પાછળ દોટ દેતો

હોય છે, ને સમળી એનાથી ત્રાસ પામીને નાસતી હોય છે, ત્યારે દશ્ય જોવા જેવું બને છે. તારું પણ એવું જ હતું, દોસ્ત અનંત ચાવડા!

ને પછી? આ સીદીકોઠો નામે ઓળખાતા ખડક ઉપર શું તું એ તમામ મૂછાળાઓને કઠ-પાંજરામાં પૂરી પ્રભાતે પ્રભાતે ‘કુકડુ...કુ!’ બોલાવતો! દરેક રાજા શું એટલો બધા નમાલો, કે મોતની બીકે માથું નમાવીને, કૂકડાની માફક તારી સમુખ ‘કુકડુ કુ’ કરતો! એ બધા - લોકવાયકા મુજબ સાડા સાતસો, અથવા તો પછી ભલે ને કેપન બેલ નોંધે છે તે રીતે માત્ર છિત્રીસ - પણ એ બધા જ શું આ પાંજરાના કેદી-જીવનને એટલું બધું મીઠું ગણતા કે રોજ પ્રભાતનું આટલું અપમાન પી જઈને પણ દેહ રાખવાનું પસંદ કરતા? એ શું આટલી પ્રાચીન પરંપરા છે? નવીન કશું જ નહીં કે?

અને સહુથી પામર નીકળ્યો વામનસ્થલીનો રા’ કવાટ: ગરવાનો ધરણી મહીપાલદેવ : નવઘણ સરખા વીરનો દાદો : જેના બાપ ગ્રાહરિપુએ ઉપરકોટ જેવો કિલ્લો ઊભો કર્યો. એ બાપડો રા’ કવાટ પ્રભાસને દરિયે આ ચૌરરાજ અનંત ચાવડાનું આતિથ્ય ચાખવા ગયો ને સપડાઈ જઈ પેલા સાડા સાતસો ભેણો ‘કુકડુ કુ’ પોકારતો થયો. અને એ ‘કુકડુ કુ!’ કંઈ જેવુંતેવું? એ તો રીતસરનો મુજરો કરવાનું ‘કુકડુ કુ!’

કર મજરો કવાટ! (તુંને) આજે રાજા અનંત,  
(તો તો) પાછો મેલું પાટ, (તુંને) પરણાવી ગરનારપત!

- એ આ કથાનો દુહો છે; રાજા અનંત ચાવડો રોજ પ્રભાતે રા’ કવાટને કહેતો કે ‘જો તું મારી સામે ગરદન ઝુકાવી, કૂકડાની પેઠે પ્રભાતની નેકી પોકારી મને સલામ ભરીશ, તો હું તને કોઈક દિવસ પરણાવીને પછી પાછો રાજગાઢી પર બેસારીશ, બચ્યાજી! બાકી એ કવાટના - એ મહીપાલદેવ યદ્વિકણીની વીરતાનાં તો શાં શાં વખાણ કરીએ? પાંજરે જીભ કરડીને મરી ન જઈ શક્યો એટલે, તળાજાના રાજા ઊગા વાળાને એઝો છાનો સંદેશો પહોંચાડ્યો કે -

તું કહેતો તે પાજ્ય, તાળી જે તળાજાધણી!  
વાળા હવે વગાજ્ય, એકે હથે ઊગલા!

‘હે ભાણેજ ઊગા વાળા! (અથવા કોઈ કહે છે કે કવાટ ભાણેજ ને ઊગો મામો) મેં તારી સાથે બહુ વેર બાંધ્યું છે. તેં કહું હતું કે સાચી વીરતા હોય તો એક હાથનીય તાળી પડી શકે. મેં આજ સુધી તારા શૈર્યનો તેજ્જેષ કરેલ છે. પણ હવે તું આવ, ને બતાવ કે એક હથે તાળી કેમ પડે છે.

ઊગો બિચારો મામાની અવદશાની દયા આણીને શિયાળ બેટ પર પડ્યો. એની કનેય તળાજ, સરતાનપર, ઝાંઝમેર વગેરે સમુક્તીરની ખારવા-ઝોજ હોવી જ જોઈએ. નહીં તો અનંત ચાવડા જેવા સમર્થ સાગરરાજના નૌકાસૈન્યને શિક્ષસ્ત આપી, બેટ ફરતો ઊભેલો એ બદિષ દુર્ગ ભેદી એ અંદર કેમ જઈ શકે?

પણ હું તો આપણા ‘કુકડુ... કુ’ કવાટ ભાઈની વીરતા બતાવવા માગું છું. અનંત

ચાવડાને રોળી નાખીને ઉગ્ગો દોડતો આવ્યો એ પાંજરા ઉપર. ગિરનારપતિ મામાની આ અપમાનિત દશા દેખીને એની સબૂરી ખૂટી ગઈ. પાંજરાનું બારણું ખોલવાની ચાવી હ્યથ કરવા જેટલો વિલંબ પણ એનાથી ન સહેવાયો. એણે ઠેક મારીને પગની પાટુ લગાવી એ કેદખાનાના કમાડ ઉપર. કમાડ ઉધારી પડ્યું.

પણ એ પાટુ સહેજ બંદીવાન મામા કવાટને અડકી ગઈ. અથવા અડકી ન હોય તો પણ એની બાજુએ આમ કોઈના પગની લાત ઉછળો એ કંઈ જેવું-તેવું અપમાન છે ક્ષત્રિય વીરનું!

અહ૱હ! બારણું ઉધડતાં જ મામા કવાટનું ક્ષત્રિતેજ સળગી ઉઠ્યું: ‘હે..એં !!! તં ઉગલે ઉઠીને મને પાટુ મારી! મારું ગૌરવભંજન કર્યું! ઉગા! ઉઝ! ઉગલા! આનો બદલો હું લઈશ! જોઈ લેજે! (બેશક, નાટકમાં જે વીરત્વ આલેખાયું છે, તે તો મારી કલમથી કેમ જ આંહીં રજૂ થઈ શકે?)

ઉગ્ગો વાળો મામાને સમજાવે છે : પોતાની અધીરાઈનો દોષ - ઈરાદાનો નહિ - કબૂલ કરે છે. પણ યદ્વિવંશી મામા મહીપાલદેવ પોતાના તુરણ ભાણોજ ઉગલાની આ ધૂષ્ટતા શે સહી શકે? (એ તો અનંત ચાવડાનું ‘કૂકડુ કૂ’ જ સહન કરે.)

એક વાર પાંજરે પડ્યો પડ્યો ઉગાને આવી કાકલૂદીઓના સંદેશો મોકલનાર -

સો રાજા બંધી પડ્યા, કઠ પાંજરે કવાટ;  
વાળા, જોઉં વાટ, એક તાહરી, ઉગલા!

ઇતી ઉપર શેરડો, માથા ઉપર વાટ,  
જાણજે વાળા ઉગલા! કઠ પાંજરે કવાટ.

તું કહેતો તે આવ, તાળી જે તળાજાધણી!  
વાળા, હવે વગાડય, એકલ હાથે ઉગલા!

આવા આજુજુના સૂર કાઢનાર ગરનારપત હવે પાંજરું ઉઘડ્યે માટી થયા. વામનસ્થલી જઈને, જરા સાજતાજા બની, પદ્ધી મોટી ફોજ લઈ એ ક્ષત્રિ વીર પોતાના ઉગારનાર યુવાન ઉગા વાળા ઉપર ચડ્યા, અને બાબરિયાવાડના ચિત્રાસર ગામની પાસે કુરુક્ષેત્રનાં રક્ત રેલાવીને ભાણોજનો વધ કર્યો.

## દરિયાનાં દેવદેવીઓ

એ તો હવે ગયા : એ કૂકડુ કૂ કરાવનારા અને કરનારા, તમામ ગયા. રહ્યાં છે ફક્ત 500-700 ઉદ્યમવંત કોળી કુટુંબો. આ ખારવાઓ ‘બેટ’ને આરે બેઠા બેઠા જૂનાં વહાણો સમારે છે, નવાં બનાવે છે, કરાંચી, મુંબઈ, ને કાલકોટની સફરે ચેત છે, વહાણો ચડવા અશક્ત હોય તે કુટુંબો જાફરાબાદ જઈ મર્યાદી મારી ગુજરાતો કરે છે, બેક ગાઉની બેટ-ધરતીમાં અક્કેક-બબે વીઘાનું વાવેતર પણ અક્કેક કુટુંબને વાલ, રીંગાણાં, મૂળા વગેરેની થોડી થોડી પેદાશ આપી રહે છે, જૂની વાવો એને પીવાનું જળ પૂરું પડે છે. દરિયાનું નીર એને માછલાં આપવા ઉપરાંત, એના ખાટલાઓના માકડને પણ પોતાનાં જળચરોને મુંયેથી વીણાવી દે છે, અરધા માઈલનો સમુદ્ર ઓળંગીને એની ખારવણો સામે ધરતી-કંઠે બળતણનાં લાકડાં શોધવા જાય છે. (બેટ શિયાળમાં બળતણનો ખરો ત્રાસ છે, ઝડી કે વન જરીકે ન મળે.)

એ વિજોગણ ખારવણોનું નજીકમાં નજીક હટાણું દરિયારસ્તે પાંચ ગાઉ આધેરા બંદર જાફરાબાદથી હાટડીઓમાં : એની બીમારીની દવા કરનાર દુલા સવાઈ પીરનું નામ અને કોઈક રક્યોખડક્યો હજામ : એનાં બાળકોની નિશાળ ફક્ત દરિયાની છાતી ઉપર : એનો ખરો ઉત્સવ એક હોળી.

“અરે ભાઈ, તમે હોળી ટાજો આંઈ આવજો એટલે અમારાં લોકની ખરી મસ્તી જોઈ શકશો. આજ તો અમારા તમામ નાનામોટા જજા વહાણો ચડી ગયા છે, પણ હોળી માથે એ એકોએક આવી પોગવાનો. એક પણ જજા બા’ર નહીં રે’વાનો. પંદર દિ’ અમે સૌ માણાણું : દારૂડો પીશું, ગાંડાતૂર બનશું, ગાશું, ડાંડિયા લેશું, અમારી વાતું ને અમારાં ગીતો તે દિ’માં નીકળશે. આજ તો બેટ ખાલી પડયું છે. અમારા ખરા જજા ક્યાં છે?”

“દારૂ બહુ પીઓ છો?”

“હા, તે ટાજો પીવાના. અરે બાપડે ગોરખમદીને બાવેજીએ લાગ્ય મે’નત કરી’તી ગામને દારૂ છોડાવવાની! કેટલાક દિ’ તો ટક્યું, પછી અમારા જજા ન રહી શક્યા. ને બાવેજી ગામ માથે કોચવાઈને આંઈનું પાણી હરામ કરી ચાલ્યા ગયા છે.”

આ દારૂની વાત ઉપર તો હું ચાલ્યો આવું છું. બાપડા ગોરખમદીના બાવાળ નાહક ઊંડા પાણીમાં ઉતર્યા. ખરું ડહાપ્યણ તો દીકું દુલા સવાઈ પીરમાં અને એના મુંજાવરમાં.

આવી કશી લોકોદ્વારની કડાકૂટમાં એ પડવાના જ નહીં. બેટના નિર્જન છેડાની છેલ્લામાં છેલ્લી અણી ઉપર, મોટા દરિયાની છોળો જ્યાં અથડાય છે તે ભેખડે, અખંડ એકાંતમાં બે કબરો છે : એક સવાઈ પીરની ને બીજી એનાં બહેનની. માતબર થાનક છે. શા સારુન હોય? હિંદુ ને મુસલમાન, માછીમાર ને વાણિયા, વહાણધણી કે ખારવા, તમામની માનતાઓ આ દરિયાના અધિષ્ઠાતા મનાતા દેવને અહનિંશ ચાલી જ આવે છે. દરિયાની સાથે હંમેશાં ‘પીર’નો જ ભાવ જોડાયેલો છે. ‘દરિયાપીર’ તો ઘણું જૂનું નામ છે, કોણ જાણો કેમ, પણ પીરાજાનું ને દરિયાનું વાતાવરણ એકબીજાથી જે મેળ પામે છે, તે મેળ બીજાં દેવીદેવતા સાથે દરિયાને મળતો નથી. નહીં તો હિન્દુઓએ કંઈ કમ દેવસ્થાનાં ઊભાં કર્યાં છે આ સાગરતીર ઉપર? ઠેર ઠેર મહાદેવ : ગોપનાથ, ઝાંઝનાથ, ચાંચુડા ને સોમૈયા સરીખા : ઠેરઠેર ઈશ્વરાવતાર, વારાહરૂપ, જગત અને બેટ શંખોદ્વારના એકસામટા કૃષ્ણ-કુટુંબનું જૂથ. પણ એ બધાં કેમ દરિયાઈ વિભૂતિથી મેળ નથી લેતાં?

મને લાગે છે કે પીર એટલે મૃત્યુની પ્રતિષ્ઠા. દરિયો પણ જીવન કરતાં મૃત્યુનો જ ભાસ વધુ કરાવે. એ બંનેના વાતાવરણમાં કંઈક નિગૂઢ, ગેબી, અનંત, પરલોકનું તત્ત્વ પડ્યું છે, અવસાનનું મૌન છે, અફસોસની શાંતિ છે, કરુણાભરી નિર્જનતા છે, લોબાનના ધૂપમાંથી પથરાતી જે ગમગીન ફોરમ દરિયાના અનંત સીમાડા ઉપર ચાલી જાય છે તે ફોરમ ધી-તેલના ધૂપદીપ, અગરચંદનના લેપત્રિલક, સિંદુર કુમકુમના સાથિયા, આંગી રોશનીના ઝક્કમાળ અને બીજા મંદિરિયા ઠાઠમાઠમાં નથી. દરિયો જાણો મહાકાળ છે. એનાં ઊછળતાં અથવા મૂંગાં પડેલાં પાણી હંમેશાં કોઈ શબ ઉપર ઓળાડેલ સોડચની જ યાદ આપે છે. કેંક વહાણો અને ખલાસીઓના મૃત્યુદેહ એ કફનની નીચે પોઢેલા છે. માટે જ મને લાગે છે કે પીર અને સાગર વચ્ચે કોઈક પ્રકારની તદ્વપત્તા હું.

ને આ પીરની કલ્યાણમાં ભયનું તત્ત્વ ઓછું છે. પોરબંદરને દરિયે પેલા મિયાણી પણુણનાં ખંડિયેરની નજીક, ખાડીને સામે પાર કોયલો કુંગર છે, તેની ‘કોયલાવાળી’ દેવી હર્ષદી આઈનો ઈતિહાસ તો ભયાનક છે. એક વાર એ ‘કોયલાવાળી’ માતાનું બેસણું એ કુંગરની ટોચે હતું. પણ સમુખ પડેલા મોટા દરિયામાં જે જે વહાણો નીકળતાં ને આ દેવીની કરડી નજરમાં આવતાં, તે બધાં પાણીમાં ગરક બની જતાં. પછી બાપડા કુચ્છના પરગજુ શેઠ જગડુશાએ માતાજીને વીનયાં કે ભલાં થઈને કોઈ વાતે તમે ત્યાં શિખરે બેસીને વહાણો ભરખવાનું છોડીને નીચે તળેટીમાં પધારો? આઈ કહે કે મારે પગલે પગલે અક્કેક પાડાનો ભોગ પૂરો પાડ તો હું નીચી ઉત્તરું. ‘એમ તો એમ!’ કહીને જગડુશાએ પાડા એકઠા કર્યા, પગલે પગલે અક્કેક નિર્દ્દેશ પાડો વધેરીને આઈને નીચે લીધાં, પણ છેલ્લાં ચાર પગલાં બાકી રહ્યાં ત્યાં પાડા ખૂટી પડ્યા! હવે? આઈ કહે કે આ ને આ ઘડીએ ભોગ લાવ, નહીં તો હું પાછી ચડી જઈશ! જગડુશાને સુભાગ્યે એની સાથે પોતાનો દીકરો ને દીકરાવહુ હાજર હતાં. ને ઘણાંખરાં કુટુંબમાં આજ પણ છે તે મુજબ દીકરો ને દીકરાવહુ તો ઘરનાં પશુ (તે પણ પાછાં બલિદાન ચડાવવાનાં પશુ)

જ તે કાળેય મનાતાં હશે. આજે એ જોડિયો બલ્યા સમાજના દાનવને ચડે છે, તે કાળે દેવદેવીને ચડતો. ટુકમાં, પછી માતાજીનાં બે પગલાં આ પુત્ર અને પુત્રવધૂનાં શોણિતે છંટાયાં, ને દેવી તૃપ્ત બનીને તે કાળથી હવે તળેટીમાં જ બિરાજેલ છે. દરિયા આડો કોયલા કુંગરનો પડદો દેવાઈ ગયો છે. એટલે હવે ખારવાઓનો જળમાર્ગ સલામત બનેલ છે. (કોયલા કુંગરની ટોચે જે પ્રાચીન હર્ષદી મંદિર ખાલી પડ્યું છે, તે ખરેખર પુરાતત્ત્વના શોધકોએ નજર કરી લેવા જેવું છે.)

આ હિસાબે પીરની બાપડાની રંજાડ છે કશીયે? ભેંસલાને માથે રાત રહેનારને અબુ પીર ભવે ફગાવી દી છે, પણ એનું ફગાવવું એટલે માણસના ફોટોઝોટા વેરી નાખવા જેવું નહીં. સવારે જાગ્રત થયેલો માણસ જુઓ તો પોતે કોઈક સલામત ધરતીમાં નિરાંતે પડ્યો હોય!

ગીર્યક પુરાણકથા માંહેલો જળદેવ નીરિયસ ભાભો પણ એવો જ ભદ્રિક પીર છે. શાંતિમય સાગરજળનો એ અધિષ્ઠાતા પોતાની પચાસ નાની છોકરીઓનું જૂથ લઈને દરિયે ભસ્યા કરે છે અને શ્રદ્ધાળુ નાવિકોને રક્ષા આપે છે, સવાઈ પીરને તિશેય આવી જ આસ્થા છે.

પાંચેક વર્ષો પર મેં દ્વારિકાથી આરંભડાને યાત્રાપંથે થઈ બેટ શંખોદ્વારની મુસાફરી કરી હતી તે અત્યારે યાદ આવવાનું બીજું એક કારણ મળ્યું. આંહીં થોડાંક જાડ એવાં ઉભાં છે, કે જેની એક બાજુએથી ડાળપાંદડાનું ઝુંડ જાણો કે સોરાઈ ગયું છે ને વધતું નથી એટલે બીજી એક બાજુએ જ વધતી જતી ઘટા એવો જ્યાલ કરાવે કે જાણો વૃક્ષ કોઈ અમુક દિશામાં નમી રહેલ છે. દ્વારિકાથી આરંભડા સુધીની સરક પરનાં તમામ વૃક્ષોની આ હાલત છે. બેટ શંખોદ્વારના પુરોહિતો આવા દશયનો ઉપયોગ ન કરે એ તો કેમ બને? તેઓએ યાત્રિકોને ઠસાવ્યું : દેખ્યું કે ભાઈઓ! દ્વારિકાપુરીથી આ તમામ વૃક્ષો પણ બેટ પ્રત્યે જ અભિમુખ બની રહેલ છે, એ પણ યાત્રાળુઓ જ છે, ને જાણો કે બેટના કૃષ્ણધામને અહોરાત વંદના દઈ રહેલ છે. જુઓ તો ખરા આ વનસ્પતિ જીવોનીય પ્રભુભક્તિ!

કાનમાં કહું? સમુદ્રનો ખારો વાયુ એ દિશામાં વાઈ વાઈને એક બાજુએ જાડની વૃદ્ધિ થવા દેતો નથી. તે જ આ 'વૃક્ષ-વંદના'નું વૈજ્ઞાનિક રહસ્ય છે.

પણ મને આશ્ર્ય જ એ થાય છે કે આ શિયાળ બેટની અંદર પ્રાચીન ખંડેર, ચેલેયાના અવશેષ, આટલી ફક્કડ પ્રતિમાઓ, આવાં વંદનશીલ વૃક્ષો, અને આવી વહેમભીરુ અજ્ઞાની વસ્તી વગેરે બધી વાતની અનુકૂળતા છતાં કેમ કોઈ પુરોહિત આંહીં યાત્રાધામ ઉભું કરવા પહોંચ્યો નથી? કોઈક દ્વારિકા, બેટ કે સોમનાથની માતબર પેઢીએ કેમ આંહીં પોતાની 'ભાન્ય' નહીં નાખી દીધી હોય? હૈયાફૂટ્ય ગોરખમણીવાળા સાધુએ આવું કશું કરવાને બદલે નાહક દારુ છોડાવવાની હિલચાલ કરી!

આવા, લગભગ જાતે જ આવીને આંહીં જાત્રાધામ સ્થાપવાના લલચામણા વિચારો

મનમાં ચાલી રહ્યા હતા, ત્યાં તો ઘૂઘા પગીએ કદ્યું કે “ભાઈ, જર ચાલો હવે. મણવો તિયાર છે. ને જાફરાબાદ અરધી જ કલાકમાં પુગાડે તેવો વાવડો છે, માટે ઊઠો!”

“ને શેઠ!<sup>1</sup> જુવાનોએ કદ્યું : (‘શેઠ’ સંબોધન મને હંમેશાં ચોકાવે છે. કેમ કે એની પછવાડે ‘કોઈક ધૂતવા લાયક ધનિક’ હોવાની કલ્યાણ ઊભેલ હોય છે. બાપડા અમૃતલાલભાઈને<sup>1</sup> એનો કપરો અનુભવ છે!) “શેઠ, તમે કાં હોળી માથે આવો, ને કાં આવો જેઠ મહિને. જેઠ મહિને અમારો એકોએક જણ આવી જશે, અમારાં તમામ વાણુંને અમે ઘસડીને આંહીં ઊંચે ચડાવી દેશું. ને પછી અમારાં વીવાવાજમ હાલશે, તે ઠેઠ બળેવનો દરિયો પૂજુને પાછા વાળે ચડી જશે અમારા જુવાનો.”

---

<sup>1</sup> અમૃતલાલ શેઠ.

## ‘મોતી બૂજ્યું મોરણી’

“બસ? વિવાહ પછી માસ-પંદર દિવસમાં જ પાછા મુસાફરીએ ચડશે તમારા પરણોલા જ્યવાનો?”

“ચેતે નહીં તો ખાય શું? મહિના-બે મહિનાની અક્કેક ખેપ કરે ત્યારે માંડ આઈ-  
દસ તૃણિયા મળે એને વેપારી કનેથી..”

અપન સિંકલેરનું 'ધ જંગલ' યાદ આવ્યું. શિકાગો શહેરના એ વિરાટ કલ્યાણનો મજૂર યુગ્ગિસ અને એની પરણેતર પોતાના લગ્નછિવસે પણ દિવસભર કારખાને મજૂરી જેંચી આવીને રાતે પરણે છે, આખી રાત અનાં સગાંવહાલાં અને ઓળખીતાંના સમુદાય જોડે એક હોટેલમાં નાચગાન ને બાળપીણિમાં ગુજરે છે, પરોઢીયે થાક્યાંપાક્યાં, શિર ઉપર એ એક રાતના ખર્ચની ભરપાઈ કરવાની ફિકરની ગાંસડી લઈ, પોતાના કાતરિયાનું તાણું ઉઘાડે છે, અને તુરત જ કારખાનાની વીસલ વાગે છે. નવદંપતી મજૂરીએ ચાલ્યાં જાય છે. આ તેઓની લગ્નરાત્રિ!

જીવ છ. આ તથાં લગ્નરાન! ખારવાઓનાં પણ લગભગ એ જ જાતનાં લગ્ન : દરિયાઈ મૃત્યુના કફન નીચે  
પોઢતું દંપતી-જીવન.

“તમારે વિવાહનો સંબંધ કેટલે દુર થાય?”

“આ બેટ, ચાંચ્ય, પટવા ને ત્રવડા : ફક્ત આ ચાર ગામની જ અંદર. એથી બહાર નહીં.”

નહીં.” બરાબર છે. મૃત્યુની સોઝવમાં પોતાની પુત્રીઓનો સુવાડવા આ ચાર ખારવાઈ ગામો સિવાયનાં બીજાં કોણ લોકો આવે? વહાંથે ચક્કો ખલાસી પાછો તો ધેર પહોંચે ત્યારે ખરો. પ્રત્યેક વિદ્યાય છેલ્લી જ સમજવાની. પ્રત્યેક મિલન એક નવો અવતાર. એ ચિરવિયોગીઓની જંખનાનાં ગીતો તો હું કંતપરના વર્ણન ટાકો જ આપીશ. નાવિકોની સ્ત્રીઓની નીતિ ઉપર આપણે ‘ધરતીનાં પરમ પવિત્ર મનુષ્યો’ કેવા કટાક્ષો કરીએ છીએ પણ હું ત્યારે જ છાપીશ.

પણ હું ત્યાર જે છાકારા.  
અત્યારે તો નાવિક જીવનની આ કરુણતામાંથી ટપકેલ એક આંસુ સમાન ઘટના  
મારી સામે તરવરે છે, શિયાળ બેટની ધર્મશાળાના હોરા ઉપરથી બરોબર સમુખના બિન્કુ  
ઉપર, સમુદ્રના સામા પારની એક ઊંચી ટેકરી ઉપર ચાંચુડા મહાદેવની દેરી છે. બેટ

અને ચાંચુડા વર્ચ્યે બે જગાં દૂબ્યાં છે. એક તો બેટની ખલાસી-નાર મોરણી, ને બીજો ચાંચુડાનો પૂજારી બાવો ભભૂતગર :

ચાંચુડે ચડવા જાય; (મારું) પાંજર પોત્યું કરે;  
(ત્યાં તો) બેટના બારામાંય, મોતી બૂડચું મોરણી.

[અર્થ : મોરણી! રાત્રિના અંધકારમાં તું બેટથી ઉત્તરીને બે તુંબડાં બાંધીલ વાંસ ઉપર તરતી તરતી આવતી હોઈશ એમ સમજને મારું દેહ-પાંજર આ ચાંચુડાની ભેખડે તને નિશાની કરવા ચે છે. આ નિશાનીને આધારે રોજ રાતની કાળી મેઘલી ઘટામાં, ખાડીના ચાહે તેવા તોફાનને વીંજી તું આંહોં આવી પહોંચતી. પરંતુ આજ તો મારે નિશાનીનો દીવો ધરી રાખીને વાટ જોયા જ કરવી પડી. કેમ કે મારું મોતી મોરણી તો બેટના બારામાં જ દૂબી મરી.]

મોતની અચોક્કસ લાંબી સફરો ખેડતા કોઈ ગરીબ નાવિકની પરણોતર ઓ મોરણી! તું શું તારા નિત્યના વિજોગથી કંટાળી ગઈ હતી? સામે કાંડે બળતણનાં કરગઠિયાં વીણવા જતાં શું તને ચાંચુડાના પૂજારીની પ્રીત કંખી હતી? મોરી રાતે વાંસડાને બે છેડે બે તુંબડાં બાંધીને તને આધારે આટલો લાંબો ને ઊંડો સાગરપટ ચૂપચાપ તરી જવાનું કૌવત તને કોણ આપી રહ્યું હતું? તારા પ્રત્યેક રાત્રિના ખ્યારને શું તું સામા છાબડામાં તારો પ્રાણ મૂકીને આ કઠોર વિશ્વની બજારમાંથી ખરીદતી હતી? અમે પાખંડી લગ્નનીતિના (મેરેજ પ્લસ પ્રોસ્ટિટ્યૂશનના) પલેપલ ભ્રષ્ટ બનનાર ઉપાસકો, અમે કેવળ અનુકૂલતાને અભાવે ઊગરી રહેનાર, લોકાપવાઢના ભીરુ શિયળવંતો, અમે દ્રવ્ય, વિક્રતા અને બાપદાદાની આબરુને જોરે સુંદર સ્ત્રી-શરીરો ખરીદનાર વિલાસીઓ, તને પ્રતિરાતનાં સાગરજળ પાર કરનારીને એક નીતિભ્રષ્ટ ખારવણ કહીએ છીએ, ઓ મોરણી! તારી એ ભ્રષ્ટતાની પછવાડેય કેવું ભીષણ ક્રત ઊભું હતું!

પણ તારાં છુપાવેલાં વાસ-તુંબડાં એક દિવસ ઉઘાડાં પડી ગયાં. તારી સાસુએ દગ્ગો કર્યો. છાનામાનાં એ તુંબડાં ખસેડી લઈ, તેની જગ્યાએ માટીના બે કાચા મોરિયા બાંધી દીધા. એ અધરાતને અંધારે દરિયાના મરણપછાડા વર્ચ્યે તારા ખ્યારના વલવલાટે તારા કલેવરને જીંકી દીધું. માટીના મોરિયા તારે એક જ શેલારે ઓગળી ગયા. તું ખારવાની દીકરી છતાં શું તરવાનું શીખી નહોતી? તારું શરીર તળિયે જઈ બેદુ. અને તારો સામા કિનારાનો પિયુ પણ તારો નાશ થયો સમજ લઈ, ચાંચુડાની ધારેથી દરિયામાં ખાબકર્યો. ન પોતે પુરુષ હોઈ રખે કદાચ પડવા પછી જીવતરની લાલચ લાગી જાય તે બીકે હાથપગ દોરીથી પકડી લઈને જ પડયો. તમારી જળ-સમાધ ઉપર કોઈ દેરી ચણાઈ નથી, માત્ર કોઈક લોકકવિની કવિતાએ ચાર-છ દુહણી ખાંબી ચણી. તેમાંથી એકાઉ આવો દુહો હાથ લાગે છે કે -

ચાંચુડે ચડવા જાય, (મારું) પાંજર પોત્યું કરે,  
(ત્યાં તો) બેટના બારા માંય, મોતી બૂડચું મોરણી.

સિંહુ નદી ઉપર પણ એક આવી જ રાત અંધારી હતી. અને હરરોજ રાતે સિંહુનાં ભમ્મરિયાં જળ બેદીને કુભાર-કન્યા સુહિણી પોતાના સમાજબાતલ પિયુ મેહાર (ગોપાળ)ને મળવા સામે પાર જતી હતી. એને પાર લઈ જનારા પાકા ઘડાને પણ એની માતાએ એક રાતે બદલી લઈ કાચો ઘડો ધરી દીધો હતો. ને એ ઘડાએ મધ્યજળમાં દૂબતી મૃકેલી દીવાની સુહિણી સામા પારથી પિયુના પાવાના સૂર સાંભળતી સાંભળતી -

દિરી ઘરો હાથ કરે બોર્યા ઈ બાંહુ,  
વેચારીય વંડુ કિયું, વિચ ધરિયા ધાઉં,  
વરજ સાડ! પાંઉ, તંકું તકી આંદ્યાં.

**અર્થ :** પ્રથમ ઘડો હાથ ધરીને તરી; પછી ઘડો ઓગળી જતાં બાહુઓ (ભુજાઓ) બોળીને તરી; છેવટે દૂબતાં દૂબતાં દરિયામાંથી (સિંહુ નદીમાંથી) વચ્ચેથી એ બિચારીએ ધા ઉપર ધા દીધી કે 'ઓ વલાદ સાડ! ઓ મેહાર! તું પાછો વળી જજે, કેમ કે મને પાછીનાં હિસ્ક પશુઓએ દેરી લીધી છે.]

- એમ પોકારીને સુહિણી જળમાં સમાઈ. મેહારે પણ એની સંગાથે જ દરિયાની આરામગાહ બિધાવી.

એ સુહિણી અને તું મોરણી, બેઉ શું એક જ માર્ગનાં મુસાફિર હતાં? ત્રીજું કોઈ જુગાલ તમારે પંથે પદ્ધ્યું છે ખરું?

હા, હા, દૂર, દૂર, કોઈક કાળાન્તર પરના ભૂતકાળમાં : અને સ્થળને હિસાબે પણ પારંપાર આદે, એશિયા અને યુરોપ એ બે ખંડોને ફક્ત અરધો જ માઈલ અળગા રાખીને પડેલી હેલેસ્પોન્ટની સામુદ્રધુનીનાં જીવલેણ વમળોની અંદર.

અંહીં મોરણીનો પ્રેમિક ચાંચુડા મંદિરનો પૂજારી હતો, ને ત્યાં લીએન્ડરની પ્રિયતમા હીરાં દેવીના દેવાલયની પૂજારિણી હતી. યુરોપ ખંડના છેલ્લા ધરતી-બિન્દુ પર ઊભેલ એ જોગેશ્વરીને મંદિરેથી હીરાંની આંખો હેલેસ્પોન્ટને સામે તીર રહેતા જુવાન લીએન્ડરને જ શોધતી હતી. યુરોપ-એશિયાની વચ્ચે ઘારના ત્રાગડા એ ચાર આંખો નિરંતર કાંત્યા કરતી હતી. સાંકડી સામુદ્રધુનીમાંથી આવ-જા કરતાં અસીમ સાગરનીર અહોરાત એવા તો પછાટ મચાવતાં કે ન ત્યાં મછવો ચાલી શકતો, ન ત્યાં માનવી તરી શકતું. અરધા જ માઈલને અંતરે ઊભેલ બે પ્રેમીઓની વચ્ચે એ સાંકડી નાળ હજાર યોજનનું છેટું પાડીને દાંત કચ્કચાવતી હતી.

પરંતુ ઘારના સામર્થ્યો ક્યાં સંકટ ગણકાર્યો છે જગતમાં! હંમેશ રાત્રિએ આ કંઠેથી લીએન્ડર ઝંપલાવી પડતો, ને સામે તીરેથી પૂજારિણી મશાલ પેટાવીને દેવાલયના બુરજ ઉપર ઊભી રહેતી. મશાલની ટમટમતી તારલ-જ્યોતને અંધાણો અંધાણો લીએન્ડરની ભુજાઓ એ વિકરાળ લોઢને ભેદી ભેદી ચાલી જતી. પ્રેમીજનો રોજ ને રોજ રાતે એ રીતે દેવીના થાનકુમાં ભેળાં થતાં. પરોઢના અંધકારમાં જ લીએન્ડર પાછો એશિયાને તીર તરી પહોંચતો.

સોરઠને તીરે તીરે : 'મોતી બૂજ્યું મોરણી'

પરંતુ એક રાત્રિએ સામુદ્ધુનીનાં તોણન એશિયા-યુરોપ વચ્ચેના આ ગ્રાગડાને તોડવાનો નિશ્ચય કરીને જ ચગયાં હતાં. પોતાના દેહને ઊંચે ઉપાડી ઉપાડીને પછાડી ભુક્કો કરવા ઉન્મત્ત બનેલ તરંગોની સામે લીએન્ડરે પોણી રાત સુધી મુકાબલો કર્યા કર્યો. મોજાંના મારથી છુંદાતી એની છાતી ગોટો વળી જતી હતી. તરંગોની ચૂડ એની પાંસળીઓને હમણાં જાણે ભીસ્સી નાખશે એમ એનો શાસ નીકળી પડતો હતો. છતાં લીએન્ડરનો ઘાર પરાજ્ય કબૂલતો નહોતો. કારણ? કારણ કે સામે પાર મશાલની દીવડી હજુ તબકતી હતી. વમળમાંથી વારંવાર માથું ઊંચું કરીને લીએન્ડર એ જ્યોતને જોઈ લેતો હતો. જ્યોત દેખાયા કરી ત્યાં સુધી એણે હામ હારી નહીં.

પરંતુ હવે થોડુંક જ અંતર રહ્યું છે, બેચાર છલંગે કિનારો હથ કરી લઈશ, ને પછી આ વેરણ સામુદ્ધુની એના લોઢરૂપી દાંત કચકચાવતી જોઈ રહેશે: ત્યાં તો દીવો ઓલવાયો. વાવાજોડાના ઝપાટા વચ્ચે મશાલને પોતાના પાલવની આડશે માંડ માંડ સાચવી રહેલી પૂજારિણીની ધીરજને પવને ધૂળ મેળવી. એટલે લીએન્ડર કિનારો હથ કરવાની આશા ગુમાવીને મોજાંને શરણે થઈ ગયો.

પૂજારિણી હીરાં એ બુઝાયેલી મશાલ સાથે ત્યાં ખડક પરના મંદિરે જ થીજી ગઈ. માન્યું કે આ તોણનની ભેખડ ઉપર એક ગૌર માનવકલેવર પડ્યું હતું. ભેખડે બાળેલાં ચેત સમુદ્રફીણમાં સિંહરિયા રંગનું શોણિત નીતરતું હતું.

દુઃખની એક હાય પુકારી, અને દેહ પરથી પૂજાનાં પરિધાન ફાડી નાખી હીરાં પાણીમાં કૂદી પડી. એક પહોર પછી મોજાંએ એના શરીરને પણ લીએન્ડરના શબની પાસે સુવાડી દીધું.

**મોરણી-ભભૂતગર, સુહિણી-મેહાર, હીરાં-લીએન્ડર :** એક સોરઠની, બીજી પંજાબસિંધની, ને ત્રીજી ગ્રીસની, ત્રણેય શું જુદી જુદી ઘટનાઓ હશે? કે એક જ ઘટના પરથી ઘડાયેલી લોકકથા વહાણવટીઓની જ્ઞાને જુદે જુદે ઠેકાણે ઊતરી પડી હશે? ને પછી શું એને સ્થળ સ્થળનાં લોકોએ પોતપોતાની નજીકનાં એવાં જ ભજતાં સ્થળોની સાથે નોખે નોખે નામે બંધબેસતી કરી હશે? સુહિણી-મેહારની એકની એક કથા પંજાબ, સિંધ તેમજ કચ્છમાં કાં દાવો પામે? બેટ શંખોદ્વારની નજીક પણ દરિયામાં સુણી-મેઆરના બે ખડકો બતાવવામાં આવે છે, તેનો શો મર્મ? આમ પ્રેમકથાના રસને જે વેળા હું પંડિતાઈની આંચ લગાવી રહ્યો હતો, તે વેળા -

“કાં શેઠ, સા બજાવવશું?” જાફરાબાદ તરફ સરતા ‘પીરના મછવા’માં વિચારગ્રસ્ત બેઠેલ આ વિદ્ધાનને સામત ખલાસીએ નોતરું પુકાર્યું.

“ચા? આંહીં મછવામાં?”

“હા શેઠ. દૂધ તો નથી, એટલે ‘સુલતાની સા’ બજાવીએ.” સામત ખલાસીની કનેથી આજ પહેલી જ વાર ‘સુલતાની ચહ્છ’નાં નામસવરૂપ જાણ્યાં.

“કંઈ નહીં ભાઈ, હું હજુ બેટનાં રીંગણાંના મઠા અને ભાખરી મૂળા ઉપર ત્રાપટ

દઈને જ ચડચો છું." (વસ્તુત: 'સુલતાની ચાન્દુ રસપાન કરવાની શક્તિ હજુ મેં કેળવી નહોતી.) "માટે સામતભાઈ, કંક તમારી દરિયાની વાતું થાવ શો."

"દરિયાની વાતું?" સુકાન થોભીને ઊંચે બેઠેલ સામતના શ્યામ ચહેરા ઉપર પીળી દંતાવળીની ભાત ઉઠી. એની તીણી છતાં ફિક્કી દેખાતી આંખો એના જર્જરિત ઉંડા હાડકાના માળખામાંથી ઊંચી આવી: "દરિયાની વાતું તે શી હોય, શેઠ? સત તો હવે એક ઈણામાં - ઈ રતનગરમાં જ - રિયું છે, ઈણો ટેમ ઈ કેદીય ચૂકતો નથી. દિયાળે કે રાતે, ઈણી વીણ્ય ને ઈણાં આર એકસરખાં ચાલે છે. ઈ અમારી વહાઙ્ગવટીઓની સાચી ઘડિયાળ છે. આજ તો સત બીજા કિનામાં રિયું છે, ભાઈ?"

## એક-બે ભજનો

“સામતભાઈ, મોટા દરિયા ખેડવા છે?”

“હા ભાઈ, સાત-આठ વરસનો હતો તે દા’દેશી મારા મામાના વા’ણે રોટલા ઘડવા ચડ્યો, ને તે પછી આજ દિ’ લગી ટંડેલાઈ જ કરી છે. આંહીંનાં વાણુંમાં, ને કર્ચનાં વાણુંમાં. મામો મુવો તર્યે એનાં છોકરાં નાનાં : ઈનું વાણ ઘણાં વરસ ખેડવું. છોકરાં જવાન થિયાં એટલે મેં કહ્યું કે “બાપા, તમારો ઘોડો હવે તમે હંકી ખાવ.” પણ બાપડા જુવાન ખરા ને! એક વારની ખેપમાં મલબારથી આવતા’તા, તી રાતને ટાડો સંધાઈ સૂઈ ગિયા. સોખવાળો (સુકાને) બેઠેલ ભાજોજ પણ ઝોલે ગયો. મનમાં એમ કે વા’ણ સમે માર્ગે હાલ્યું જાય છે. જાગીને નજર કરે ત્યાં વા’ણ તો કાદામાં પછડારા ખાય છે! છોકરા બાપડા કૂદી કૂદીને નીસરી જ્યા, ને વાણના ભુક્કા થઈ જ્યા ઈ કાદાને માથે. એવું વાણ આખા બેટમાં કોઈને નોતું.”

“સામતભાઈ, દરિયામાં તોફાન નડ્યાં છે કદી?”

“અરે ભાઈ! તોફાનની શી વાત કરવી? રતનાગર દયાળું છે તે બચાવે છે. બાકી અમારે ને મોતને ક્યાં છેટું છે?”

“તોફાન વખતે શું કરો?”

“જઈ તોફાન આવવાનું હોઈ તઈ અમારી કને ‘માલમનો હોકો’ (હોકાયંત્ર) હોય છે ના, ઈની વચેનો ગોળો નેનકલાક રોખો સફેદ બણી જાય. પછી એમે વાણ બચતાં માલને વામી (નાખી) દયીં, ને માણસ બચતાં વાણને જવા દયીં, વા’ણનો કવો (કુવાથંભ નામનો મધ્યસ્થંભ) પણ કવાડીએ કવાડીએ ત્રોડિને નાખી દેવો પડે, જેમ બને તેમ વાણને હળવું કરી નાખી મોજાંને માથે જવા દયીં, એમ છતાંયે બચાવ ન જ થઈ શકે એવું હોય, તો પછી જીવતા જણ બા’રા નીસરી જથીં. પછી અમને વળી જ્યાં માલક કાઢે ત્યાં ખરો.”

સામતભાઈ આવી વાતો કરે છે, જમણા હાથને કિનારે કિનારે, ડાચાં ફાડીને બેઠેલ ભરખજોગણી જેવી ભેખડોથી છેટે છેટે મછવો ચાલ્યો જાય છે, ત્યાં કિનારે એક મંદિર દેખાયું.

“એ છે વરાહરૂપનું થાનક, ભાઈ, આપણા આખા દેશમાં વરાહ અવતારની બીજી

સ્થાપના ક્યાંય નથી. આપણી કેડચ જેટલી ઊંચી મૂર્તિ છે : રોગે કાળી : મોહુ વરાહનું : મોંમાં દાતરડી છે : દાતરડી માથે પ્રથમીનો પિંડો છે : ચતુર્ભુજ સ્વરૂપ છે. મોઢા નિવાયની આખી કાયા માનવરૂપની છે. અતારે ત્યાંથી પાણી વળી ગયાં છે, એટલે મધ્યવો પોણી નહીં શકે. નીકર જઈ આવત આપણે.”

પ્રભુના વરાહ અવતારની, આખા ભારતવર્ષ ખાતે કેવળ ગુજરાતમાં જ પ્રતિષ્ઠા છે. સોરઠમાં ફક્ત આંહીં એક અપરિચિત કિનારે ક્યાંથી? ના, કિનારો તો અપરિચિત નથી. આખાય આર્યાવર્તમાંથી અસલના કાળમાં આંહીં ઉત્તરતાં યાત્રિકોનો છેક દ્વારિકા સુધીનો યાત્રાપથ આ કિનારે કિનારે જ ચાલતો હતો. તે મહામાર્ગની ઉપર જ આ વરાહરૂપનું ધામ પડ્યું છે. આ પ્રદેશને અપરિચિત બનાવી મૂકનાર તો પેલા પરભાર્યા દોડતા આગગાડીના ડબ્બા જ છે. આજે આર્યાવર્તનાં યાત્રિકો સૌરાષ્ટ્રનાં માત્ર બે-ત્રણ તીર્થો જ જોઈને ચાચ્યાં જાય છે. પોણોસો વર્ષ પૂર્વે તો એને આખી જ સોરઠનું દર્શન થતું. કિનારા ઉપર ટંકાયેલાં મોતી-શાંન બંદરો, એને કિનારાથી પાંચ-પાંચ કોસની અંદર પડેલાં શૈવ, બૌદ્ધ તેમજ વૈશ્વી તીર્થસ્થાનો, પહાડો, જાડીઓ ને ઝરા, તમામને અવલોકવાની જુક્ઝિતદાર એ કેડી હતી. સમગ્રતાની દાસ્તિ એમાં ખૂબ સચવાયેલી હતી.

પણ આ વરાહ અવતારની એક સ્થાપના આંહીં ક્યાંથી? આખા ભારતવર્ષમાં એકનું એક વામન અવતારનું મંદિર પણ સૌરાષ્ટ્રના વણથળી (વામનસ્થળી) ગામે કેમ? આ ‘સુરાષ્ટ્ર’ને ઇતિહાસે કેમ આટલો બધો મહિમા ચડાવ્યો છે? આ દેશની તવારીખ કેટલા યુગોની જૂની સમજવી? ચાંચના પેલા રાવણા-ઝાડ રૂખડાને વોટસન સાહેબે ત્રણ હજાર વર્ષોનો જૂનો કહ્યો છે! ઇતિહાસકાર કેસ્ટન [વિલ્બરફ્સેર્સ്] બેલ સાચ્યું જ લખે છે કે ‘ધ હિસ્ટરી ઓફ કાઠિયાવાડ ઈઝ ધ હિસ્ટરી ઓફ હોલ ઇન્ડિયા ઇન મિનિએચર’: સંસ્કૃતિઓની ચડતીપડતીનાં જે જે મોજાં હિન્દને છંટાયાં, તે તે તમામ આ ‘સુરાષ્ટ્ર’ને કિનારે પણ અફળાયાં હતાં.

“ઠીક, સામતભાઈ, આપણો તો આપણી વાતો ચલાવો. મોટી વાતો ભલે ઇતિહાસવેત્તાઓ ચર્ચાતાં.”

પણ સામતભાઈ કંઈ પાણીનો નળ થોડો હતો કે ચકલી ઉઘાડીએ એટલે અંદરથી ધાર થાય? એ તો હતો માનવી. એ કહે કે “ભાઈ, તમે એકાદ ભજન લલકારો ત્યાં જાફરાબાદની ખાડીમાં પોળી જાયેં. પ્રભુનું એકાદ પદ થાવા ધો.”

સામતભાઈને ખબર નહોતી કે પ્રભુભક્તિને એને પંડિતાઈને ઘણું અંતર ધોય છે. ભક્તિના ભાવ જીલે એવી પોલી એ છાતી નોય. પણ ભજનોની અંદરેય એકલા વૈરાગ્યનાં જ ક્યાં રોદણાં છે? માનવી માનવી વચ્ચેના ઉચ્ચ અનુરાગની વાણી જેસલ-તોળવનાં પદોમાં છલોછલ પડી છે. એમાંથી મેં સામતભાઈને એક-બે સંભળાવી દીધાં.

“સામતભાઈ, કચ્છનો કાળજાળ લુંટારો જેસલ જાડેજો જ્યારે સોરઠની કાઠિયાણી સતી તોળવને ધેર ગળતી રાતે ખાતર પાડવા ગયો છે તે વેળાની આ વાણી છે.”

“રંગ ભાઈ, થાવા ધો.” સામતને કોડે દીવા થયા.

એ જુ જેસલ! ગળતી એ માર્ગમ રાત;  
એ... આદેજ હો... ગળતી એ માર્ગમ રાત :  
લાલ રે લુંઘીની વાળેલ  
કાળી રે કામળની ભીડેલ ગાતરી હો જુ!  
એ જુ જેસલ! ખડગ ખતરીસો લીધો હાથ,  
એ... આદેજ હો... ખડક ખતરીસો લીધો હાથ,  
ખાતર દીધાં રે હરિને ઓરડે હો જુ!  
એ જુ જેસલ! તોળી રે ઘોડી ને તરવાર,  
એ... આદેજ હો... તોળી રે ઘોડી ને તરવાર,  
ત્રીજી રે તોળલાં સતીની લોબડી હો જુ!

આ રીતે જેસલ લૂંયારો ગળતી માર્ગમ રાતે જ્યારે કાળા રંગની લુંઘી પહેરીને,  
કુઝે તલવાર અને હાથમાં ગણેશિયો લઈને, પ્રભુભક્ત તોળલ સતીના પત્ર સંસત્તિયાને  
ઘેર ત્રણ ચીજની ચોરી કરવા જાય છે : શ્રી ત્રણ ચીજ? સતી તોળલ, ઘોડી ને તલવાર :  
પણ ત્યાં પોતે છતો થઈ જાય છે : પછી એને તારવા માટે તોળલ સતી સંસત્તિયા સ્વામીની  
રજા લઈને જ્યારે જેસલની જોડે ચાલી નીકળે છે, સામતભાઈ! તે ટાજો બેઉ જ્ઞાનાં હદા  
કેવા એકાકાર બની જાય છે? શું કહે છે તોળલ સતી? કહે છે કે હે જેસલ પીર!

એ જુ જેસલ! તમે રે હીરો ને અમે લાલ,  
આદેજ હો! તમે રે હીરો ને અમે લાલ,  
એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હો જુ!

વળી,

તમે રે ચંપો ને અમે કુલ્ય,  
આદેજ હો! તમે રે ચંપો ને અમે કુલ્ય.  
એકી એ ક્યારામાં દોનું રોપિયા હો જુ!

અને,

તમે રે પાણી ને અમે પાળ્ય,  
આદેજ હો!... તમે રે પાણી ને અમે પાળ્ય,  
એકી એ આરામાં દોનું જીલતાં હો જુ!

એમ,

બોલ્યાં રે તોળાંદે સતી નાર,  
આદેજ હો! બોલ્યાં રે તોળાંદે સતી નાર,  
સતીએ ગાયો રે હરિનો ઝૂલણો હો જુ!

“વાહ વાહ!” સુકાને બેઠેલ સામત ખારવાએ અને ઘૂઘા પગીએ માથાં ડોલાવ્યાં :  
“પ્રભુના નામની ભજનવાણી ભારી મીઠી લાગે છે. બીજાં ગીત ગમતાં નથી.”

ભજનિક પોતાના અંતરમાં સારી પેઠે સમજતો હતો કે એને ગમતી વાત આ પદની અંદર કોઈ પ્રભુ નામની નહોત્તી, પણ

અમે હીરો ને તમે લાલ : બેઉ એકી દોરે પરોવેલાં :

અમે ચંપો ને તમે કેળ : બેઉ એકી ક્યારે રોપેલાં :

અમે પાણી ને તમે પાળ : બેઉ એકી આરે ઝીલતાં :

એ પ્રેમી યુગલની ત્રાણ ઉપમાઓ હતી એને ઊંડામાં ઊંડી જંખના બ્યક્ત કરનારો

ભજનનો ઢાળ હતો. જેસલ-તોળલનો દેશ કરછ ઘણા કાળથી બોલાવી રહેલ છે. એ બે પ્રેમભક્તોની નિગૂઢ કથાએ ક્યારનું જાદુ પાથર્યું છે. સંસત્તિયા કાઠીએ સંગી સ્ત્રીને રાજ્યભૂષણથી લૂંટારા જેસલની જોડે વળમણાં દીધાં, એ રુદ્ધિયુસ્ત પીંજર-નીતિના ઉપાસક સમાજને ગભરાવી નાખનારો સમર્પણનો પ્રસંગ એનેક વાર અંતરમાં ઘોળાતો જ રહ્યો છે.

હું તો જેસલ-તોળલની વારતાને તેમજ વાણીને પોતાના પ્રાણ સાથે ઘોળનાર સોરઠી લોકસમૂહની ભાવના વિચારી રહ્યો છું. એની આંખોમાં રૂદ્ધિનું ઝેર-ખુનસ આવવાને બદલે, આ કથા પ્રત્યે શાંતિનું, સમાધાનવૃત્તિનું અમૃતંજન કેવું અંજાયું છે! અંજારમાં જેસલ-તોળલ રહેતાં, તેમાં એક દિવસ છેક મારવાડના રણુજી ગામેથી ભક્ત રામદે પીરના સમૈયામાં પદ્ધારવાનાં તેડાં આવે છે. પણ એ ‘વાયક’ – એ નોતરાં આવ્યાં તે ફક્ત એકલાં તોળલદેને સારુ. વગર તેડાં બીજાથી જવાય નહીં. જેસલ-તોળલને જુદાં પડવાનું આવે છે : જેસલ, જંગલનાં મૃગલાં-મોરલા હણનારો, કુંવારી જાનો લૂંટનારો, સાત વીસું (એટલે 140) મોડબંધા વરરાજાની હત્યા કરનારો, અરે, જેટલા માથાના વાળ એટલા ગુના કરી ચૂકેલો જેસલ એ તોળલની થોડા મહિનાની જુદાઈને ટાજો શી આર્તવાણી ઉચ્ચારી રહ્યો હતો : સાંભળો સામતભાઈ, ઘૂઘા પગી, બીજું ભજન સંભળવું જેસલ-તોળલનું : જેસલજી કહે છે :

રોઈ રોઈ કેને સંભળવું રે, જાદેજો કહે છે,  
ઊંડાં દુઃખ કેને સંભળવું રે, જેસલજી કહે છે,  
રુદ્ધિયો રુવે રે મારો ભીતર જલે.

અમે હતાં, તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે,  
તમે રે તારીને લાવ્યાં તીરે રે જાદેજો કહે છે,  
રુદ્ધિયો રુવે રે મારો ભીતર જલે! – રોઈં

અમે હતાં, તોળી રાણી, ખારી વેલ્યે તુંબડાં;  
તમે આવ્યે મીઠડાં હોય રે, જાદેજો કહે છે. – રોઈં

કાપડ લાવો, તોળી રાણી, ધોઈ કરી લાવું;  
ધોઈ લાવું જમનાને તીર રે જાદેજો કહે છે. – રોઈં

મેલાં કાપડ, તોળી રાણી, સાલુએ સુધ્યારું,  
નિદા થકી ઊજણાં હોય રે જાદેજો કહે છે. – રોઈં

તમે ચાલ્યાં, તોળી રાણી, વડે સંધી વાયકે;  
તમ વિના દનડા ન જાય રે આડેજો કહે છે. - રોઈં.

દોયલી રેળાની, તોળી રાણી, ગાયત્રી સંભળાવો,  
સંભળાવ્યે મુગતિ હોય રે, આડેજો કહે છે. - રોઈં.

એમ એ આખું ભાંગયું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કરીએ જ સાંભરી શકી.

“સામતભાઈ,” મેં કહ્યું, “તોળલ તો જેસલને દિલાસો દઈને જાય છે. પણ રામદેવ પીરને સમૈયે એને વધુ દિવસો ભાંગે છે. આંઠીં અંજારમાં જેસલ જીવતી સમાધ લ્યે છે, દટાય છે, પછી તોળલ પાછાં આવીને, હાથમાં તંબુરો ને કરતાલ ધરી, પગે ઘૂઘરા બાંધી જેસલજીને સમાધમાંથી જગપડવાનું કેવું ભેદક પદ એ સમાધની સન્નુખ નાચતાં નાચતાં ગાય છે! -

આડેજા હો વચન સંભારી વે'લા જાગજો!  
આડેજા હો તાલ તંબુરો સતીના હાથમાં રે જી!

આમ વેણ યાદ કરું છું, આખો પ્રસંગ મારી કલ્યનાભોમમાં સર્જીં રહ્યો છે, ત્યાં તો જાફરાબાદની ખાડીને મુખદ્વારે, ખડકવાળી કિનારી ઉપરથી ઉત્તરતા જુવાળનાં જળ એક ઊંડા ભખરમાં પછડાતાં હતાં, ઉપરવાડે બગલાની તપસ્વી-જમાત એક પંક્તિએ ધ્યાન ધરીને બેઠી હતી, દરિયાનું ‘વીળીયું’ પંખી, એ ચડતી ને ઉત્તરતી વીળ્યની ઉપર ને ઉપર જ અધ્યર ઊડતું હતું, અને જેસલ-તોળલની શેષ સમાધ-ભોમની જાત્રાએ જવા સારુ સાગર જાણો કે એનો એકતારો ઝંકારીને બોલાવતો હતો કે -

હેડા! હાલો અંજાર, મુંજા બેલીડા!  
એ હેડા હા...લો અંજાર, મુંજા બેલીડા!  
જાત્રા કરીએ જેસલ પીરની હો જી!

- અને વિરાટના મૃદુંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી.

## વસ્ત્રની રત

રોતના આઈ વાગ્યે જ્યારે હું ને ઘૂઘો પગી નાસ્તો લઈને ગામમાંથી કિનારે આવ્યા ત્યારે સુકાન પર બેઠેલો સામતભાઈ રોટલો ચાવતો હતો.

“અરે અરે સામતભાઈ!” મેં કહ્યું, “હું નાસ્તો લાવું છું એમ કહીને ગયો’તો ને?”

“તમતમારે નાસ્તો જમો, ભાઈ, મારે રોટલો ઘણો છે.”

“એમ હોય કાંઈ?” મેં ત્રણ જણ વચ્ચે નાસ્તો પાથરવા માંડ્યો.

“ના ભાઈ, તમે નોખા જમો – અમને એમાંથી થોડુંક આપી દો. તમે ઊંચ વરણ કેવાઓ.”

મેં જીદ કરીને પણ ભેળા જ નાસ્તો જમી મારું સ્વભાવગત શૂદ્રપણું સાબિત કર્યું. અથવા મારા મનને એમ મનાવી લીધું કે હું શૂદ્ર જ છું, જમાનો હતે શૂદ્રોના શાસનનો આવ્યો ખરો ને, એટલે મારા જેવા અનેક સમયવર્તીઓ પોતાને ‘શ્રમજીવી’માં, ‘મજૂર’માં, ને શૂદ્રમાં ખપાવવાની કોશિશ કરશે. જમાનો જો નાગરોનો હોય તો જેમ પ્રશ્નોરાને ‘કેવા છો’ પૂછતાં ‘પ્રશ્નોરા નાગર છીએ’ એવો જવાબ મળે, ને વાણિયો પણ ધીરે ધીરે કોઈ રીતે ‘ઊંચ વરણ’માં ઘૂસવા પ્રયત્ન કરે, લુણાણા બીજી રીતે ન ક્ષવત્વાથી જેમ છેવેટે લવ-કુશની ઓલાદ બની જઈ ક્ષત્રિયોમાં ઘૂસે – એટલે ઊંચ જાતિઓના આવિપત્યના યુગમાં તમામ લોકો ‘ઊંચપણા’ની પૂછડી પકડવા યત્ન કરે, તેમ અત્યારે હવે ઉલય વા વાય છે! એનો પુરાવો હું પોતે.

“ભાઈ,” સામત બોલ્યો, “આજ પીરે જાનારા ઘણા જણા આવવાના છે, માટે તમે આંઈ સોખવાણ (સુકાન) પાસે મારી ભેળા આવી જાવ. આપણને બેયને ઠીક પડશે.”

મેં સામતભાઈની ગોદમાં બિછાનું પાથર્યું. પૂછ્યું, “આપણે પાછા કર્યારે ઊપડશું?”

“ચંદ્રમા આથમ્યે આર ઊતરીને વીજ્યનાં પાણી ચડશે ને ભાઈ, તથેં. મણવો હંકારશું. વીજ્ય ને વાવડો બેયનો લાગ જડશે.”

એમ કહી સામતે ભંડકિયામાંથી એક પુરાતન હાફ-કોટ કાઢીને ઠીકમાં કંપતે કંપતે ધારણ કર્યો.

“સામતભાઈ, મોટી મુસાફરીઓમાં માર્ગ ને દિશા કેમ સૂઝે?”

“દરિયામાં કેડા તો થોડા છે, ભાઈ? પણ દિયાળે કરતાંય રાતે અમારી આંખું વધુ

ભાજે, ક્યાં કાઢો છે, ક્યાં ડાડો છે, એ સંધું અમે અમારી આંખ્યુને મહાવરેથી પાછીની હેઠચે માપી શકીએ ને મોટા દરિયામાં દશ્ય! સૂરે અમને આભનાં લાખતર ઉપરથી.. લાખતર એટલે નક્ષત્ર.

“ક્યાં ક્યાં નખતર તમારાં? બતાવો જોઉં!”

ડેલતા નાવડામાંથી નોખનોખી દિશામાં અંગળી ચીંઘતો ખલાસી એના રોજ રાત્રિના આકાશી સાથીઓની ઓળખાજ આપવા લાગ્યો :

“જુવો ભાઈ, આ ધરુ (ધ્રુવ) : એની સામે આ ચોકી : આ ઉગમજ્ય ને આ આથમજ્ય : આ ધરુ અને ઉગમજ્યની વર્ચ્યે કળાય એ સૂરતી લાલ : ધરુ ને આથમજ્યની વર્ચ્યે ચળકે એ મકરાણીલાલ : આ મકરાણીલાલની સામો રિયો એ બખાઈલાલ; આ દુંગરને પડાયે ટમકે હિંદવાળીલાલ. હવે આમાં બખાઈલાલની દશ્યે આવ્યો અપાર મોટો દરિયો. એ દશ્યે ન હંકારીએ..”

મને લાગ્યું કે બખાઈલાલ એટલે આઝ્કિંકા અને હિંદ બંને વર્ચ્યેની સીધી દક્ષિણ દિશા હશે. નર્દૂન નક્ષાનું જ્ઞાન!

“હવે ભાઈ,” સામતે સમજાવ્યું : “ગમે તેવી મેઘલી રાત હોય, મે હોય. પણ આ ચાર દશ્યમાંથી એક જ દશ્ય ઉઘાડી હોય ને એક જ લાખતર દેખાતું હોય, તો અમે તમામ કેડા નક્કી કરી શકીએ..”

“દિશા બિલકુલ ન કળાય તો?”

“તો વા’ણ હોદારીને બેઠા રહીએ, જ્યાં હોઈએ ત્યાં. સવાઈ પીર! સવાઈ પીર! પીર કનારે પોગાડે તથેં ખરું. નીકર અમારાં મોત તો રતનાગરને ખોળે જ લખ્યાં છે ને?”

આ ‘લાલ’ પ્રત્યયવાળાં નામોથી શોભતાં નક્ષત્રોની પિછાન તો મને નહોતી, પણ ખલાસીઓએ પોતાના તારલ દોસ્તોને ‘લાલ’ જેવું લાડલડાવણ વિશેષજ્ઞ આપવામાં તો પોતાની રસિકતા જ બતાવી છે. અથવા પછી સન્ભુખલાલ મોહનલાલ વગેરેની માફક વહ્યાજવટીઓએ તારાઓને પણ વાણિયા-બાલાજ જેવા ઊંચ વણોમાં મૂક્યા હશે! ખેર.

“હું સામતભાઈ,” ‘હડકી વારી આઈ’ની વાત મારા મનમાં તાજી હોવાથી મારો પ્રશ્ન ઉઠચો : “દરિયા ખેડો છો તો કદી ચણીતર-બળીતર દીઠામાં આવ્યું છે ખરું?”

“તથેં નહિ, ભાઈ?” સામત શૂન્યમાં કશુંક ભાળતો હોય તેમ શરીર સંકોડી ગયો. એની પીળી આંખો પાધરા દરિયામાં તાકી રહી; એનો અવાજ ઊંડો ઉત્થો. કોઈનો ઓછાયો પડી રહ્યો હોય તેવે ધાસ્તીને સ્વરે એણે સુકાન સાથે લપાતે લપાતે વાત કહી :

“તે દિ’ હું મારાં મામાના વા’ણમાં ચડતો. મારી જુવાની હતી.. એક વાર કાલકોટની ખેપેથી અમે ચાલ્યા આવીએ.. જાફરાબાદની ઓલીકોરનો દરિયો હતો. અધરાત પછીની રેળા હશે. અંધારું હતું, મામો કહે કે ‘છોકરાઓ, તમારા ચારમાંથી બે જાગો ને બે થોડાંક જોલાં લઈ લિયો. વારાફરતી જાગો’. એ રીતે હું પેલા વારામાં ઊંઘી ગયો. ઘસ્યાસાટ

<sup>1</sup> દશ્ય = દિશા

ઉંધું છું ત્યાં સોખવાણો બેઠલ મારા મામાએ બૂમ પાડી : ‘એલા છોકરાવ, ઝાગો ઝડ  
જાગો, ને કાકડી કરો, વાંસે આગબુટ વઈ આવે છે, હમણાં આપણી ઉપર આવી પડશે,  
ઝડ કાકડી કરો.’

‘સાંભળીને હું તો આંખો ચોળતો દોડચો. અંધારે અંધારે લુગડાની કાકડી પડેલી  
તે ઘાસલેટના ડબામાં બોળીને મેં તો દીવાસળી કરીને કાકડી ચેતાવી. હજુ ચેતાવું ન  
ચેતાવું ત્યાં તો બા...પા! એક જબરી આગબુટ અમારા વાણને પડખે થઈને નીકળી. માલીપા  
ઝડ ઝડ દીવા બળે છે, અને માણસ માણસ ઓહો કાંઈ માણસ હૂકળે! માણસોની વાતુંચીતું  
સંભળાય. ધમધમાટ કરતી આગબુટ વાણની પડખે થઈને ચાલી ગઈ, અમે જોઈ રિયા,  
પણ ત્યાં તો કેવી આગબુટ ને શી વાત ! કશુંય મળે નહીં. કાંઈ દીઠામાં ન આવ્યું. એવી  
મોટી આગબુટ એક ઘડીમાં ક્યાંઈક ગેબ થઈ ગઈ.

‘અમે પાંચેય જણ તો વા’ણમાં સૂનમૂન થઈ રિયા. ડેબતાઈ ગયા. કોઈ બોલે કે  
ચાલે! પાંચેયનાં કલેજાં ઉપર કાંઈક ધરબાઈ ગયું જાણે.

‘પછી મારા હૈયામાં શાસ આવ્યો. મેં ઊઠીને સહુને કષું કે ‘ભાઈ, આ બીજું  
કશું નો’તું. કોઈ આગબુટ નો’તી.. નક્કી આ ‘વીજળી’નું ચળીતર હતું. આંઈ જ ‘વીજળી’  
બુડી’તી.. હમણાં આપણને ભરખી જાત. પણ સવાઈ પીરે આપણને ઉગાર્યા !’ આવું  
ચળીતર અમે તે હિ’ રાતે દેખેલું, ભાઈ! ‘વીજળી’નું જ ઈ ચળીતર. પછી અમે વા’ણની  
મોરીને માથે તે વેળાએ લોબાનનો ધૂપ કર્યો, ને રતનાગર સાગર પાસે પાંદડી ઉત્તારીને  
સલામું કરી.’

\*

ખાડીમાં કેંક વહાણો લોથારી (લંગર) નાખી પડવાં હતાં. ચંદ્રમાના અંધોળ જીલતું  
આકાશ શાંતિમય હતું. ઓટનાં પાણીને લઈને પાછો ચાલ્યો જતો દરિયો, અનેક ધોળાં  
ગાડરનું ટોળું હંકીને વગડે જતા ગોવાળ જેવો, પોતાની નિગૂઢ સરજૂ લલકારતો હતો,  
તે વખતે એક વહાણ ઉપર કશીક તકરારના બોલ સાંભળીને સામતના કાન ચમક્યા.  
એણે લોથારી ઉપાડી લઈને પોતાનો દસેક માણસે ભર્યો મછવો એ વહાણની નજીક લીધો.  
વહાણમાંથી અવાજ આવ્યો, “કાં સામત?”

“કોણ, રૂખડ મામો કે?”

“હા ભાઈ! હાલ્ય રોટલો ખાવા.”

“મીંએ ખાધું. તમે ખાવ. પણ રીડયું શીની પડતી’તી, મામા?”

“સાચું કે’જે, સામત.’ રૂખડ મામાએ બોળી વાળી કાઢી : “મારી વઉ બેટમાંથી  
અંહીં કામકાજે આવી હોય, ને પાછી જવા સારુ તારે મછવે ચડે, ને તું ઈની પાસે  
ગેરવાજબી માગણી કર, તો કીમ?”

“અરે રામ રામ! મારો પીરનો મછવો : ઈમાં એવી નાલાયકી હોય? કુણ ઈમ  
બોલનારો હતો?”

“આપણો બેટવાળો કરણો. મારી બાયડીને ઈંધો આવું વેણ કહ્યું, ઈ બાપડી આંઈ આવેલી તથે પૈસા આપીને ઈને મછવે ચડવા ગઈ'તી.”

“હુશો ભાઈ, નાલાયકને શું કે'વું! વાત પડી મેત્ય, ને હાલ્ય મામા, આવવું છે બેટ?..

“હા, માલ હજી ભરાણો નથી એટલે આજની રાત છોકરાંને મળી જાવા આવવું છે.”

મછવો રૂખડ મામાને લઈને ઉપડચો. “હાલ્યો આવજે ઘેરે!” રૂખડમામાએ ખાડીમાં ચીસ નાખી, “કરણા, હાલજે ઘેરે, જો બીજે કિંયે જાતો નહિ. હું ઘેરે જ જાઉં છું. ત્યાં મળશું આપણો.”

મેં કહ્યું : “રૂખડભાઈ, એ ખારવાએ તમારી વહુને આમ કહ્યું એ તો બહુ ગેરવાજબી! તમે હવે એને શું કરશો?”

“શું કરીએ, ભાઈ?” રૂખડે ખામોશભર્યો સ્વભાવ પ્રગટ કર્યો : “અમારે રોજ દરિયા ખેડવા : બાયડીઉં ઘેરે એકલી : એને પાશેર મરચું જોતું હોય તો આંઈ લેવા આવે : એમાં કોઈક નાલાયક આવું બોલે તો એને ઠપકો દઈએ, બીજું શું કરીએ, ભાઈ? કજિયા માંડવા કર્યાં બેસીએ?”

કોઠો ટાઢો કરીને રૂખડ ઘસઘસાટ સૂઈ ગયો. બીજાં દસ જગાંએ પણ નીંદર ખેંચ્યો. હું અર્ધનિદ્રિત હતો, એકલો સામત સુકાન સાચવતો, શાઢને વાવડાની દિશા પ્રમાણે વારે વારે ફેરવી ફેરવી બાંધતો, સીધી તીર સરીખી નજરે સન્મુખ કેડો માપતો જાગે છે. એણે ગાંજાની સટ બે-ત્રણ વાર ચડાવી છે. ત્રણ વાર તો સહુ મુસાફરોને ચાહા કરીને પાઈ છે, સહુને ઉંઘાડીને પોતે એકલો જાગે છે : ‘તસ્યાં જાગર્તિ સંયમી!’ પેટન્ન. રોટલા સારુ એણે ત્રણ રાતથી ઝોલું નથી ખાદું. “ભાઈ, આજ ત્રીજો ઉજાગરો છે મારે..”

“અંહીંથી સીધા આપણો પીરે મછવો હંકારશું, ત્યાં આ સહુને ઉતારીને પછેં ‘પોટા’ માથે હાંકી મેલશું, હો ભાઈ! વીળ્ય છે તાં જ પોતે પોગડી દેશ તમને.”

“દ્વિકર નહિ, સામતભાઈ!”

ચાંચ અને શિયાળ બેટ વચ્ચે, જળની હેઠે છુપાઈ રહેલી દાંતી છે. વચ્ચે એક જ ઠેકાડો થઈને ‘સવાઈ પીર’ની અણી ઉપર જવાય છે. જરાક ચૂક પડે તો મછવો કે વહાણ એ દાંતીનો ભક્ષ બને.

મારી કાંડાઘડિયાળના સળગતા અંકાએ અંધારામાં જ્યારે બે બજ્યાનો અમલ બતાવ્યો, ત્યારે સામત સહુને ‘પીર’ને કિનારે ઉતારી નાખી, મને અને ઘૂઘાને લઈ પાછો વિક્ટરની ખાડી તરફ મછવો વાળી રહ્યો હતો. હવે તો વિક્ટર જઈને જગવું છે, એ વિચારે હું ભરનીંદરમાં પડ્યો.

## હે... અલ્લા!

સ્વર્ણ ચાલે છે : બખાઈલાલ અને અરબાણીલાલ વચ્ચે હીંચકો બાંધીને જાણો કોઈક મને ફુગોળી રહેલ છે.

જાગ્યો. મછવો તોલે છે. પાણીના હડૂડાટ થાય છે. હમણાં જાણો દરિયો ડાબી બાજુથી મછવા પર ચડી બેસશે. હમણાં જાણો જમણી બાજુથી જળ ભરાઈ જશે. કુવામાં બોખ જેવી દશા એ નાનકડા મછવાની બની રહી હતી.

ધડ : ધડ : ધડ : મછવાને તળિયે જાણો કોઈક હથોડા પછાડી રહ્યું છે.

ઘડિયાળના સ્વયંપ્રકાશિત લીલા કંટા સાડા ત્રણના આંકડા પર હતા. વિધાતાના જ લખ્યા એ જાણો આંકડા હતા.

અંધારું ઘોર : તારાઓ સૂનમૂન : તરંગોના પછાડા : તળિયેથી કોઈ કુહડાના પછાડાટે : દૂર દૂર પોતાની કેફચકચૂર આંખને મીંચતો ને ધીરે ધીરે ખોલતો, ચાંચના ખડક પરનો નવો કંદેલિયો.

મારી આંખો સામતને શોધતી હતી. સામતભાઈ, એકલો મુંગો મુંગો વાંસડો લઈને તળિયાના પથ્થરો સાથે જોર કરે છે, ઘડીક શઢનાં દોરડાં ફેરવી ફેરવી મછવાને ઉગારવા મથે છે.

“સામતભાઈ, સામતભાઈ!” મેં પોકાર્યું : “આ શું થાય છે? આપણો કૃયાં છીએ ?”

સામતભાઈને ખુલાસો કરવાની વેળા નથી. દરિયો હડૂડે છે. વરુ જેવાં વિકરણ મોજાં એક તરફથી મછવાને થપાટો દઈ, બીજી બાજુથી અંદર ચડવા આવે છે.

ઘૂઘો પગી ઊઠ્યો : “એલા સામત, કૃયાં ભેખડાવ્યું?”

ઉગાર સારુ મથી રહેલ સામતે દીન શબ્દે ઉત્તર વાળ્યો : “દાંતીમાં ભરાણો છે મછવો.”

બીજો વાંસડો લઈ ઘૂઘો કુદ્યો. મથતાં મથતાં પૂછે છે : “કેમ કરતાં? જોલે જ્યો’તો તું?”

“અરે જોલે શું જાઉં? પીરેથી મછવો પાછો વળ્યો, પણ સામી વીળ્ય દાંતીની ગાળીમાંથી નીકળવા જ દેતી નથી. બે વાર તો ઠેઠ લેંસદે જાતો મછવાને નાખી દીધો. હુરિયાં કરી કરીને (શઢ ફેરવી ફેરવીને) આંઈ પાછો લાવું છું, પણ મારીને પાછો કાઢે છે. આ વેળ કાદાને માથે ચડી ગયા છીએ.”

“હવે શું થાય, હેં ઘૂઘાભાઈ?” વિદ્ધાને પૂછ્યું.

“કાંઈ નહિ, ભાઈ!” ઘૂઘો કહે છે : “તમે તમારે સૂઈ જાવ. અમે હમણે મછવાને બા'રો કાઢશું.”

સૂઈ જાવ! વિદ્ધાનને આ મોતના મુખમાં સૂઈ જવાનું કહેનાર ખલાસી એ કાળી રાતનો કોઈ મૃત્યુંજ્ય દેખાયો.

“ના ના, ઘૂઘાભાઈ!” વિદ્ધાને વ્યાકુળતા છુપાવવા માંડી : “હું તમને કશી મદદ કરી શકું તેમ છું?”

“ના રે ના સા'બ! તમે શી મદદ કરો!”

એમ કહેતા એ બે ખલાસીઓ પ્રકૃતિના આ કાવતરાની સામે ઉત્તરી પડ્યા. નીચે પગ ચીરી નાખે તેવા ધારદાર પથ્થરોની દાંતી હતી. મછવાને પછાડીને મોજાં હમણાં જ ચડી બેસશે એવો આખરી મામલો હતો. મછવાની અંદર એક જીવતા જીવનું, અમલદારોના ઓળખીતાનું, ઘડીકમાં ગભરાઈ જાય અને ફડકે ફાટી પડે તેવી વાણિયા શાસ્ત્રિના રતનનું જોખમ હતું.

“હે... અલ્લા! હે... અલ્લા! હે... અલ્લા!”

શાસે શાસે એ કરુણ રાગના અવાજ દેતા, બેઉ નાવિકો જહેમત કરતા હતા. સામે મોજાં ઘૂરકતાં હતાં. નીચે દાંતી દાંત ભરાવતી હતી. આઘે આઘે શિયાળ અને ચાંચની ધરતી કોઈ વિરાટ શબ્દો જેવી સૂતી હતી. ભૂતના ભડકા કાઢતો કંદેલિયો ચાંચને પાછલે છે હાંઝતો હતો. કાળી રાત હતી, કાળાં નીર હતાં. બેંસલો ખડક જાણો વાટ જોતો હતો કે કયારે મછવાના કટકા થાય!

એ બધી કાળાશ વચ્ચે, એ સૂનકાર રાત્રિના ‘ખાં...ઉ! ખાં... ઉ!’ બોલતા લોઢરૂપી ચૂદેલો વચ્ચે, જીવનમરણનો જંગ જેડતા બે ધીર મર્દોની એ વાણી કેવી સંભળાઈ હશે!

“હે... અલ્લા! હે... અલ્લા! હે... અલ્લા!”

એમાં તીણી ચીસો નહોતી. બુલંદ પોકાર નહોતો. જેને સંભળાવવું છે તે જાણો કે પોતાની નજીક, પોતાની બાજુએ જ આવી ઉભો હોય એવો હળવો, મીઠો ને આખરી વેળાનો છતાં કાકલૂદી વગરનો સાચા પુરુષાર્થનો એ અવાજ હતો. એ રાગણી મૃત્યુ સુધી સાંભરે તેવી હતી, એ પ્રાર્થના પવિત્ર હતી, કેમ કે પુરુષાર્થના કંઠની એ પ્રાર્થના હતી.

કાદા ઉપરથી મછવો ભરદરિયે કાઢીને પાછો સામતભાઈ બહાર નીકળવા ચાલ્યો ત્યાં ને ત્યાં : મોતના મોંમાં.

“હું ભાઈ!” મેં અંદરની આકુલતાને ડહાપણની વાળીમાં વીંટાળીને કહ્યું : “વીળ્ય ઉત્તરી જાય ત્યાં લગી લોથારી નાખીને મછવો હોદારી આંહીં જ પડ્યા રહીએ તો શી હંકત છે? મારે કાંઈ પોટે પોગવાની ઉતાવળ નથી.” (ભાષા મેં પકડી લીધી હતી!)

“અરે ના રે ભાઈ!” સામતે નોક બતાવ્યો : “એમ કાંઈ બીને આંઈ પડ્યા રે’વાશે ?”

એ ચોથી વાર સામતે દાંતીમાંથી મછવાને પાર કરી દીધો.

\*

“કાં સામતભાઈ”, ફરીવાર ઉંઘમાંથી બકીને મેં પડકાર્યો એને : “વળી કેમ મછવાનું તળિયું ભટકાય છે?”

“ના ભાઈ, હવે તો પાધરો હાલ્યો જાય છે.” સુકાન પર ગુંચળું વળીને બેઠેલ ખલાસીએ જોલામાંથી જવાબ વાણ્યો.

મછવો આ વેળા ‘કાદા’ ઉપર નહીં, એટલે કે ખડક ઉપર નહીં પણ ‘ડાંડા’ ઉપર (રેતાળ જમીન ઉપર) ભટકતો હતો.

“સામત, તું થાકો છો, મુંશો સોખવાણ દે. તું સૂઈ જા.” ઘૂઘા પળીએ સુકાન લીધું.

ખાડીનાં પાછાં વળતાં પાણી પ્રભાતે બડબડિયાં બોલાવીને મને પૂછતાં હતાં : ‘કાં મિસ્ટર! બાપડા આવા ભૂખલ્યા કંઠાળ દરિયામાંય એક રાતનો અનુભવ મહાન કોઈ પરાક્રમનો પ્રસંગ લાગ્યો? આવી કંગાલ વાત કરી કરીને ધરતીનાં લોકોની વચ્ચે વીરમાં ખપશો કે?’

માણું નમાવીને મેં ઉત્તર દીધો : ‘હે સાગર! અભિમાનનો વિષય નહિ બનાવું; પણ આ એક રાત્રિના એક પ્રહર પરથી ત્રિરાશી બાંધીને નાવિકોના ધીર જીવનસંગ્રામની વેદના સમજાવીશા.’

બાદી એ લેખકનો એક મહાન ગુણ છે. અપણ સિંકલેર પોતાની આત્મકથામાં લખે છે કે જ્યારે અમુક સ્ત્રીઓએ મને ‘ઓહ, હી ઈજ ઓન ઓથર!’ એ શબ્દોમાં કોઈ ભવ્ય પ્રાણી તરીકે પ્રશંસયો, ત્યારે તે બિચારીઓને ખબર નહોતી કે ‘લેખક એટલે તો સદાની કબજિયાતથી પીડાતું પ્રાણી! સિંકલેર જો અત્યારે આ મછવામાં હોત તો પોતાના એ દુર્ભાગ્યને કેવું સૌભાગ્ય સમજત! એ ગુણની સાચી મહત્ત્વા તે પ્રભાતે મપાઈ ગઈ. દસ વર્ષની લેખન-સાધના પછી પણ એ પરમ સિદ્ધિથી વંચિત રહી ગયેલા આ અધૂરા ગ્રંથકારે મછવાની અંદર સર્વત્ર નિરીક્ષણ કરી-કારવીને લાચાર મોંએ પૂછયું, ‘ઘૂઘાભાઈ, આડે ફરવાનું શું સાધન છે આંહીં?’

ઘૂઘો પળી મુંજાયો. ઉભો થયો. “જુવો સા’બ!” એમ કહેતો મછવાની પછવાડે ઉત્થયો. સુકાનનો ડાંડો બે હાથે આલ્યો. સુકાનનો પાણીમાં રહેતો જે પંખાનો ભાગ, તેની ઉપર વાંદરાની પેઠે પગનાં અંગળાં ભરાવીને ‘દસ્ત-આસન’ વાણ્યું : પછી બોલ્યો, “અમે તો ભાઈ, આ રીતે કળશીએ બેસીએ. બીજો ઉપાય ન મળે.”

ઠીક છે. વાંદરા પણ આપણા વડવા જ હતા ને! જળસમાધિ ન લેવાઈ જાય તો તો અડચણ નથી. એમ વિચારીને હું પણ મછવાની પાછળ ઉત્તરવા લાગ્યો.

“ભાઈ, બેસી શકશો?”

“કુદી નહીં, તરતાં આવડે છે.” કહેતે બે પગે ને બે હાથે સુકાનના ડાંડાને મર્કટ-શૈલીએ ચોંટી પડી, ચાલતે મછવે હાજત પત્તાવી.

મનમાં થયું : પૂર્વજોનો આટલોય સંસ્કાર હજુ આપડામાં પડ્યો છે ને શું!

પોર્ટ વિક્ટરના વિશાળ ખાળામાંથી ખળખળીને દરિયા-જળ પાછાં વળતાં હતાં.

કુંજડાં પંખીની પંક્તિઓ ને પંક્તિઓ, નીલ આકાશમાંથી વિભરાયેલ કોઈ કાબરચીતરાં મોતીની મોતાવળ જેવી, મેરામજા ઉપર ઊડી આવતી હતી. કાઠિયાણીના કંઠ-શા એના લંબાયમાન આનંદસૂરો મને એક કાઠી લગનગીતની, છ વર્ષો પર સાંભળેલી પંક્તિઓ સંભારી દેતા હતા :

લાંબી ડોકે, કુંજડ રાણી!

અને તારાં મધ્યદરિયે મનડા મોહ્યાં રે, કુંજડ રાણી!

કાળી પાંખે કોયલ રાણી!

અને તારાં આંબલિયે મનડા મોહ્યાં રે, કોયલ રાણી!

રાતે ચૂઢે સોમબાઈ રાણી!

અને તારાં જેતપર ગામે મનડા મોહ્યાં રે, હો વહુરાણી!'

## ‘પીપા સીતા રેન અપારા!’

મોટે દરિયેથી ખાડીમાં ચાલ્યા આવતાં થોડાંએક વહાણ આમ તમારિયાંના જુંઠની અંદર કૃંગારી વળી ગયાં?

“ભાઈ, ખાડીનો એ નાનકડો ફાંટો ઠેઠ ભેરાઈ બંદરે, જૂના રાજુલા બંદરે અને પીપાવાવ બંદરે આ વહાણોને લઈ જાય છે. જુઓ, નજર કરો, એ કળાય ભેરાઈના મીઠાના અગર. જૂનાગઢ તાબાનું જુનવાણી, મીઠાનું મથક છે ભેરાઈ. ત્યાંથી વા'ણ મીઠું ઉપાડશે.”

ભેરાઈ : કાનને અને કંઠને જૂની પિછાનવાળો શબ્દ ભેરાઈ :

ઉગલાં દિ’ ને રાત

(મારે) ભરવાં પડે ભેરાઈનાં!

એ દુહાનાં પાછલાં બે ચરણ જીભ પર રમવા લાગ્યાં. આગલાં બેની યાદ સરી ગઈ હતી. તે પણ ધીરે ધીરે પાછી આવી :

મેલ્યું વાંગર મેલ્યું માઢિયું,

મેલી મ'વાની બજાર;

(હવે) ઉગલાં દિ’ ને રાત

(મારે) ભરવાં પડે ભેરાઈનાં!

એ તો રાણા—કુંવરની ગીતકથા<sup>1</sup> માયલો દુષ્ટો : રબારી જુવાન રાણાનો જ એ ઉદ્ગાર. ભગ્ન હદ્દયનો એ પ્રેમી વાંગર અને માઢિયા ગામની પોતાની જન્મભોમને તજી ગીરમાં ધુંવાસના ધડા નામે કુંગરા ઉપર રહેતો, ને છેક ત્યાંથી હટાણું કરવા એને ભેરાઈના આંટા હતા. પરને પરણી ગયેલ કુંવરને કદાચ ભેરાઈની બજારે છેટે રહીને પણ નજરે જોઈ શકાય એ આશાએ! એ કથાનાં સ્થાનો વારંવાર મારા માર્ગમાં ભટક્યા કરે છે. જાણો કોઈ પૂર્વજન્મની કંદરાઓમાં પડી રહેલો સાદ એ દુહાઓમાંથી ભણકાર ગુંજાવે છે : ‘ઉગલાં દિ’ ને રાત, (મારે) ભરવાં પડે ભેરાઈનાં!’ હતાશા, થાક અને ચિરવિરહની શાંતિ બોલે છે એ એક પંક્તિમાં.

અને ‘પીપાવાવ’ શબ્દનો અવાજ પણ ક્યાં ઓછો પરિચિત છે? પ્રેમીજનોની દુનિયામાં ભટકતા પ્રેત સામે ભક્તોની સૃષ્ટિનું કમાડ ખુલ્લું થાય છે. કબીરજીના એ

<sup>1</sup> આ ગીતકથા ‘સોરઠી ગીતકથાઓ’માં આપી છે.

સમકાળીન સંત પીપાજુએ આજ્યી ચાર સૈકા પૂર્વની એક સંધ્યાએ દ્વારિકા તરફથી આવીને આ કિનારાની બાવળ-આડીમાં પોતાનું વહાણ નાંગર્યું હશે, અને એની કૃધા ઓલવવું સારુ એક કાનકુંવારી ગાવડીએ આંચળમાંથી દૂધના મેહ વરસાવ્યા હશે. આખો સોરઠ-તીર દીઠા પછી એ કુંભિત રાજનનું અંતર આંહીં જ ઠર્યું હશે.

મેં એને રાજા કહ્યા. હા, પીપાજુ હતા ઉત્તર હિંદ તરફના કોઈ ગઢગાગરૈન નામે રજવાડાના દેશપતિ. ‘પીપા પુજે કોટકેરાળી’ એ ગીતપંક્તિ હજુય બોલાય છે. કર્યાના કેરકોટવાળી કોઈ દેવીના એ ચુસ્ત ઉપાસક હતા. પણ એક દિવસ,

સવા કળશીનો ખીચડો ને સવા માણાની શેવ;  
પીપે મારી પાટુએ, તને દઃખ લાગ્યું કાંઈ હેવ્!

એ પ્રચલિત લોકવાણી મુજબ દેવીને મોટું નેવેદ્ય જુવારવાના અવસર ઉપર પીપાજુને ભાન થયું કે આ દેવીથીયે ચિદિયાતો દેવાધિદેવ ઈશ્વર જગત પર બેઠો છે! થાનકમાં માંડયાં હતાં તે તમામ દેવી-ફળાં (પૂતળાં) ઉપાડીને પીપાએ ભારી બાંધી. આઠેય રાણીઓને લઈ દ્વારિકા આવ્યા. ત્યાંથી કહે કે મારે તો જંગલનો જોગ ધરવો છે. બાઈઓ કહે કે સાથે આવીએ. પ્રત્યેકની પાસે પીપાએ અક્કેક ધોળું વરત્ર, તુલસીની માલા અને ગોપીચંદનનો કટકો ધરી દીધાં. ભેગાં આવવું હોય તો રાજશાણગાર ઉતારીને આ ભેખનાં પરિધાન પહેરી લ્યો : નહિ તો સુખેથી પાછાં જઈ રાજસાયબી માણણો : કોઈને માથે મારું ધણી તરીકેનું બળજોર નથી : સાંભળીને સાત તો પાછી ફરી ગઈ. ફક્ત આઠમાં અણમાનેતાં સીતાદેવી પીપાની સંગે ચાલી નીસર્યાં.

પીપા સીતા રેન અપારા,  
ખરી ભક્તિ ખાંડા કી ધારા!

એમ સંસારની અધોર કાળ-રાત્રિને ખરે પહોરે, પીપા-સીતાની બેલડી ખડ્ગ-ધાર જેવા ભક્તિપથ પર પગલાં માંડતી ચાલી નીકળી.

સોરઠી રત્નાકરને તીરે, તીરે, તીરે; અનંતની ઝાલરી સાંભળતાં, સાંભળતાં, સાંભળતાં : મસ્તક ઉપર પેલાં દેવલાંની ગાંસડી ઉપાડી હશે. કોઈનાર પંથકના કોઈ ઉમેજ નામે ગામમાં એક સંધ્યાએ પોરો ખાવા થોટ્યાં. કોઈ સેન ભગત નામના ભાવિકને ઘેર પરોણલાં બન્યાં. રાત્રિએ અતિથિઓ રોટલા ખાવા બેઠાં તે વેળા ધરમાં યજમાનની ધરવાળી દીઠામાં ન આવી. મહેમાનોએ હઠ લીધી કે જમીએ તો ચારેય જણાં ભેળાં બેસીને. ધરનો ધણી ઝંખવાણો પડી ગયો. ‘ક્યાં છે ધરનાં મૈયા! સાંજરે તો દીઠાં હતાં, ને અત્યારે ક્યાં ગયાં?’ ધરધણી એ પ્રશ્નનો ઉત્તર ન દઈ શક્યો. હેઠું ભરાઈ આવ્યું. કંઈક ભેદ છે સમજીને સીતા મૈયાએ ધરમાં અંટો મારી શોધ કરી. ધરધણીયાણીને દાણા ભરવાની ખાલી કોઠીમાં બેસી ગયેલી ભાળી : અંગે એક પણ લૂગડા વિના, નખશિખ નગન! બેઠી બેઠી થરથરી રહી છે.

“ભાઈ! આનું શું કારણ?”

“‘अतिथिदेव!’” ઘરધણી આંસુની ધારાઓ લૂછતો લૂછતો બોલ્યો : ‘‘આજ ઘરમાં કશુંય અનાજ નહોંનું. એક પણ ઘરવખરી બાકી નહોતી રહી. મારા ઉભરની આબરુની રહેવાળ આ બાયડીએ પોતાના અંગ ઉપરનો સાડલો ઉતારી આપ્યો તે વેપારીને હાર્ટ મૂકીને હું લોટ-દાળ લાવ્યો, બાઈએ ન-વસ્ત્રી દશામાં ઓરડો ઓઢીને રંધણું કર્યું. તમને ખાવા બોલાવ્યાં એટલે એ પોતાની એબ સાચવવા કોઈમાં ઉત્તરી. આ અમારી કથની છે.’’

પોતાની પછીડી વડે બાઈનું અંગ ઢંકાવીને પછી પીપા-સીતાએ ગુપ્ત મસલત કરી : “શું કરશું, દેવી?”

“મહારાજ, કાલે રાત્રિએ આંહીં નાચનો જલસો કરીએ. લોકો જોઈ જોઈને દવ્ય દેશો..”

“શ્રી રીતનો જલસો?”

“હું રાજની દીકરી છું. પિયરમાં નૃત્ય-ગીત શીખી છું. આપ ઢોલક બજાવજો. હું નાચીશ, ભજન કરવા બેસશું તો ભજનિકને ભિક્ષા આપે એવું આ ગામ નથી લાગતું. પણ નાયકાને માથે લોક ન્યોછાવર થયા વિના નહિ રહે.”

સીતાનાં રૂપલાવજ્યની સામે પીપાજી તાકી રહ્યા. ‘‘અહહ! આને મેં દુષ્ટગણ કરીને ત્યજી હતી! આના દેહમાંથી આટલી બધી માધુરી નીતરી રહી છે, એ મને ખબર જ ન રહી! આ રૂપ ને આ કંઠ શું ભોગને સારુ નહોતાં સર્જયાં? મારી સીતા શું આજ રાતે આ ગરીબ યજમાન-પત્નીનો દેહ ઢંકવા માટે નર્તકી બનશે!’’

‘હિંદુસ્થાની નાચનારી આવી છે! રૂપરૂપનો ભંડાર કોઈ રાજરમણી આવી છે, બાઈ! સાંજ સુધીમાં તો આ સમાચારે ગામને થનગનાવી મૂક્યું. ને રાતે એ લોકમેદનીને પોતાના પગના ઠમકા, હાથના લહેકા તેમજ હિલોળા લઈ રહેલ રૂપ અને સંગીતનું વશીકરણ છાંટીને સીતા માઈએ યજમાન-પત્નીને છોણેછોણે કમાણી રળી દીધી.

એ પીપા અને એ સીતા આ ચાંચની ખાડીના ખમકાર જીલતાં એક સંધ્યાએ આ કંઠણી આહીરોના મુલક પર ઉિતર્યાં અને દેવીનાં ફુણાંને ખારાં ખાડી-નીરમાં પદ્ધરાવી દઈ એક જગત્પતિની ભક્તિ લઈ બેસી ગયાં. એની ગાળેલ વાવ તે પીપાવાવ. આજ ત્યાં ગામડું વસેલું છે, ધર્મનું થાનક રોપાયું છે; અને મહંતાઈ એટલે રજવાડી ઠાડમાઠ, ભોગવિલાસના ભ્રષ્ટાચાર કે સ્વપૂજાનાં પાખંડ નહીં પણ મહંતાઈ એટલે તો પૂર્ણ ત્યાગમાં રંગાયેલ જીવનની સાથ્યોસાથ અહોરાત ધૂળણિશમાં આળોટતી કાયાનું ધેનુઅ૱ણી રક્ષા કાજે શુદ્ધ આત્મસમર્પણ, પરસેવે નવરાવતી જેતરાઉ મજૂરી, ગરીબો-શરણાગતોની ટહેલ - એ સુંદર (બેશક રૂઢિગત) પરંપરાનો કંઈક અવશેષ જો સોરઠમાં કયાંય હજુ ટક્કો હોય તો તે પીપાવાવની જીવામાં દેખાય છે. ત્યાંના વાતાવરણમાં હજુ પીપા-વાણીના પડછંદા ઉઠે છે કે -

પીપા! પાપ ન કિઝાંએ,  
(તો) પુન્ય કિયા સો વાર?

સોરઠને તીરે તીરે : ‘પીપા સીતા રેન અપારા!’

“ભાઈ,” નવસારીવાળા વહાણમાં અમે ઊભા હતા ત્યારે એક સાથીએ સાદ કર્યો : “આવો તો, કંઈક બતાવું.” એમ કહીને એણે એક ખારવાનું બદન ઊંચું કરી એના પેટનો ભાગ ખુલ્લો મૂક્યો. “આ જોયા ડાઘ?”

ખલાસીના પેટ ઉપર પચીસેક ડામનાં ચિંઠો હતાં.

“આ લોકોને પેટમાં દુખાવો ઊપડે,” સાથીએ સમજ પાડી, “ત્યારે એનું ઓસડ આ રીતે કરે. તુરત લોઢું ધગાવીને ડામ ચાંપી દ્વારા દરેકને માટે એ એક જ ઓસડ.”

ત્યાં તો વહાણના પાંચ-છ નાવિકો પોતાની મેળે જ પેટ ખુલ્લાં કરીને ઊભા રહ્યા. દરેકને દસ-પંદર ચંગાં ડામનાં હતાં.

“હવે તમે જુઓ,” સાથીએ દેખાડ્યું, “આ લોકો આ કિનારેથી આપણા રાજુલાના પથરો ઉઠાવી ઉઠાવીને વહાણમાં ભરશે. અક્કેક શિલા દસ-દસ મણની હશે તોપણ બંભે ઉપાડીને આ સાંકડા પાટિયા ઉપર થઈને દોડાદોડ વહેશે. સામે બંદરે જઈને પાછા એ જ પ્રમાણે એ માલ કિનારે ઉત્તારી દેશે. ત્યારે એને આ વહાણનો માલિક જે આપશે તે પેટપૂરતું પણ નહીં હોય. વહાણવાળો વેપારી પોતાની પેઢીની ગાદી ઉપર પડ્યો પડ્યો શાંતિથી આ લોકોનું રણેલું પચાવી જ્શે.

મેં કહ્યું : “દરેક ઠેકાડો અત્યારે તો મોટું માછલું પોતાનાથી નાના માછલાને ખાઈ ખાઈને જ જીવે છે, એવો આપણો દેશકાળ છે.”

## નાવિકોનાં લોકગીતો

આથમતા કાળની ભૂખરી પ્રભામાં અમે એમને દીઠી : જેમના ચારિશ્યની ગિલા - નિંદા  
ડગદેપગતે સાંભળી હતી તેમને : કતપર ગામની એ ખારવાજ બાઈઓને.  
ઉંચાં અને ઉજળાં મનાતાં વણ્ણોને મુખે સાંભળ્યું હતું : બગડેલ ગામ! ભષ શિયળ!  
વેશ્યાવાડો! એ લોકોને બ્રહ્મચર્ય ન મળો!

ધારણા રાખી હતી કે હશે! ફૂલફુગરના ઘેરદાર ઘાઘરા, આછકલી ઓઢણીઓ,  
પાતર-શી ઓળેલી લલાટ-પાટીઓ, વશીકરણાંનાં નખરાં, છક્કાઈ, મોળ્ણલાં જીવન,  
મદ્દોન્માદી મુખબોલ - એવું બધું હશે. તેલ-અરીસા હશે, ભોગની સાહેબી બધીયે હશે.  
નવરાશ હશે, છકેલીઓ નિર્દોષ શહેરને વણસ્પાડી રહી હશે.

પણ અમે સાચોસાચ શું દીકું? ગામ ખાલી દીકું. છૂટાછવાયા હતા તેઓને પૂછ્યું :  
“કૃયાં ગયાં લોકો?”  
“મરદો દરિયાની ખેપે, ને બાઈઓ મ'વે મજૂરી કરવા.” (મહુવા કતપરથી બે ગાઉ  
થાય.)

“કૃયારે પાછી આવે છે બાઈઓ?”

“દિ આથમ્યે.”

“રોજ સવારે ચાર મૈલ જાય, ને રોજ રાતે ચાર મૈલ ચાલતાં આવે?”

“હાસ્તો. નીકર ખાય શું? પથરા?”

સંધ્યાની ભૂખરી પ્રભામાં અમે એ હીજાયેલીઓનાં ટોણોટોળાં વળી આવતાં દીડાં.  
ખેડૂતોની વહુ-દીકરીઓ પહેરે છે તેવાં ધીંગાં, ગૂઢા રંગનાં થેપાડાં ને ઓઢણાં. ક્યાંય રંગોની  
ભભક નહોતી.

નમણી, નિસ્તેજ, થાકેલી, રજે ભરેલી, વાજો...વાજ વહી આવે છે. એને નખરાં,  
હવભાવ અને કામબાજ છોડવાની વેળા ક્યાં છે! શક્તિ ક્યાં છે! વેપારીઓનાં  
કારખાનાંઓમાં પોતાનાં બળજોર નિયોવીને તો એ બાપડી ચાલી આવે છે. ભૂખી હશે..  
ઘેરે જઈ રાંધશે ત્યારે ખાવા પામશે. પરોડના ચાર બજતાં તો પાછી ફફડીને જાગશે.

હથમાં, ખંબે, કાખમાં, કે ખોળમાં નાનું અક્કેક બાળ લીધું છે : કોઈ બે જ મહિનાનું,  
કોઈ બારનું. છાતીએ ધવરાવતી આવે છે. રમાડતી, છિલોળતી, ચૂમતી આવે છે.

ગોરજ વેળાએ હીહોરા દેતું, ઘેર ખીલે બાંધ્યાં વાઇરુને માથે જાડો ધિનુઓનું ધારા ધસ્યું આવે છે.

એના ચહેરા ઉપર શું શું લખાયેલું હતું? વિલાસની રેખાઓ હતી? ના, ના, એ તો હતી વેદનાની, જીવનના કરડા સંગ્રામની, દિશાશૂન્ય દશાની, ગ્રામ્ય આપદાઓની, રોટલાના ઉચાટની, ધણીઓના ચિરવિજોગની કપાળ-કથાઓ.

આજે માર્ગ એ ધરોધણ માનવ-ગાવડીઓ ધૂળના ડમર ચડાવતી ચાલી આવતી હતી.

વેપારીઓની ઉન ફોલતાં વૃંદેવૃંદ દીઠાં એનાં. આઈ વરસની કુમારિકાઓથી લઈ સાઈ વરસની ડોસીઓ : માથાનાં પીંખાયેલાં જીંથરકામાં ઉનની કીટી અટવાયેલી : કામ કરતાં કરતાં ભૂખ્યું પીંજર લૂખા રોટલાનાં બટકાં ચાવે : ઝોળીમાં સુવાડેલ છોકરાં ઉપર ઓઢાડ્યા હોય છે ઉનના લચકા!

આ બગડેલીઓ, ને આપણો ઘેર સતીત્વના ઈજારા!

અમે દીઠા એના ઘેરા ને ઘેરા, બંદર પર કામ કરતા : વહાણોમાંથી માંગલોરી નળિયાં, મલબારી લાકડાં ને ગુણીઓના કોથળા વહે છે. ગાણાં ગાય ને થાક વીસરે છે. ગાળો ખાય ને હસી નાંખે છે. ગૂઢાં વસ્ત્રો, ગંભીર ચહેરા, પગની પીંડીઓ ઉપર વહાણાં-અકારનાં છૂંદણાં. એકાએક સાંભળે કે વહાણો ચડેલ ધણી, દીકરો અથવા ભાઈ અમુક દરિયે ડૂબી મૂઆ. “પછી, બાઈ, તમને વહાણના માલેકો કંઈ જિવાઈ-બિવાઈ આપે ખરા?” “અરેરે ભાઈ, છોકરાના હથમાં એક પાયલીયે નહીં ને. પછી અમે એને આંગણો જઈને અમારું કાળું મોહું શું બતાવીએ?”

આ બ્રષ્ટાઓ – ને આપણો ગાદીખુરસીના બેસતલ ચારમહિયા ચરબીવંતો પવિત્ર!

હવસની પૂતળીઓ ન્હોય આવી. વિલાસનાં મંદિરો ત્યાં ઉભાં હશે, ધનવંતોએ બંધાવેલાં. એ દ્રવ્યમંદિરોની દેવદાસીઓ કોણે બનાવી આ ખારવણોને? કોણે એનાં કલેવરો વેચાતાં લીધાં? કોણ ફસાવનાર? ને કોણ ફસાયેલ? જવાબ પૂછવાથી જડશે નહીં. પોતાની કાળ્ય ઢાંકવા પરાયાને કાળું કહેનાર આપણો ઉજળિયાતો!

પેટના ખાડા પૂરવા સારુ પોતાનાં ખોળિયાં વેચનારાંને આપણાં નીતિ-અનીતિનાં ગ્રાજવાં નહીં તોળી શકે.

એનાં જીવતરમાં તો ચીરા પડ્યા છે, જીવનની શૂન્યતાને. પૂરવા કદાચ એ પરાયાં કલેવરો સેવતી હશે. પણ એ એનું સાચું જીવન નથી. એના જીવન-પડછાયા તો સાચા ને સુરેખ અંકાયા છે એનાં લોકગીતોમાં. જેવું છે તેવું, વણાછુપાબું જિગર એણે ગીતોમાં વહાયું છે –

જેબનિયાં મારાં મલબારી પંથમાં હાલ્યાં,  
જેબનિયાં કાલ્ય આવતાં રેશો!

જોબનિયાં તમે દારુ પીને ગાડાં થૈયાં,  
જોબનિયાં કાલ્ય આવતાં રેશો!

ઉનને કારખાને ઉન ફોલતી બાઈઓને વિનવી કે તમારાં નાવિક-જીવનનો પડધો  
જીલતાં કોઈ લાક્ષણિક ગીતો ગાશો?

“અરે ગાશો, જરૂર ગાશો ભાઈ!” ગામલોકોએ કહ્યું. “એલી એય બાધું આઈ  
ભેળાં થઈને ભાઈને ગીત સંભળાવો. ચાલો ઝડ કરો.”

મેં કહ્યું : “ના, દબાણ કરીને નથી ગવરાવવું. એને કશો સંકોચ ન હોય ને જો  
લહેરથી ગાય તો જ સંભળીએ”

“એને સંકોચ હોય જ નહિ. એને તો ઉલટી મોજ આવે. હાં, ચાલો બાઈઓ, ગાવા  
માંડો.”

- ને પછી નાનીમોટી પંદર-વીસે ઉપાડવું એ વહાજાવટીને વિદાય દેતી વેળાનું ગીત.

## 1

જોબનિયાં મારાં મલબારી પંથમાં ચાલ્યાં

જોબનિયાં કાલ્ય આવતાં રેશો!

જોબનિયાં તમે દારુ પીને ગાડાં થૈયાં. - જોબનિયાં

જોબનિયાં તમે લીલે ગલાસે લાંઝું કરીયું. - જોબનિયાં

જોબનિયાં તમે ગુલાબી દારુ લાવો. - જોબનિયાં

“બાઈઓ, તમારાં ગીતમાં દારુ કેમ આટલો ઉગ્ર પદ્દ દેખાય છે?”

“જુઓ ભાઈ, અમારા જ્ઞાન જ્યારે વાણે ચડવાના હોય, ત્યારે ઘરના વિજોગની  
પીડા વીસરાવવા સારુ અમે એને ખૂબ દારુ પાય્યો. પછી એને અમે બધાં બંદરે મૂકવા  
જાય્યો, તથેં પણ રસ્તામાં ગાતાં ગાતાં એને સીસામાંથી પાતાં પાતાં એના દિલને હુલ્લાસમાં  
રાખીએં, પછી કેફમાં ને કેફમાં ઈ ઝડ ઝડ વાણને હંકારી મેલે, લેરમાં ને લેરમાં ખાડી  
વટાવી જાય, અને મોટે દરિયે પોગે એટલે પછી ઘર એને બહુ ન સાંભરે. આ સાટુ અમે  
એને દારુડે ગાડા કરીએ, ભાઈ? શું કરીએ? તમારી કને દારુનાં ગાણાં ગાતાં લાજીએ  
છીએ અમે.”

“લાજવાની જરૂર નથી. મારે તો એ જ સાંભળવું છે. માટે ગાઓ છૂટથી..” (મનમાં  
થયું કે સાચા જીવન પર ફૂલ-ચાદર ઓડાડનારાં ગીતો તો અમે ઘણાંય રચીએ છીએ!)

જોબનિયાં મારાં નાકુંની નથડી મેલી,

જોબનિયાં કાલ્ય આવતાં રેશો.

જોબનિયું મારું વેકરિયાની ખાડીમાં હાલ્યું. - જોબનિયાં

જોબનિયાં મારાં, પીછેલી સટ્ય છોડવા. - જોબનિયાં

[એટલે કે શઢના દોર પાછળથી છોડવા ને શઢ ખુલ્લા મૂક્યા.]

જોબનિયાંને મુંબીના પંથ લાગ્યા દોયલા. - જોબનિયાં.  
 જોબનિયાં મારાં મુંબીની ગોડીયુંમાં મા'લે. - જોબનિયાં.  
 જોબનિયું મારું જચ્છેલું પિઠે હાલ્યું. - જોબનિયાં.  
 જોબનિયું મારું નાનેથી ગાંદું શૈયું. - જોબનિયાં.  
 જોબનિયાં મારાં, જેવો તેવો દેશી દાડ સારો. - જોબનિયાં.  
 જોબનિયાં મારાં ઘાસલેટનો દાડ સારો. - જોબનિયાં.  
 જોબનિયાંને મારાં ઘાસલેટે ખોટાં પડી જાયે. - જોબનિયાં.  
 જોબનિયાંને પેટુંમાં અગની ઊંઠે. - જોબનિયાં.  
 જોબનિયાં મારાં વાંસેલાં ગોરસ પીશે,  
 જોબનિયાં કાલ્ય આવતાં રે'શે.

“આ તમે ઘાસલેટના દાડનું શું કહ્યું? કંઈ સમજ ન પડી.”

“આપણો રાજે દાડની તો બંધી કરી છે ને, અટલે હવે અમારા જ્ઞાન ભડકીયું કરીને પીવે છે. ‘ભડકીયું’ એટલે શું? કે અસ્પિરિટ (સિપરિટ) આવે છે ને, એને પાણીના ઠામમાં રેડીને પછે માથે એક દીવાસળી સળગાવે, એટલે આકરો નશો બળી જાય, પછી સહુ ઈ પાણી પીવે. ઉપર ગોરસ પીને પેટની આગ ઓલવે. પણ ઈ પીવાથી પુરુષાત્મક વયું જાય.”

‘ગુલાબી દાડાના લીલા ગલાસો ભરી ભરી લાણીઓ’ કરનાર નાવિકોની જીવન-સમસ્યા તો આમ છે ત્યારે! વેદના ભૂલવાનું પીણું! પેટમાં સિપરિટના ભડકા ઠલવવાનું રહેસ્ય તો આવું નીકળી પડજું. જીવતરમાં કોઈ બીજો સંસ્કાર નથી, રસ નથી, ભણતર નથી; ને સામે ઊભેલ છે સદા મોત. એનો સામનો કરવા સારુ આ દયામણી શરાબી! એને સારુ બાયડીએ બાપડીએ –

જોબનિયાં મારાં! નાંકુંની નથડી મેલી,  
 જોબનિયાં કાલ્ય આવતાં રે'શે.

પોતાના ધણીને સુરા પાવા માટે અંગ પરનાં આઇં આભરણ વટાવ્યાં, ગાઈ ગાઈને મનું મનાવે કે ‘જોબનિયાં મારાં કાલ્ય આવતાં રે'શે!’

સુધારકો! તમારી સામે આ સમસ્યા ઉકેલ માગે છે.

મકાન બંધાતું હતું. એક જુવાનડી, બે આધેડ ને પાંચ બુઢીઓ ચૂનો ખાંડતી ખાંડતી ગાવા લાગી. પૂછે છે કે હરિનાં કિર્તનો ગાઈએ? કહ્યું કે ના, એ તો ઘણાં ગાવાય છે અમારાં મંદિરોમાં. એની તો હવે હં થઈ છે. ત્યારે પછી આવાં ગીતો ઉપાડ્યાં :

આંબેથી કેરીયું મગાવ્યિયું  
 રે કાઢ્યો રંગાડામાં રસ રે

\*

ભત્રીજે જાણ્યું કે કક્કો તેડશે!  
 રે દોડી મરડી નારખી ઊક રે!

\*

લખી કાગળ વજેસંગ મોકલે  
રે દાદુભા દરિયો પૂજવા હત્યા રે!

“એ બધાં, રજવાડી હત્યાઓનાં, ઝેર-પ્રયોગોનાં, ગરાસને સ્વાર્થ સગા ભાઈ-ભત્રીજાઓને છેક પારણામાં હજુયાનાં ગીતો પણ, ભાઈઓ! મેં ઘણાં સંઘર્યા છે. મારે તો સાંભળવાં છે તમારાં વહાણવટી જીવનનાં વેદના-ગીતો.”

“ઓહોહો ભાઈ,” ડેશીમાએ કહ્યું : “એવાં તો મારા કોઠામાં છલોછલ ભર્યો છે. હાલો, અમે ભીતે ટીપણી ટીપતાં-ટીપતાં બેસીને ગાશું. ગીતો આમ ચૂંનો ખાંડવામાં ને ફાવે.”

મારા તરફ પીઠ વાળી, ટક, ટક, ટક, દીવાલની સિમેન્ટ ટીપતી ટીપતી, રુદ્ધને સૂરે, કશા તાલ વગર, એ આઈ જણીઓ ગાવા લાગ્યી : પોતાના વા'લાના વહાણ દૂબતું હોય તે સમયનું ગીત :

2

લે'ર તો લાગ્યી ને બેડી બૂડવાને લાગ્યી,  
ઘેલા સમદરિયામાં,  
આખરની રે મુને લેર લાગ્યી.

મધ રે દરિયામાં, વા'લા, વાજલાં <sup>1</sup>હોદાર્યા,  
<sup>2</sup>મડદ નાખીને પાણી લ્યોને માપી!  
ઘેલા સમદરિયામાં. - આખરની રે૦

મધ રે દરિયામાં, વા'લા, મામલા મચાયા,  
ઘાયલ ટંડેલિયાની માયા લાગ્યી!  
ઘેલા સમદરિયામાં. - આખરની રે૦

વા'લા!  
તજને કારણો મેં તો વાવડી ગળાવી;  
પાણીડાંની મસે એક વાર આવી જાની!  
ઘેલા સમદરિયામાં. - આખરની રે૦

વા'લા!  
ઘરની અસતરી સાથે નેહ રે થોડેરો.  
તજ રે રૂપિયા સાટુ જીવડો ખોવો!  
ઘેલા સમદરિયામાં. - આખરની રે૦

<sup>1</sup> હોદાર્યા : થંભાય્યા : હંકારણું ને હોદારણું. <sup>2</sup> મડદ : સીસાનું શંકુ આકારણું વજન રસીને છેડે બાંધેલું, જે દરિયામાં ફેંકતાં ખારવા માપતા જાય છે કે પાણીની ઊંડાઈ કેટલા વાંસ છે.

વા'લા!

તજને કારણિયે મેં તો માંડવા રચાવ્યા,  
ચોરી બાંધી ને ફેરા ફરતો જાની!  
ઘેલા સમદરિયામાં. - આખરની રૂ.

વા'લા!

હથેળીમાં જીવડો લઈને જા મા!  
ઘેલા સમદરિયામાં. - આખરની રૂ.

“બસ ડોસીમા, આ જ જાતનાં ગીત હું માગું છું.”  
“તથેં ઠીક ભાઈ, ગાસું.”

કશી બનાવટી વીરતા વગરની, સાચી ઊર્ભિઓ ઊઠી છે આ ગીતમાં. “હથેળીમાં જીવ લઈને જા મા : ત્રણ રૂપિયાની કમાણી સારુ જીવડો ખોઈ નાખવા તું જા મા! ને જો જવું જ હોય તો મારી જોડે પરણીને પછી જા. અરેરે, તારો ઘરની સ્ત્રી સાથેનો સ્નેહ ઓછો થઈ ગયો છે. મને એ વહેણના પ્રીત-ધ્યાયલ ટેલની માયા લાગી ત્યાં તો એ વહેણ હંકારી ગયો, ને ઘેલા સમદરની આખરી લહેરોએ મામલા મચાવીને એની બેડલી (નૌકા) દુખાવી નાખી.”

ડોસીઓએ બીજું ગીત ઉપાડ્યું :

3

પાંચ વા'ણુંનો કાફ્લો, એલા! પાંચ વા'ણુંનો કાફ્લો,  
તેમાંલો એકલો હકરાણો, જવાનડા!  
એકલો હકરાઈશ મા, એલા! એકલો હકરાઈશ મા,  
કાચા હૈયાના ઘણી! એકલો હકરાઈશ મા,  
વાવડાનું જોર છે, એલા! વાવડાનું જોર છે,  
હેમત રાખીને સટ્ય છોડજે, જવાનડા!  
સટે વાવડ મેલજે, એલા, સટે વાવડ મેલજે,  
બારે આવીને નગારું કરજે, જવાનડા!  
ધામસનું જોર છે એલા, ધામસનું જોર છે,  
હેમત રાખીને ધામસ કાઢજે, જવાનડા!  
નથી તારે માવડી એલા, નથી તારે બેનડી,  
પડીશ તો ચાકરી કોણ કરશે, જવાનડા!  
મંબી તું જાજે એલા, મંબી તું જાજે,  
એલા આઘે બંદર તું જાશ મા, જવાનડા!  
મલબારે જાશ મા એલા, મલબારે જાશ મા!  
મલબારી પંથ તો લાગે દોયલા, જવાનડા!

લીલુડી પીઠનાં એલા, લીલુડી પીઠનાં  
 લીલાં લવિગડાં તું લાવજે, જવાનડા!  
 રૂપાળી ગોત્ય મા એલા, રૂપાળી ગોત્ય મા,  
 રૂપાળી બાવડાં બંધાવશે, જવાનડા!  
 છેટાંની ગોત્ય મા એલા, છેટાંની ગોત્ય મા,  
 છેટાંની છેતરી જાશે, જવાનડા!  
 પડખાની ગોત્ય મા એલા, પડખાની ગોત્ય મા,  
 પડખાની પતળી જાશે, જવાનડા!  
 કુંવારી ગોત્ય મા એલા, કુંવારી ગોત્ય મા,  
 કુંવારી છે નાણાંની લાલચુડી, જવાનડા!  
 ફળિયામાં ફર્ય મા એલા, ફળિયામાં ફર્ય મા,  
 હાલતો ચાલતો નજરે ચહેર્ય મા, જવાનડા!  
 વાડચે તું હાલ્ય મા એલા, વાડચે તું હાલ્ય મા,  
 વાડચે હાલીને વાંકાં બ્યોલ્ય મા, જવાનડા!

**અર્થ :** પાંચ વહાણોનો કોફલો છે, તેમાંથી, હે મારા પ્રીતમ, તું તારું વહાણ એકલું તારવીને હંકારજે.

હે કાચી છાતીવાળા જુવાન! તું એકલો કાં પડી જા?  
 પવન જોરથી ઝૂકે છે. માટે તું હિમત રાખીને સરખા પ્રમાણમાં શઢ છોડજે,  
 હે જુવાન!

તું શઢમાં પવન ભરાવા દેજે. ને પછી બંદરમાં પહોંચ ત્યારે નગારું વગાડજે,  
 એટલે અમને તારા આવ્યાની જાણ થાય.

તારા વહાણમાં પાણી (ધામસ) જોરથી ભરાવા લાગ્યું છે. એને તું હિમત રાખીને  
 ઉદેચવા માંડજે.

હે જુવાન, તારે મા કે બહેન નથી. તું માંદો પડીશ તો તારી ચાકરી કોણ કરશે ?  
 હે જુવાન, તું મુંબઈથી વધુ દૂર જઈશ મા. મલબારના પંથ ઘણા દોષલા છે.  
 તું લીલાં-પીળાં લવિગડાં મોતી લેતો આવજે.  
 તું લગ્ન કર તો બહુ રૂપાળી કન્યા ન ગોતજે, કેમ કે એ તને કોઈક દિવસ  
 કેદમાં નખાવશે.

દૂરની કન્યા ન ગોતજે, એ તને છેતરીને ચાલી જશ..  
 બહુ નજીકની પણ ન ગોતજે, એ વિફરી જશ..  
 કુંવારી ગોતીશ મા. એ નાણાંની લાલચુ હોય છે.]

કોઈ દૂરના પંથથી વહાણ હુકારીને ઘર તરફ ચાલ્યા આવતા જુવાનને સંબોધિલું  
આ ગીત દરિયાનાં વાવાજોડાં, વહાણનાં ભરાઈ રહેલ પાછી, ઈત્યાદિ સંકટોની કલ્યનાઓ  
આલેખે છે. એ કલ્યના કરનાર કોઈ નાવિકની માશૂક છે.

ગાતાં ગાતાં ડોશીઓ સંકોચ પામતાં હતાં. કહે કે ભાઈ, અમે બુઢી ઉમ્મરે આવાં  
શોખનાં ગીતો ગાતાં લાજુએ છીએ. મેં ખાતરી આપી કે હું શોખનાં ગીતો તરીકે એમાંથી  
મજા લેવા નથી માગતો, મારે તો તમારા જીવનસંસારની સાચી વેદનાઓ ને આકંશાઓ  
પુકડવી છે.

ચોથું ગીત પણ એતું જ સાચું ચિત્ર આપે છે :

#### 4

વા'ણે ચડચે રે એલા વા'ણે ચડચે,  
મારા મામાના માલિયા, વા'ણે ચડચે.

મંબી જાજે રે એલા મંબી જાજે.  
મારા મામાના માલિયા, મંબી જાજે.

મોતી લાવજે રે એલા મોતી લાવજે,  
મારા મામાના માલિયા, મોતી લાવજે.

કેવાં લાવું રે એલી, કેવા લાવું,  
મારા ઝીબાની દીકરી, કેવાં લાવું.

લીલાં લાવજે રે એલા પીળાં લાવજે,  
મારા મામાના માલિયા, રાતાં લાવજે.

ખાતર પાડચું રે ઈણે ખાતર પાડચું,  
મારા મામાને માલિયે ખાતર પાડચું,

શું શું ચોર્યું રે ઈણે શું શું ચોર્યું.  
મારા મામાને માલિયે શું શું ચોર્યું.

હાર ચોર્યો રે ઈણે ઝૂમણાં ચોર્યો,  
મારા મામાના માલિયે હાર ચોર્યો.

બાંધી વારો રે ઈને બાંધી વારો,  
મારા મામાના માલિયાને બાંધી વારો.

હેડચમાં પૂરો રે ઈને હેડચમાં પૂરો.  
મારા મામાના માલિયાને હેડચમાં પૂરો.

છોડી મેલો રે ઈને છોડી મેલો,  
મારા બાળુડા જીવડાને છોડી મેલો,

માયા રાખો રે થોડી દીવા રાખો,  
મારા નાનુડા જીવાનની માયા રાખો.  
રમવા હેજો રે ઈને ભમવા હેજો,  
મારા બાળુડા જીવાને રમવા હેજો.

આ લોકો તો મામા-કુઈનાં વરે-પરણે ખરાં ને, એટલે પરણેલી પોતાના પરણ્યા નાવિકને (અથવા કોઈ અપરિણીતા પોતાના વિવાહિત વરને) મારા મામાના માત્રિયા! એવું ટીખળી સંબોધન કરતી કહે છે : વહાણે ચડાને તું મુંબઈ જા, ત્યાંથી મારે સારુ મોતી લાવજે, મારે ભરતકામ કરવું છે.

નાવિક જીવાનડો સામું ટીખળ કરે છે : હે મારી ફરજબાની છોકરી, તારા સારુ કેવાં કેવાં મોતી લાવું?

લીલાં, પીળાં ને રાતાં લાવજે.

કંગાલ ખારવો પોતાની પરણેતરને સારુ મોતી મેળવવા માટે ચોરી કરે છે. કોઈ ધનવાનનો હાર ચોરે છે : પકડાય છે.

પરણેલીને પ્રથમ તો મોંજ આવે છે? એ ચોરને કેદમાં પૂરો!

પણ પોતાના પિયુને ખરેખર કેદ બનેલો દીઠા પછી સાચી ઊર્મિ આવે છે : એને છોડી મેલો. એ હજુ બાળુડી ઉમ્મરનો છે : એના ઉપર દયામાયા રાખો, સા'બ! એને છૂટો રમવા ભમવા દ્યો!

આ પછીનું ગીત બેદક છે, તે ઉપરાંત સોરઠના ઉગમણા કિનારાનું એક ઐતિહાસિક તત્ત્વ પણ રજૂ કરે છે. ઈસ્ટ ઇન્ડિયા કુપનીના વહીવટ દરમિયાન ગોરાઓની સાથે ફસાવવાના કેટલાક પ્રસંગો બંગાળાનાં ગામડાંની સુંદર સ્ત્રીઓને પડચા હશે, તેનું ચિત્ર બંકિમચંદે પોતાની વારતાઓમાં દોર્યું. છે, સોરઠને કિનારે ફ્રિરંગી કુપનીઓનાં થાજાંઓ પડચાં હતાં, તેના અવશેષો પૂર્વકાંઠને અમુક ગામડે હજુ મોજૂદ છે. કણસાર ગામમાં ફ્રિરંગીઓનું ધમદિવાલય ઊભું છે. સંત નિકોલાસ પરથી જેનું નામ પડયું હોવું જોઈએ તે 'નિકોલ' નામનું બંદર પણ હજુ છે. આમ સાગરતીરની એ પદ્ધી પર ફ્રિરંગી ગોરાઓના અમુક અપહરણ-પ્રસંગો બન્યા હશે. તેનું વાતાવરણ આ ગીતમાં છવાયું છે.

ગરીબ ખારવો ખેપે જાય છે. નિરાધાર ખારવણ પિતરાઈઓનું ને મોસાળિયાનું શરણ લે છે, પણ તેઓ એને દુઃખ આપે છે. પછી એક દિવસ એ બાઈ, બંદર પર તંબુ તાણીને પુટેલ 'જાંગલા' અથવા 'થોપીવાળા'ના પ્યારમાં ફસાઈ ગઈ.

## 5

તું તો મંબી હાલ્યો, તું તો મલબાર હાલ્યો.  
નાશાંની રે ખોટ્યે, ખરચીની રે ખોટ્યે.

અધવચમાં મેલ્યાં, અધવચમાં મેલ્યાં,  
કોઈ તડનાં નથી, ઘરબારનાં નથી!

ਛੇਟਾਨਾਂ ਰੇ ਛੈਧੋਂ, ਆਖਾਨਾਂ ਰੇ ਛੈਧੋਂ।  
ਰਾਖੋ ਤੋ ਰੇ ਰੈਧੋਂ, ਰਾਖੋ ਤੋ ਰੇ ਰੈਧੋਂ।

ਕਾਕਾਨਾ ਰੇ ਕਾਕੁ, ਮਾਮਾਨਾ ਰੇ ਮੂਕੁ,  
ਫੁ:ਖਡਲਾਂ ਰੇ ਫੇਵੇ, ਫੁ:ਖਡਲਾਂ ਰੇ ਫੇਵੇ।

ਜਾਂਗਲੋ ਰੇ ਆਵਾਂ, ਟੋਪੀਵਾਰੋ ਆਵਾਂ,  
ਪੀਥਲਪਰਨੇ ਪਾਧਰ, ਤੇਰਾਣਾਨੇ ਪਾਧਰ।

ਤੰਬੁਡਾ ਰੇ ਤਾਝਧਾ, ਤੰਬੁਡਾ ਰੇ ਤਾਝਧਾ,  
ਪੀਥਲਪਰਨੇ ਪਾਧਰ, ਤੇਰਾਣਾਨੇ ਪਾਧਰ।

ਰਖਮਾਈ ਪਾਣੀ ਹਾਲੀ, ਰਖਮਾਈ ਪਾਣੀ ਹਾਲੀ,  
ਜੀਲਿਭਿਧੇ ਰੇ ਤਣਾਵ, ਜੀਲਿਭਿਧੇ ਰੇ ਤਣਾਵ।

ਵਾਂਸੇ ਜਾਂਗਲੋ ਹਾਲਧੋ, ਵਾਂਸੇ ਜਾਂਗਲੋ ਹਾਲਧੋ,  
ਰਖਮਾਈਨੇ ਲੇਵਾ, ਰਖਮਾਈਨੇ ਲੇਵਾ।

ਫੇਰਾ ਫਰਵਾ ਫੇ ਨੇ! ਜਵਤਲ ਹੋਮਵਾ ਫੇ ਨੇ!  
ਪੇਛੇਂ ਤਮਾਰਾਂ ਛੈਧੋਂ, ਪੇਛੇਂ ਤਮਾਰਾਂ ਛੈਧੋਂ।

ਵੰਟੋਣੇ ਰੋ ਆਵਾਂ, ਵੰਟੋਣੇ ਰੇ ਆਵਾਂ,  
ਚੂਂਦਲਤੀ ਰੇ ਉਤੀ, ਪਾਂਭਲਤੀ ਰੇ ਉਤੀ।

ਚੂਂਦਲਤੀ ਰੇ ਉਤੀ, ਪਾਂਭਲਤੀ ਰੇ ਉਤੀ。  
ਟੋਪਿਧਾਨੇ ਘੇਰੇ ਪੋਢੀ, ਜਾਂਗਲਾਨੇ ਘੇਰੇ ਪੋਢੀ।

**ਅਰਥ :** ‘ਹੇ ਪਿਧੁ, ਤੁੰ ਤੋ ਘਰਖਰਨੇ ਅਭਾਵੇ ਮੁੰਬਈ ਅਨੇ ਮਲਬਾਰਨੀ ਸਫਰੇ ਚਾਲਧੋ  
ਗਧੋ।

ਮਨੇ ਤੌਂ ਪਰਾਇਆ ਕਿਨਾਨੀ, ਰਾਖਤੀ ਸਥਤਿਮਾਂ ਮੂਕੀ। ਮਾਰੇ ਨ ਮਨੇ ਕੋਈ ਕਿਨਾਰੋ,  
ਨ ਮਨੇ ਘਰਬਾਰ।

ਹੇ ਕਾਕਾਨਾ ਅਨੇ ਮਾਮਾਨਾ ਪੁਤ੍ਰੀ, ਹੁੰ ਬ਷ੁ ਫੂਰਨੀ ਰਹੇਨਾਰੀ ਛੁੰ। ਤਮੇ ਆਸ਼ਰੋ ਆਪੋ  
ਤੋ ਹੁੰ ਪਤੀ ਰਹੁੰ।

ਪਾਣ ਕਾਕਾ-ਮਾਮਾਨਾ ਦੀਕਰਾ ਤੋ ਰੁਖਮਾਈਨੇ ਫੁ:ਖ ਫੇਵਾ ਲਾਗਧਾ।

ਏਕ ਛਿਵਸ ਏ ਪੀਥਲਪਰ ਅਨੇ ਕੇਰਾਣਾ ਗਾਮਨੇ ਪਾਇਰ ‘ਟੋਪੀਵਾਣਾ ਜਾਂਗਲਾ’  
ਫਿਰੰਗੀਓਏ ਪਤਾਵ ਨਾਖਧਾ।

ਰੁਖਮਾਈ ਤਣਾਵ ਪਰ ਪਾਣੀ ਭਰਵਾ ਜਤੀ ਹਤੀ।

ਅਨੀ ਪਛਵਾਤੇ ਪਛਵਾਤੇ ਫਿਰੰਗੀਸ਼ਾਡੇਬ ਪਾਣ ਚਾਲਧੋ। ਰੁਖਮਾਈਨੇ ਏ ਉਠਾਵੀ ਜਵਾ  
ਮਾਗਤੋ ਹਤੋ।

ਜਧਾਰੇ ਅਨੇ ਫਿਰੰਗੀਏ ਪਕਤੀ, ਤਧਾਰੇ ਏ ਕਾਲਾਵਾਲਾ ਕਰਵਾ ਲਾਗੀ ਤੇ ਹੁੰ ਹੁੰ  
ਅਵਿਵਾਹਿਤ ਛੁੰ। ਮਨੇ ਕਲਾਂਕ ਲਾਗਸ਼ੇ। ਮਾਟੇ ਹੁੰ ਏਕ ਵਾਰ ਮਾਰਾ ਧਾਣੀ ਜੋਤੇ ਲਗਨਨਾ ਫੇਰਾ

ફરી લઉં ને લગ્ન-વેદીમાં જવતલ હોમી લઉં એટલી અવધ તુ મને આપ પછી હું  
તારી જ બનીશ.

પરંતુ પછી તો વટોળો વાયો, રૂખમાઈની ચૂંદડી ઉડી પડી.

એની ચૂંદડી ઉડી, ને એ તો યોગીવાળાના ઘરમા પોકી ગઈ.)

આ રીતે અનેક નાવિક-પુનીઓ આ પરદેશીઓની હવસ-જાળમાં ફસાઈ પડ્યાના  
કરુણ કિસ્સાઓ બન્યા હશે, ને તેમાંથી આવાં ગીતો દવ્યાં હશે. તમે આ ગીત સાંભળો  
તો તમને ખાતરી થશે કે આ મલિન ગમ્મતનું કે સામાજિક કટાક્ષનું નહીં પણ અસંખ્યાતની  
આહ દર્શાવતું રૂદ્ધન-ગીત છે. બંકિમબાબુની 'ચંદ્રશેખર' નામની કથામાં એ જ રૂદ્ધન  
ઠલવાયું છે.

બેવજ્ઞાઈ ઉપર અફસોસ દર્શાવતું આ તે પછીનું ગીત :

6

રે ખાડીમાં મદ્ધવો, એલા!

રે ખાડીમાં મદ્ધવો;

એકને મેલી બીજાને નીસવ્યો, જવાનડા!

રે દરિયામાં લીલ છે એલા!

રે દરિયામાં લીલ છે;

સાચી નજ્રું ને ખોટાં હિલ છે, જવાનડા!

રે કાપડામાં હીર છે, એલા!

રે કાપડામાં હીર છે;

ગાંગલો મેઘુરિયો મારો વીર છે, જવાનડા!

રે નેરાં ને ખાતરાં એલા!

રે નેરાં ને ખાતરાં:

જાડા દિવસનાં પડ્યાં વાંતરાં, જવાનડા!

રે ઓઢેલી ઘાંટડી, એલા!

રે ઓઢેલી ઘાંટડી:

આઠ્યે દા'ં જોઉં તારી વાટડી રે, જવાનડા!

રે ખેતરમાં ઓઘ્યો, એલા!

રે ખેતરમાં ઓઘ્યો;

વા'ણ આવે ને કરું મોંઘો રે, જમાનડા!

રે હાથુમાં સૂપડું, એલા!  
 રે હાથુમાં સૂપડું;  
 શ્વરો આવે ને વાંશ ઉપડયું રે, જવાનડા!  
  
 રે દીંસાંમાં ભટિયાં, એલા!  
 રે દીંસાંમાં ભટિયાં;  
 હવે વિખાણાં મારાં ઝંટિયા રે, જવાનડા!  
  
 રે હાથુમાં સોટી, એલા!  
 રે હાથુમાં સોટી;  
 હવે કરીશ મા મને ખોટી રે, જવાનડા!  
  
 રે ખોળામાં ખારકું, એલા!  
 રે ખોળામાં ખારકું;  
 ખારને દરવાજે તારું પારખું રે, જવાનડા!  
  
 રે ખેતરમાં બોરડી, એલા!  
 રે ખેતરમાં બોરડી;  
 મ'વે આવીને લેશું ઓરડી રે, જવાનડા!

**અર્થ :** જુવાન ખલાસી! હજુ તો તારો મછવો ખાડી પાર કરીને નીકળ્યો નહોતો ત્યાં તો તારી માશૂકે તને મૂકીને બીજા સું પ્રેમ બાંધ્યો.

હે જુવાન! દરિયા માયલી લીલ જેમ દેખાવમાં રૂપાળી પણ અનુભવમાં લપસણી છે, તેમ જ પ્રેમીઓની નજરમાં પ્રેમ દેખાય છે પણ અંદરનાં ઢિલ ખોટાં હોય છે.  
હે જુવાન, હું સાચું જ કહું છું કે ગાંગલો મેઘુરિયો નામનો નાવિક મારો ભાઈ જ છે. એની સાથે મારે સ્નેહ નથી..

દરિયામાં જેમ ઊંડી ગાળીઓ હોય છે તેમ મારીતારી વચ્ચે પણ ઘણા દિવસનું અંતર પડી ગયું છે.

ઘાંટડી (ચૂંદડી) ઓળીને હું આજ આઠમે દિવસે તારી વાટ જોઉં છું.

આપણા ખેતરમાં અન્પજનો ઓઘો (ફગલો) ખડકાઈ ગયો છે. હવે તો તારું વહાણ ઘેરે આવે એટલે હું તને અત્યંત મોંઘો (ખહિમાવંતો) કરું. ખૂબ પ્રેમ કરું.

મારા હાથમાં સૂપડું હતું. શિયાળો, કે જે સહજીવનની ઝાતુ છે, તે આવતાં જ તારું વહાણ તો ઉપડી ગયું.

રેતીના ફગલામાં એટલાં બધાં ડાભોળિયાં (કાંટા જેવું ઘાસ) છે, કે ખેતરમાં કામ કરતાં કરતાં એ કાંટા ભરાઈ ભરાઈને મારાં ઝંટિયા (વાળ) વીંખાઈ ગયાં છે.

હવે તું મને વાટ ન જોવરાવ.

શહેરને બંદર-દરવાજે તારી પ્રીતિની પરીક્ષા થઈ જવાની.

તું આવીશ એટલે આપણો મહુવા શહેરમાં એક ઓરડી ભાડે રાખશું ને ત્યાં સ્વતંત્ર રહેશું.]

## ભષ ગીતો?

કોઈ ભાગેડુ ખારવજાનું જંખના-ગીત ગવાયું. આવાં ગીતોને આપણો 'ઠમ્મોરલ' કહીએ છીએ. 'ઠમ્મોરલ': ભષ : કારણ? કારણ કે આ ગીતો પોતાનાં ગાનારાનું જીવન જેવું છે તેવું ગાઈ બતાવે છે. બીજું કારણ એ કે આપણાં નીતિનાં, પવિત્રતાનાં તેમજ સભ્યતાનાં ધોરણો જુદાં છે. આપણી કવિતા જીવનની સામે આરસી ધરતી નથી. એટલે આપણને એક જ જ્યાલ રહી ગયો છે કે સાચી વા જોટી, સ્વાભાવિક કે બનાવટી, ભાવનાના ઝાકમણોળ હિંડોળા ચડાવે તે કવિતા.

હું તો આદર્શોની કવિતા શોધવા નહોતો આવ્યો. ગ્રામ્ય ગીતોમાં કાવ્યનું તરત્વ ઘણું ગરીબ હોય છે. એ કાવ્યો નથી, જીવનની આરસીઓ છે. મારે તો એમાં અંકિત બનેલી ખલાસી-જીવનની રેખાઓ પકડવી હતી. કોઈ ફસાયેલી, દગાનો ભોગ થઈ પડેલી ખલાસી કન્યાની મેં આ કાવ્ય-છબી સંધરી લીધી :

7

પીથલપરનો પાવો રે, માલિયા! પીથલપરનો પાવો;  
તારા પાવાને રાગે હાલી આવું રે, મારી હેડી!

પછવાડે પાવા વાગે રે, માલિયા!  
પછવાડે પાવા વાગે,  
તારા પાવાને લીલાં પીળાં મોતી રે, મારી હેડી!

હાલ્યને ભાગી જાયેં રે, માલિયા!  
હાલ્યને ભાગી જાયેં!  
આપણો ભાગીને ભાલ ભેળાં થાયેં રે, મારી હેડી!

મંબી શો'ર છે મોટું રે, માલિયા!  
મંબી શો'ર છે મોટું.  
તુંને કી કી ગલીયુંમાં ગોતું રે, મારી હેડી!

તારા પગની બેડી રે, માલિયા!  
 તારા પગની બેડી;  
 તેના મુને કડલાં ઘડાવો રે, મારી હેડી!  
  
 તારા અંગનો રે રૂમાલ, માલિયા!  
 તારા અંગનો રે, રૂમાલ,  
 તારા રૂમાલિયા દેખી રુંગાં આવે રે મારી હેડી!

હાથુંમાં છે સોટી રે, માલિયા!  
 હાથુંમાં છે સોટી,  
 હવે તારી દાનત થઈ છે ખોટી રે, મારી હેડી!

**અર્થ :** હે મારા જોડીદાર પિયુ માલિયા! પીથલપર ગામથી તારો પાવો (બંસી) બજી રહેલ છે. એ પાવાને લીલાં પીળાં ફૂમકડાં શોભે છે.

મારી પછવાડે પછવાડે એ પાવો તું બજાવે છે. એના સૂરોનું વશીકરણ થતાં હું આકર્ષાઈને ચાલી આવી છું. હે મારા જોડીદાર :

હે માલિયા! ચાલો આપણો બેઉ નાસીને ભાલ પ્રદેશમાં ચાલ્યાં જઈએ.  
 તું તો મુંબઈ ચાલ્યો ગયો. એવડા મોટા શહેરની કઈ કઈ ગલીમાં હું તને શોધું?  
 હે માલિયા! તારા પગનાં ઘરેણાંમાંથી મને કડલાં ઘડાવી દે.  
 તારા અંગ ઉપર શોભતો રૂમાલ દેખીને મને પ્રેમનું રુદ્ધન આવે છે.  
 પણ તારી મારા પ્રત્યેની વૃત્તિ હવે બદલી ગઈ છે. તું મને રજ્ઞાવે છે.]

\*

આનું જ કોઈ ભગનહૃદયી ('બ્રોકન-હાર્ટેડ') ગ્રામ્ય યૌવનાનું સાત વંશો પર સંઘરેલું ગીત યાદ આવે છે : ઘણો કસુણ એનો ઢાળ છે :

8

ઊરી તળાવડીનો આરો!  
 માયાળુ રે, ઊરી તળાવડીનો આરો,  
 તારે માથે બંધૂકુનો ભારો રે, માયાળુ!

નોધારી તે મુને રાખી,  
 માયાળુ રે, નોધારી તે મુને રાખી,  
 હું તો વાટલડી જોઈ જોઈ થાકી રે, માયાળુ!

તારા તે હાથમાં છતરી,  
 માયાળુ રે, તારા હાથમાં છતરી,  
 તારી છતરી દેખીને વાત પતળી રે, માયાળુ!

તારી તે ડેકમાં છે કઢી,  
માયાળુ રે, તારી તે ડેકમાં છે કઢી,  
તારી કઢી દેખીને વાત કઢી રે, માયાળુ!

મરજે ને માંદો તું પડજે,  
માયાળુ રે મરજે ને માંદો તું પડજે,  
તારા જીવતમાં જીવડાં પડરો રે, માયાળુ!

અને એવું જ એક બીજું ગીત :

9

હજ્યે ના'વ્યો રે હેડીનો હજ્યે ના'વ્યો,  
છીલ માયલો છીલછીગાળો હજ્યે ના'વ્યો.

સીમાડાની વાટ્યું રે હેડીના સીમાડાની વાટ્યું,  
સીમાડે જોઈ જોઈને રે મારી ઓડ્યું ફુઃખી.

માથડાં ફુઃખે રે હેડીનાં માથડાં ફુઃખે  
આછે ને રૂમાલિયે રે વાલ્યમનાં માથડાં બાંધો.

એ ગીતમાં પણ ત્યજી જનાર પુરુષને માટે ઝંખના ગવાય છે. આ ગીતો મશકરીનાં  
નથી, 'ઈશક'નાં નથી. સ્ત્રી-હૃદયના ભુક્કા થતાં જે અવાજ ઉઠે છે, તે અવાજ આ ગીતોનો  
છે. પરંતુ આપણી સૌષ્ઠવ અને સભ્યતાની લાગણી ('સેન્સ') કંઈક એવી તીક્ષ્ણ બની  
છે કે આવાં તો શું, નીચે લખું છું તેવું ગોવાળ-ગોવાળણનું સંવનન-ગીત પણ આપણને  
સુગાવે છે :

10

બકરાં તરસ્યાં જાય છે રે, સોમલ!  
બકરાં તરસ્યાં જાય છે,  
જાય છે રે, મારા ઘેલીડા રે રબારી!

ખોબલે પાણી પાય છે રે, સોમલ!  
ખોબલે પાણી પાય છે :  
પાય છે રે, મારા ઘેલીડા રે રબારી!

વેળુમાં વીરડા ગાળશું રે, સોમલ!  
વેળુમાં વીરડા ગાળશું.  
ગાળશું રે, મારી સોમલડી રે હજારણ!

પહલીએ પાણી પીશું રે સોમલ!  
 પહલીએ પાણી પીશું.  
 પીશું રે, મારી સોમલડી રે હજારણ!

અરધાના લાડવા લેશું રે, સોમલ!  
 અરધાના લાડવા લેશું,

આરે બેસીને આપણ જમશું રે, મારી સોમલડી રે હજારણ!

અર્થ: સોમલ નામની ગોવાળ-કન્યા કહે છે કે હે ઘેલુડા રબારી! આ તારાં  
 બકરાં તરસ્યાં જાય છે.

હે ઘેલા રબારી! તું બકરાંને ખોબે ખોબે કેટલુંક પાણી પાઈશ?

ગોવાળ જવાબ આપે છે: હે મારી વહાતી સોમલ! આપણે બેઉ મળીને નદીની  
 વેકુરીમાં વીરડા [પાણીના ખાડા] ગાળશું.

પછી એમાંથી આપણે બંને અંજલિઓ ભરી ભરીને પાણી પીશું.

અરધા રૂપિયાના લાડુ લઈને આપણે નદીના આરા પર બેસી જમશું.]

‘દક્ષિણ હિંદનાં લોકગીતો’ સંગ્રહનાર યુરોપી વિદ્વાન ચાર્લ્સ ગોવર એ સંબંધમાં  
 લખે છે કે :

“મનોવિકારવાળા પ્રત્યેક જીવનની અંદર પ્રવેશતી જે બાબતો છે, તેને વિશે જરીક  
 ઠિશારો પણ ન કરવાની આપણા નર્યા શિષ્ટાચારે જ મના કરી છે... બાકી તો આપણા  
 બીજે ઢળતા શિષ્ટ સાહિત્યની સપાટી ઉપર જે કદ્દી જ ન તરવરી શકે, ને છતાં જે ઉર્મિઓ  
 પ્રજાની માન્યતાઓના ખુદ તત્ત્વ સમાન છે, તે આંતર્ગત ભાવોના ઉચ્ચારણને સદા તાજું  
 જ રાખનારાં આ લોકગીતો છે.”<sup>1</sup>

ટેઝ્સ નદીના ઉપરવાસના પ્રદેશમાંથી લોકગીતો વીજાનારા અંગ્રેજ આલ્ફ્રેડ  
 વિલિયમ્સને પણ એ ‘અશ્રિષ્ટ ને અસભ્ય’ પ્રકારનાં ગીતો મહત્વનાં લાગ્યાં. એણે લખ્યું છે:

“આ ગીતો સંઘરવા બદલ હું વાચકની માઝી નથી માગતો. એ અસભ્ય હશે,  
 પણ સંદર્ભ દુષ્ટ નથી. એમાંનાં ઘણાંએક તો કટાકશગીતો છે. એ અનીતિને આદેખે છે  
 તે કંઈ અનીતિને ઉત્તેજવા કે સૂચિત કરવા અર્થે નહીં પણ મર્મપ્રહારો કરવા માટે. આજે  
 આપણે એને અસભ્ય કરીએ, પણ સરલ અને અણવંઠેલા ગ્રામ્યજનોને એ અરસાને નહોતાં  
 લાગતાં. તેઓને એથી કશી હાનિ નહોતી દેખાતી. શરમ અને લજજાની તેઓની સમજ  
 આપણા જેવી નહોતી. આપણી સરખામણીએ એ લોકો નિર્દોષ હતાં. આપણને લજજા  
 અને સભ્યતાનું ભાન થયું, પણ તે કેટલા મોટા ભોગે! સાચી વાત એ છે કે શરમ આપણા

<sup>1</sup> ‘A mere conventionality has tabooed all verbal reference to matters that enter into the life of every sentient being... They (folksongs) keep up to date, as it were, the expression of those inner feelings which never rise to the surface of a set literature, but in reality the very essence of popular belief.’

પણ છે, ગામડિયાંને પણ નહીં. ને વળી જ્યારે ગીતો દેખીતાં જ દુષ્ટ હતાં, ત્યારે પણ રેમને વિશે આટલું તો કહી શકાય કે એ પ્રામાણિકપણે દુષ્ટ હતાં. એટલે કે એ સીધાં-સાદાં, નિખાલસ ને સ્વાભાવિક હતાં. બીજી રીતે કહું તો એ નિતિપૂર્વક અનીતિમાન હતાં. આપણા આજકાલના જલસાઓમાં ગવાતાં કેટલાંક ગીતોની પેઠે એ ગ્રામ્ય ગીતો શબ્દચાલાકીથી દુષ્ટ સૂચન કરનાર નફટ દંભી ગીતો તો નહોતાં જ.”<sup>2</sup>

---

<sup>2</sup> ‘I make no apology for them. They were rude, but not altogether bad. Many of them were satirical. They deal chiefly with immorality not to encourage or suggest it, but to satirize it... No doubt they served their purpose though we of our time, should call them indelicate. Yet the simple, unspoiled rustic folks did not consider them out of place. They saw no harm in them. But they knew not shame as we do : they were really very innocent compared with ourselves. We have had our eyes opened, but at what a price! Of a truth the shame is on our side and lies not with the rustics. And where the songs were professedly bad, this might be said of them that they were so honestly; that is to say, there were simple, open and natural; they were morally immoral if I may say so and not cunningly suggestive and damnably hypocritical, as are some of the modern music-hall pieces.’

12

## વિદ્યા

૨૫, ૨૫, ૨૫, થાળીમાં દાણા ચણતાં પક્ષીઓની માફક ટીપણીઓ દીવાલને થીપી રહી છે : શોકાકુલ વાતાવરણ છે : માર્ગ નીકળતાં મહુવાવાસીઓ પ્રથમ આ તમાશાથી વિસ્મય પામીને પછી નિઃસ્તબ્ધ પગે થોબે છે : કતપરની ખારવણો માવા-જેસા નામના બે જુવાન ખારવાઓની જલસમાં ગાય છે :

11

માવા, ગાયું ચરે ને વાછુ ટળવળે.

માવા, જાતાં ચરે લીલો ઝીંઝવો,

માવા, વળતાં ચરે નાગરવેલ્ય રે

માવો ને જેસો નહીં મળે.

માવા, ચોરે કસુંબા ઘોળાવિયા,

માવા, ભાયબુંધને ઘાલા પાતા જાવ રે

માવો ને જેસો નહીં મળે.

માવા, સૂડી સોપારી બેવડ વંકડી,

માવા, કચેરીમાં કટકા ઢેતા જાવ રે

માવો ને જેસો નહીં મળે.

માવા, પોટલિયામાં પાણી લેજો પોંચતાં,

માવા, ભાતાં લેજો ભરપૂર રે

માવો ને જેસો નહીં મળે.

માવા, લેજો ખેલણ તુડા ઘોડલા,

માવા, લેજો લોડણ ધેલી સાંઢ્ય રે

માવો ને જેસો નહીં મળે.

પછી માવો ને જેસો બંને નાવિકો ક્યાં ગયાં ? વહ્ણાણે ચડચા ? ગાનારી બહેનો એ ભાગ નથી ગતી. પણ મારી કને વહેલાંનું એક ગીત આવ્યું છે (તે પણ ખંડિત હતું) તે અને આ બંનેની કઠીઓ મેળવતાં આખી કથા સંકળાય છે :

માવા, હોડ કરીને બા'ર નીસયા,  
માવા, ચાલ્યા છે નકળંક ગામ રે  
માવો ને જેસો નહીં મળે.

બંને ભાઈબંધો દરિયામાં નકળંક મહાદેવનું થાનક છે, તેને મેળે જવા નીકળ્યા.  
હોડ બાંધી બેઉઅ, કે આ વેળા તો ભાઈ, નકળંક મહાદેવનું નાળિયેર ને સોપારી આપણે  
લઈ લેવાં છે.

માવા, નકળંક જઈને વિચાર કર્યા  
માવા, લેતું છે લીલું નાળિયેર રે  
માવો ને જેસો નહીં મળે

નકળંક મહાદેવનો વાર્ષિક મેળો ભરાય છે. મહાદેવનું લિગ સમુદ્રની અંદર છે. હોડ  
એવી રીતની રમાય છે કે ભરતીનાં પાણી જ્યારે મહાદેવના થાનક ઉપર ફરી વળ્યાં હોય  
છે તે વેળા ત્યાં જઈને મહાદેવની પાસે પડેલ શ્રીફળ-સોપારી જે હથ કરી આવે તે સાચો  
મદ્દ. આ મર્દાઈની શરતમાં માવો ને જેસો બેઉ ઉત્તર્યા :

માવા, વેળિયું કાઢીને બેનને આપિયું,  
બેનને નયણે વદ્ધૂટ્યાં છે નીર રે  
માવો ને જેસો નહીં મળે

માવા વિચાર કરી બોકાનાં ભીડિયાં,  
પડિયા રતનાગર સાગર મોઝાર રે  
માવો ને જેસો નહીં મળે

કદાચ દૂબીયે જવાય એ ધારણાથી પોતાના કાનનું ઘરેણું વેળીયું કાઢીને માવાએ  
ત્યાં ઊભેલી બહેનને આપ્યું. બહેનની અંખમાં અંસુ આવ્યાં. માવો ને જેસો નકળંકને  
થાનકે જઈ પહોંચ્યા. સોપારી-શ્રીફળ હથ કર્યા. ત્યાં તો,

માવા, પાણી સમદરસું વળી રિયું,  
માવા, લેવાણા લોઢુની માંય રે  
માવો ને જેસો નહીં મળે

ઓટ આવી જવાથી સમુદ્રનાં જળ પાછાં વળી ગયાં તેના જોશમાં સપડાઈને આ  
સાહસિકો ઘસડાઈ ગયા.

વીરની બેન્યું તે વાટુ જોઈ રહી,  
ક્યારે આવે મારીજાયો વીર રે  
માવો ને જેસો નહીં મળે.

માવા, દીવીયું કરીને દરિયા જોઈ વળ્યા,  
માવા, જોયા રતનાગર લોઢ રે  
માવો ને જેસો નહીં મળે

રાત પડી ગઈ. અંધકારમાં મશાલો પેટાવીને દરિયો તપાસ્યો. પણ માવો ને જેસો હાથ ન આવ્યા. પછી તો -

માવા, તારી માચે લીધાં જંતર તુંબડાં,  
માવા, તારી બેને લીધો ભગવો ભેખ રે  
માવો ને જેસો નહીં મળે.

આમ વાતાવરણમાં કરુણાતા વધુ ને વધુ ઘૂંઠાતી જ ગઈ. પીઠ ફેરવીને બેઠેલી એ સ્ત્રીઓના મોં પરના ભાવ નહોતા કળપતા, પણ સૂનકાર પથરાયો હતો. ગીતના ઉદ્ગારો એવા સ્વયમેવ શોકકૂલ નીકળતા હતા (ભલે એમાં વૈવિધ્ય નહોતું). અને શિષ્ટ કે દુષ્ટ એવા કોઈ પણ બનાવટી ભેદની રેખા વિનાનો શુદ્ધ સંસ્કાર આ બહેનોના કંઠમાંથી ટપકતો હતો :

12

જાયબા, ટેશ આવોની! ઘણાં થૈ ગિયાં રે!  
તારા ચોકમાં ઢળાતું બાજોઠિયાં રે  
તારાં ચોળીને નવરાતું શરીર  
કાગળ લખો ઘારીના રે!

મારે ને રે પાંખું, ઊરી કેમ આતું રે,  
તારાં ભૂલાં રે પડી જ્યાં ભવન  
કાગળ લખો ઘારીના રે!

કોઈ તૃટેલ નાવનાં વેરણછેરણ પાટિયાં જેવાં ખંડિત આવાં ગીતો, ખંડિત છતાં પણ ગાનારીઓની અંતરતમ ઊર્મિઓની ઊંચી કક્ષા સૂચવતાં હતાં. અને પછી તો -

13

તારી સીસીમાં ભરિયલ તેલ,  
તેલ સીયા કામનાં રે!  
તેલનો નાખનારો પરદેશ,  
તેલ સીયા કામનાં રે.

તારી સીસીમાં ભરિયલ અંતર,  
અંતર નથી કામનાં રે,  
અંતરનો છાંટનારો પરદેશ,  
અંતર નથી કામનાં રે!

તારી છાબમાં ભરિયલ ઝૂલ રે  
સેજાંદ્યે સુકાઈ ગિયાં રે,  
રેજનો પોઢનારો પરદેશ  
સેજલડી સૂની પડી રે.

મારી લાલ રે પડોશજ બાઈ  
તમને કાઈ કી જિયા રે?  
મારે કાગળ ના'વેલા કોણ  
હરિવરના હાથના રે.

સખી, નાખી રે દીધાં રે નિરાધાર રે  
પિયુટ અમને પરહર્યા રે,  
આવ્યાં પીપેર નવેલાં પાંદ  
નગણગારો ના'વિયો રે.

મારી સગી રે નજાંદગીના વીર રે  
ઓરડીએ છઈં એકલાં રે,  
એવી જમરા અંધારી રાત  
નીંદર ના'વે એકલાં રે.

મારા હાથનો કરી ત્યું કાગળીયો  
આંગળની લેખણ કરું રે,  
મારાં આંસુડાંની કરી લિયું શાઈ  
લખીને કાગળ મોકલું રે.

સખી, નાયા રે ધોયા વન્યા નારી રે  
અંબોડો નવ વાળીએં રે,  
એવીયું લાંઘણ્યું પડે નવ લાખ  
માણસ કીંમ મેલીએં રે.

સખી, પાકી રે આંબા કેરી સાખ રે  
ઉપર સૂડા આટકે રે,  
એવીં સવ રે ઘોળે આંબા સાખ  
અમે તો ઘોળીએં વખડાં રે.

જના પિયુડા વસે પરદેશ રે  
નવીન ચીજ નવ ચાખીએં રે,  
ઇનાં નેજાલાંમાં વરસે નીર  
કાજળ નવ સારીએં રે.

સખી, સરવે માણસ સાથે પ્રીત્યું રે  
પાળે તો લઈ પાળીએં રે,  
એવાં નુગરાં માણસ સાથે નેહ  
ટાળે તો લઈ ટાળી દઈએં રે.

એ લાંબું ગીત પૂરું કરીને જ્યારે બાઈઓ સમુખ થઈ, ત્યારે તેઓની આંખો ભીની  
હતી. તેઓના મોં ઉપર દરિયાનાં મોજાં ફરી વળ્યાં હોય એવી ઝંખપ હતી. ગીતો શોધવાની

ଓલટમાં બીજું બધું ભાન ગુમાવીને મેં તો નવી ઉઘરાણી કરવા માંડી. મને એ બહેનોએ જવાબ દીધો : ‘ભાઈ, અમે આ ગીતો મહામુશકેલીથી ગાઈએ છીએ.’

‘કેમ?’

‘અમુંથી ગાઈ શકતાં નથી. આ અમે સાત જણીયું બેઠી છઈ તેમાંથી કોઈનો બાપ, કોઈનો બેટો, કોઈનો ધણી, અને કોઈના ઘરમાંથી એકસામટા છ-સાત જગ દરિયે દૂબીને મૂઝા છે; એ બધાંની વેદના અમને આ ગીતો ગાતાં ગાતાં તાજ થાય છે. અમારાં ગળાં રૂધાઈ રહેલ છે, ભાઈ! આ તો તમે ગીતો માંડી લેવા આવેલ છો એટલે અમારે દેડાં કઠજા કરીકરીને ગાવાં પડે છે, પણ અમે અંદરથી વલોવાઈ રહ્યાં છીએ.’

આ શબ્દોએ મને શરમિદો કરી મૂક્યો. શ્રી રામનારાયણ પાઠકનું એક વાક્ય મને સાંભરી આવ્યું. અમદાવાદમાં એક વાર લોકગીતોના મારા સંગ્રહકાર્ય સારુ એમજો પોતાના ચોગાનમાં ઠકરડા કોમની બહેનોને નોતરી હતી. એ બહેનો પોતાના કોઈ ઉત્સવ કે તહેવારની સ્વયંસ્કુરણાથી નહીં પણ એક-બે સાહિત્યકોને સંભળાવવાની સભાન મહેનતથી ગીતો સંભારીને ગાતી હતી.

“કોઈ સ્ત્રીની કનેથી આમ ગીતો કઢાવવાં!” પાઠકભાઈએ કહ્યું : “દીજ દીટ નોટ સમધિંગ લાઈક ડ્રોઇંગ હર નેકેડ?”

એ વાક્ય મારી છાતીએ ચોંટી ગયું છે : કલાકાર કુદરતી માનવ-સૌંદર્યને ચીતરવા માટે પોતાની સામે કોઈ જીવતી સ્ત્રીને નજનાવસ્થામાં ઊભી રાખે, એના જેવું જ શું હું નહોતો કરી રહ્યો? મારે જોઈતાં હતાં ગીતો : મારે આલેખવી હતી શબ્દ-છબી : તે સારુ, મારી કલાસિદ્ધિને સારુ આ નાવિક-પત્નીઓનાં હૈયાંઓને હું ખુલ્લાં કરી રહ્યો હતો!

તેઓનાં એ આંસુમાં મારાં પણ બે આંસુ મિલાવીને મેં નવાં બે-ત્રણ ગીતો કઢાવવાનો હક્ક રજૂ કર્યો : વિરહની વેદનાનું, પણ હળવું હળવું નૃત્યગીત ચાલ્યું :

14

કે દાડુડો ને પીધા હોય તો માનો, માણારાજ!

કાલ્ય અતારે ઉતારા ને કરતાં, માણારાજ!

આજ અતારે ઓટા ઓસરી સૂની, મારી રાધાનાર!

ઓહો ગોરી! મરધાનેણી!

દાડુડો ને પીધા હોય તો માનો, માણારાજ!

કાલ્ય અતારે દાતણિયાં ને કરતાં, માણારાજ!

આજ અતારે કણોરી કંબ સૂની મોરી, રાધાનાર!

ઓહો ગોરી! મરધાનેણી! - દાડુડો

કાલ્ય અતારે અંધોળ્યું ને કરતાં, માણારાજ!

આજ અતારે તંબાકુંડીયું સૂની મોરી, રાધાનાર!

ઓહો ગોરી! મરધાનેણી! - દાડુડો

એ રીતે ભોજનિયાં, મુખવાસિયાં ને પોઢણિયાં ગવાયાં, ગઈકાલ્યનું મિલનસૂખ અને આજની શૂન્યતા, બંને લાગણીઓ ઘૂંટાતી હતી. દારુએ વાળે નખોદના ચૂર પણ નીકળતા હતા :

15

અરધાનો સીસો આખ્યો છે  
ને મધરો દારુ મારો છે.

ઈને લાઙે લાઙે પાયો છે  
ને મધરો દારુ મારો છે.

મારા પગ કેરી કંબીયું છે. - ને મધરો  
ઈ દારુડામાં દૂલિયું છે. - ને મધરો

મારી કેડચ કેરો ઘાઘરો છે. - ને મધરો  
ઈ દારુડામાં દૂલ્યો છે. - ને મધરો

એમ દારુ પાછળ આખા અંગ ઉપરનાં ઘરાણાંલૂગડાં ફના થયાંનું ગાયું. અને થોડાં વર્ષો પર એક રાત્રિએ માલમ નદીના જળપ્રલયમાં મહુવાની હોનારત થઈ હતી તેની પણ નવી રચના સંભળાવી :

16

એવી રે'તી ગોઝારણ આવી રે  
નીંદરા શીની આવે!

આવી ભાડોડને ઝાંપે ભરાણી રે  
નીંદરા શીની આવે!

ઓલ્યા ભાટ્ટિયાનાં બકાલાં તણાણાં રે - નીંદરા૦  
ઓલ્યા ધોતા ધોબીડા તણાણા રે - નીંદરા૦  
ઈનાં છોકરાં ચીસું નાંખે રે - નીંદરા૦  
આવી ખારને દરવાજે ભરાણી રે - નીંદરા૦  
ઓલ્યા <sup>૧</sup>બુલાભાઈનો ઘાઙો તણાણો રે - નીંદરા૦  
ઈના ડબા તળાવમાં બૂડચા રે - નીંદરા૦  
ઓલ્યા <sup>૨</sup>ખરકનાં ખોરડાં તણાણાં રે - નીંદરા૦  
એનાં છોકરાં હાયું નાખે રે - નીંદરા૦  
આવી કતરપરને ખાળે ભરાણી રે - નીંદરા૦  
ઓલ્યા <sup>૩</sup>ગુલાભાઈનાં વાણો તણાણાં રે - નીંદરા૦  
ઈનો માલ તે <sup>૪</sup>વામી નાખ્યો રે - નીંદરા૦  
ઈનો માલ તે સૌંથે લાગ્યો રે - નીંદરા૦

<sup>1</sup> રેપારીઓનાં નામ. <sup>2</sup> ખરક જતના ખેડૂતો. <sup>3</sup> વહાણમાંથી કાઢી નાખ્યો. <sup>4</sup> તણાઈને કિનારે નીકળી ગયો.

મકાન ચણાવનાર ઘરધણીએ ભલાઈ કરીને આ બહેનોને મારા ગીત-સંઘરા સારુ રાતપાળી રોકી લીધી હતી. પણ એનો અર્થ એ થયો કે તેઓ રાતભર પેટ્રોમેક્સને અજવાળે ગળાં બેંચીને પછી વળતો આખો દહાડો ત્યાં ને ત્યાં મજૂરી કરે, ને સાંજરે કુલ છત્રીસ કલાકે પાછી ઘર ભેણી થાય. ‘ઈજ ઈટ નોટ લાઈક ડ્રોઇંગ હર નેકેડ!’ એ શ્રી રામનારાયણ પાઠકનો ઉદ્ગાર મારા મનને આધ્યાત્મ કરતો હતો. “ના, ના, ના,” મારાથી ન રહેવાયું : “તમારાં બાળકોથી મારે તમને વિછોડી નથી રાખવાં.”

“પણ ભાઈ,” એ બહેનો બોલી ઉઠી : “અમમાંથી કોઈને નાનું ધાવણું છોકરું છે જ નહીં, ને અમે તો આમ ઘડી વાર રાત-પાળી કામે રોકાઈએ છીએ. તમે ફકર કરો મા.”

એક જણી દોડિને બીજાં કારખાનાંની બાઈઓ સાથે સાતેયને ઘેર સંદેશો મોકલી આવી. પોતાની ઝંખનાઓનો જીલનાર એક માનવી સામે બેઠો છે, અને આજ પહેલી જ વાર પોતાનાં અસ્પૃષ્ય ગીતો એક ભજોલા મુસાફરની ધોળી ધોળી નોટબુકમાં આસન પામી રહેલ છે, એ કૌતુક, એ માન, એ મહત્ત્વ આ સાત બાઈઓના પ્રાણમાં કોઈ અપૂર્વતાની લાગણી રોપી રહી હતી - ને તેઓએ છેલ્લું ગાયું આજા દિવસની આહ ઉપર શાંતિના શીતળ લેપ કરતું એક ધીરગંભીર માતૃબોલ સરખું ભજન :

17

દોરંગાં સાથે નવ બેસનાં એ જી!  
એ જી! પત્ય પોતાની જાય રે મન... લો! - દોરંગાં.

કુંડાં રે કપટી ને લોભી લાલચુ રે જી!  
એ જી! પારકે કુંખે ન દૂભાય રે મન... લો! - દોરંગાં.

ઘડીક રંગ ચરે ઘડીક ઊતરે એ જી!  
એ જી! ઘડીક વેરાગી બની જાય રે મન... લો! - દોરંગાં.

ઘડીક ગરુ ને ઘડીક ચેલકા રે જી!  
એ જી! ઘડીક પીર થૈ પુંજાય રે મન... લો! - દોરંગાં.

મીણાં બાઈ ભજે રે જિરધરલાલને જી!  
એ જી! દેજો સાધુ ચરણો વાસ રે મન... લો!  
- દોરંગાં સાથે નવ બેસનાં રે જી!

કંપરની ખાડીના કાદવમાંથી આવાં સુવાસિત પુષ્પો જડવાની આશા રાખી નહોતી. ‘મન લો...! દોરંગાં સાથે નવ બેસનાં રે જી!’ એ શબ્દો દોરંગાઈના તાજેતરના અનુભવી હૈયાફૂટાને કાને માતાના મુખબોલ જેવા મીઠપભર્યા છંટતા હતા.

પરંતુ રાત્રિના દસ બજ્યાની એ વિદાય-ઘડીમાં એક વેદનાનું ટીપું પડી ગયું. ગાન્ધારી બાઈઓ પરસ્પર ઝીણી પૂછપરછ કરવા લાગી. એ વાતો પોતાનાં ઘેર રહેલાં બાળકો વિશેની હતી : “તેં બરાબર કહેવરાયું છે ને મારી માને, કે છોકરાને રાતમાં સરખું ઓઢાડે?”

મેં પૂછ્યું : “તમે તો કહેતી હતી ને, બાઈઓ, કે તમારે છોકરાં નથી!”

“પણ ભાઈ, આ તો મોટાં છોકરાં છે, ને એને સાચવનાર અમારી મા, સાસુ, ગંધાંય છે ઘેરે.”

આ ખુલાસો મન પર પડેલા ઓછાયાને દૂર ન કરી શક્યો. વાળું કરવા જયા પછી મારાથી પાછા ન વળાયું. થાકેલું મન ધર્મશાળાની પથારી પર અંધારે પડ્યું પડ્યું ડાઢ્યા મિત્રનો એ જ મુખોચ્ચાર સંભારતું હતું : “ઇજ ઇટ નોટ લાઈક રોઝિગ થિમ ન્યૂડ?” એ ગાનારીઓનાં હૃદય ત્યાં દોડી રહ્યાં છે – કંપર ગામના ફૂલામાં, ઉઘાડાં ને અધભૂષ્યાં સૂતેલ બાળકોની પાસે; ને હું એનાં જીવનની રેખાઓ દોરવા માટે એનાં કલેજાં પરનાં વિરસૂતિ-ફાંકણો ખેંચી ખેંચી નજન વેદના-દેહ નિહાળતો હતો! ‘રોઝિગ થિમ નેકેડ ઇન્ડીડ!

રાતના સાડા ત્રણ વાગ્યે જ્યારે સેશન પર જતો હતો ત્યારે નવી ચણપાયેલ એ દુકાનોમાં પેટ્રોમેક્સ બળતી હતી : સાથીએ કહ્યું : “ભાઈ, ગાનારીઓ આંહીં સૂતી હશે – ફાટલતૂટલ ગુણપાટમાં ટૂટિયાં વાળીને.”

અંતર્યામીએ ઊમેર્યું : ‘– ને એ સાતેય કલેવરોનાં અંતઃકરણો દોડી રહ્યાં હશે અત્યારે કંપરના ફૂલાઓની અંદર : ઉઘાડાં છૈયાંને ફાંકવા સાસુ.’

## મા!

સાગરનાં ભવ્ય સૌંદર્ય ભાખતી કવિતાઓ થોડીધણી વાંચી છે : થોડીક લખી પણ છે પરંતુ જેના જોધાર દીકરા અને ધણીઓ પેટને ખાતર એ કાળને ખોળે પોતાનાં પીંજર સોંપીને એક દિન અચાનક તળિયે જઈ બેઠા છે, તેવી આ માતાઓ અને પત્નીઓનાં અસહાય, રૂંધાયેલાં આંસુને દીઠા પછી એ કાબ્ય-લહરીઓ સરી પડે છે; ઓસરી જાય છે એ -

જલધિ-જલ દલ ઉપર દામિની દમકતી  
દામિની વ્યોમ સર માંહી સરતી

જેવી 'કાન્ત'ના 'સાગર-શશી'ની કેફચક્કયૂર કલ્યનાઓ : દિલમાંથી ઊતરી જાય છે એ -

સાગર સખે મુજ કાનમાં એવું કંઈ તો ગા!  
જવવું મીઠ લાગે મને એવું કંઈ તો ગા!

એવાં ન્હાનાલાલ કવિનાં ગરવાં સાગર-સંબોધનોનો નશો; જલકતી ઉપમાઓથી ભરપૂર એ દેશબંધુનું 'સાગર-સંગીત' અને

માલા ગુંથી ગુંથી લાવે સાગર રાણો  
કૂલડાં ગુંથી ગુંથી લાવે;  
ધરતીને હૈયે પે'રાવે સાગર રાણો  
કૂલડાં ગુંથી ગુંથી લાવે.

એવાં મારાંય થોડાંક નખરાળ રુપકો અત્યારે કેવળ કલ્યના-ખેલ-શા ભાસે છે. ધરતી પર સલામત પગ ઠેરવીને ઊભેલા સુખી સાહિત્યકારોએ જ સાગરના સુનીલ રંગોને, ગગન-ગેલતા જલ-તરંગોને, લાખ લાખ શાર્દુલો-શા ઘૂઘવત્તા ભરતી-ઓટોને કે ચંદ આલિગવા ઊછળતી મસ્ત લહરીઓને કેંકેં લાડીલી ગાથાઓમાં ઉતારી રમાડેલ છે. પણ સાચું જીવન-કાબ્ય એમાં નથી સંભળપતું. સાચા સ્વરો તો જીતે છે એ શાયર, કે જેણે જગતનાં કરોડો ખલાસી બાળકોની ફુફડતી જનેતાને હૈયે કાન માંડ્યા હશે.

'ધ મધર હૂ હોથ એ ચાઈલ્ડ એટ સી' : જેનું બાળક દરિયા ખેડી રહ્યું છે એવી કોઈ મા :

એની આંખો જ્યારે એકાએક કોઈ અજવાળી રાત્રિએ ઘેરતી વાદળીઓના વૃદ્ધમાં ગૌર ગૌર ચંદ્રને ગ્રહાતો જોતી હશે, ત્યારે પ્રિયતમાઓની અલક-લટો સાથે ગેલતો કોઈ આશક નહીં, પણ કાળના કફનમાં જીવતો લપેટાઈ રહેલ કોઈ રંડિરાડ માતાનો ખોટ્યનો બેટો દેખાતો હશે એને ગગનનો ચાંદલો. ઈશ્વરની કરોડો આંખોની ઉપમા પામેલા તારાઓને એ નાવિક-જનેતાની નયન-કીકીઓ એક પછી એક કોઈ કાળગત્તમાં દફનાતા પુત્રો સમા પેખતી હશે; પૃથ્વીના આરામ-દેટા શાયરને કાને પ્રભુમહિમાનું મહાગ્યાન સંભળાવતો આ વિરાટ ભજનિક વારિધિ કેવો લાગતો હશે એ મધરાતનાં જાગરણ ખેચનાર વૃદ્ધ ખારવણને? વિષ ફૂંકાડતા કાળા ઝેબાળ ફૂંકીધર જેવો. સિંધુ-સંગીતની એ તાલબદ્ધ ખંજરીમાંથી કૃયા બે કાનને છાતીઝાટ મરણિયાનાં ધૂસકાં સંભળતાં હશે! કોની હશે એ ફાટી રહેલી આંખ!

‘ધોટ આઈ! ધેટ ઈઅર! ઓહ, હૂંડ કેન ધે બી; બટ એ મધર્સ હૂ હેથ એ ચાઈલ એટ સી?’

એ આંખ : એ કાન : ઓહ, અન્યે કોનાં હોય એ? સાગર-ખેપે ગયેલા બેટાની માતનાં.]

*There's an eye that looks on the swelling cloud;  
Folding the moon in a funeral shroud;  
That watches the stars dying one by one;  
Till the whole of heaven's calm light hath gone.  
There's an ear that lists to the hissing surge,  
As the mourner turns to the anthem dirge.  
That eye! that ear! oh whose can they be,  
But a mother's who hath a child at sea?*

ગળતી જતી માર્ગમ રાતને પહોરે એક પછી એક ચડતાં તોફાન-ચિહ્નો કો' કરચલિયાળા બે ગાલોને રૂની પૂછીઓ-શા ડિક્કા, રક્તશૂન્ય બનાવી રહેલ હશે. રત્નાકરને માથે કાળ-તાંડવની જમાવટ કરતા ઘન અંધારને એકીટશે પેખી રહેલ એક જર્જરિત કલેવર પોતાના કૂબાની બારીએ ઊભું ઊભું થીજુ ગયું હશે. છલાંગી છલાંગીને, ત્રાડ પર ત્રાડ દઈ દઈ કિનારાની ભેખડો માથે થપાટો મારતા ગડહડ જળ-લોઢને ગણતી બે નયન-મીટ સમુદ્ર પર મંડાઈ રહી હશે. કોના હશે એ ગાલ! કોનું એ કલેવર! કોની એ મીટ! હા! હા! બીજા કોની હોય એ? જેનો જાયો દરિયે ગયેલ હશે તેવી કો' જનેતાની જ તો.

*There's a cheek that is getting ashy white,  
As the tokens of storm come on with night.*

*There's a form that's fixed at the lattice pane,  
To mark how the gloom gathers over the main.  
While the goasty billows lash the shore,  
With loftier sweep and hoarser roar.  
That cheek! that form! oh whose can they be,  
But a mother's who hath a child at sea?*

3

ઘેલાંતૂર સાગર-નીરને ફટકાવવા ધર્સનાર ઓતરાદા વાવડાની સૂસવાટીઓ એ વૃદ્ધાના લોહીને થિજાવી દેતી હશે. વીજળીની પહેલવહેલી લોહીવરણી રેખાઓને ભાળતાં જ એના કલેજમાં ઠંડો હીમ થરથરાટ મચતો હશે. બદખદ ઉકળતા સમદર-ચુની સામે મોં ફાડતી અને જોરથી આંગળાં ભીડતી એ નિઃસ્તબ્ધ ઊભી રહે છે. ઓહ ભાઈ! એના આ ગભરાટથી તમે ચકિત થતા ના. કારણ કે - 'શી ઈજ એ મધર હૂ હેથ એ ચાઈલ્ડ એટ સી' : દરિયે સફર ખેડતા દૂધમલ પુત્રની એ માવડી છે.

*The rushing whistle chills her blood,  
As the North Wind hurries to scourge the flood  
And the icy shiver spreads to her heart,  
As the first red lines of lightning start.  
The ocean boils! all mute she stands,  
With parted lips and tight-clasped hands.  
Oh! marvel not at her fear, for she  
Is a mother who hath a child at sea.*

4

એની કલ્યનામાં ખડું થાય છે એ ભીજણ દરય : ડાચાં ફાડતાં મોજાં વચ્ચે ઓરાયેલું એકાકી વહાણ : ખંડ ખંડ થઈ ભાંગેલો એનો કૂવાથંભ, અને ખડકો પર પછડાટા ખાતું એનું તળિયું; ઊંચકાઈ ઊંચકાઈને વહાણ પછડાય છે : જાણે પાતાલ-ગર્તે ઊતરતું જાય છે : એવા કો' વહાણને માથે ઊભો હશે મારો એકનો એક છૈયો - માથાબોળ મોજાંના માર જીલતો, ધામસ ઉલેચતો, અને આખરે 'હે અલ્લા! હે અલ્લા!' એવી હતાશાની ચીસ નાખીને દૂબતા વહાણને ચોંટી પડતો - ઓહ, પાગલ કરી મૂકનાર એ કલ્યના છે. નથી, બીજી એવી એકેય હાય નથી જગતમાં - દરિયો ખેડતા છૈયાની માતૃ-છાતીમાંથી ઊઠે છે તેવી.

*She Conjures up the fearful scene  
Of yawning waves, where the ship between,*

*With striking keel and splintered mast  
Is plunging hard and foundered fast.  
She sees her boy with lank drenched hair,  
Clinging on to the wreck with a cry of despair,  
Oh the vision is maddening: no grief can be  
Like a mother's who hath a child at sea.*

5

એ માર્વડીનું માથું ચક્કર ફરે છે. લમણાં દબાવીને એ પગ ઠેરવવા મથે છે, નમે છે, ને જ્યારે વાવડો હું હું હું બોલે છે, ગગન કડકડે છે, ત્યારે એ એકાકી મા હૈયે હથ જોડીને ઘૂંટણિયે પડે છે. ‘અલ્તા! અલ્તા! અલ્તા!’ એ બંદગીના સૂર એના હૈયામાં જ ગુંજે છે, હોઠે નથી આવતા. એના હોઠ ન ઝીલી શકે તેવી ઊંડી ને આહભરી એ પ્રાર્થના છે. એ પ્રાર્થના તો ઠલવાય છે માતાના હરએક દિલવલોવજા નિઃચાસમાં, અને એની ગગને મંડાયેલી ઓંખોના ઝૂરતા દસ્તિપાતમાં. નથી, જગતમાં નથી કો એવી પુનિત આહુતિ કે જે દરિયે પળેલા દીકરાની માતૃ-પ્રાર્થનાની તોલે આવે.

*She presses her brow; she sinks and kneels,  
While the blast howls on and the thunder peals.  
She breathes not a word; for her her passionate prayer  
Is too fervent and deep for the lips to bear.  
It is poured in the long convulsive sigh,  
In the straining glance of an upturned eye;  
And a holier offering cannot be,  
Than the mother's prayer for her child at sea.*

6

અહા! દિગ્યુપાલોની લગામો તોડાવીને વધૂટતા જંખાવતો મારા બંધનવિરોધી પ્રાણને બહુ બહુ ભાવે છે. ગરુડની સૂસવતી જલદ પાંખો જેવા એના વેગ-ઝંકાર પર હું હિંદુ છું. પરંતુ હવે પછી તો એ પવન-હુંકારાનો વિચાર કરતાં જ મારા અંતરમાં એક વેદના જાગરો. મારા નિર્બધ પ્રાણની મસ્તી પોચી પડશે, મારો હર્ષોન્યાદ ઊંડાણો ઉત્તરશે કારણ કે મને સાંભરી આવશે એ વંટોળ-ધ્વનિ થકી ભરનીંદરે ફફડી ઊઠતી એક માતા, જેનો બેટડો દરિયાની ખેપે પણ્યો હશે.

*Oh! I love the winds when they spurn control,  
For they suit my own bond-hating soul;  
I like to hear them sweeping past,*

*Like the eagle's pinions, free and fast.  
But a pang will rise with sad alloy  
To soften my spirit and sink my joy  
When I think how dismal their voice must be  
To a mother who hath a child at sea.*

*Eliza Cook*

---